

॥ॐ श्री संतराम लक्ष्मणदेव ॥

# તंदुरस्ती तमारां हाथमां

संपूर्ण तंदुरस्ती माटेना घरगाथ्यु उपाय



### : प्रकाशक :

ब्रह्मलीन अष्टम महंत प.पू. श्री नारायणादासજु महाराजश्री प्रेरीत  
अने वर्तमान महंत प.पू. श्री रामदासजु महाराजश्रीनां शुभाखिर्वाद सह

SHREE SANTRAM BHAKTA SAMAJ, U.S.A.

P. O. Box 32155

Newark, New Jersey 07102

Phone : (732) 906 - 0792 Fax : (908) 486 - 6082

Website: [www.santram.org](http://www.santram.org)

# તंदुरस्ती तमारां हाथमां

संपूर्ण तंदुरस्ती माटेना घरगाथ्यु उपाय

- સौજन्य :** ચિ. સોહમ, ચિ. મીરા, અ.સૌ. સ્વાતીબેન અને  
ભદ્રાક્ષકુમાર પી. પટેલ પરિવાર  
California, U.S.A.
- પ્રકાશન :** સંતરામ મહાપૂર્ણિમા સત્સંગ નં. ૫૨  
એપ્રિલ ૩, ૨૦૧૦  
મહાપૂર્ણિમા સંવત ૨૦૬૬
- પ્રકાશક :** શ્રી સંતરામ ભક્ત સમાજ, ચુ.એસ.એ.  
P.O. Box 32155 Newark, New Jersey 07102  
Phone : (732) 906 - 0792 Fax : (908) 486 - 6082  
Website: [www.santram.org](http://www.santram.org)
- મુદ્રક :** વિમલ ગ્રાફિક્સ, નડીઅદ



॥ શ્રી સંતરામ મહારાજ સત્ય છે ॥

યોગિરાજ અવધૂત  
શ્રી સંતરામ મહારાજની  
દિવ્ય અખંડ જ્યોતિના શુભાખ્રિંગ

આપણું વર્તમાન જીવન પૂર્વ-પદ્ધિમના શિક્ષણ, સંસ્કાર,  
રહનસહનના આદાન પ્રદાને, એના મિશ્રાણને કારણે દૂષિત બન્યું છે.  
આજે માનવ શારીરિક, માનસિક રોગોથી પીડાય છે, એનામાં સુખ,  
શાંતિ, સંતોષ દેખાતા નથી. એના આહાર-વિહાર વિપરીત બન્યા છે.  
આપણે ત્યાં સાદા, સાત્ત્વિક ભોજનની મહત્ત્વા, કુદરતને અનુકૂળ  
રહીને દિનચર્યા કરવી, યુક્તાહાર વિહારને લીધે રોગો દૂર રહેતા.

“અનુકૂળ, શુદ્ધ સાત્ત્વિક ભોજનથી નિર્મળ જળ અને સ્વચ્છ  
પવિત્ર વાયુ-સેવનથી, સ્વચ્છ હવાવાળા ધરમાં નિવાસથી, બળ અને  
પૌરુષને હાનિ ન પહોંચે તેવી દિનચર્યાથી, શારીરિક બળ અને  
પરોક્ષમ વધારનાર વ્યાયામથી, શાંતિમય પવિત્રજીવન વ્યતીત કરવાથી,  
ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું મૂળ સ્વાસ્થ્ય અને દીર્ଘજીવન હતું.”

પ્રકૃતિના હિતકારી નિયમોથી વિપરીત જીવનનો ત્યાગ, મનમ  
પ્રસન્નતા, દરરોજ નિયમિત વ્યાયામ, નિયમિત ભોજન, હળવું ભોજન  
તો રોગ કયારેય થશે નહીં.

શ્રી સંતરામ ભક્ત અ.સૌ. સ્વાતીબેન અને શ્રી ભદ્રાક્ષકુમાર પટેલ,  
પરિવાર (California) નાં સહયોગથી “તંદુરસ્તી તમારા હાથમાં”  
પુસ્તકનું પુનઃ પ્રકાશન થઈ રહ્યું છે, ત્યારે શ્રી સંતરામ ભક્ત સમાજ,  
ચુ.એસ.એ.નાં સર્વે ભક્તજનો માટે આ પુસ્તક આશિશ્વરિદ્રૂપ બની રહેશે.

પ. પુ. શ્રી સંતરામ મહારાજના શુભાખ્રિંગ સદાય તેમના સમગ્ર  
પરિવાર ઉપર વરસતા રહે એવી શુભ ભાવના....

સહુનું શુભ અને મંગલ થાઓ....

સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા: ।  
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્યિત દુ:ખ ભાગ ભવેત ॥

રામદાસ મહારાજ

મહંત : શ્રી સંતરામ મંદિર, નડીઅદ  
મહાપૂર્ણિમા - ૨૦૬૬  
જાન્યુઆરી ૩૦, ૨૦૧૦

## : અનુકમણિકા :

અ.નં.	વિગત
પેજ નં.	
(૧) કબજિયાત .....	૧
(૨) કમરનો દુઃખાવો – સંધિવા .....	૨
(૩) કમળો .....	૪
(૪) કાકડા .....	૫
(૫) કાનની પીડા .....	૫
(૬) કોલેરા .....	૬
(૭) કરમ (કરમિયા – ઝૂભિ) .....	૭
(૮) કષ .....	૭
(૯) ગૂમડાં .....	૮
(૧૦) ખીલ .....	૮
(૧૧) ખરજવું, ખસ, ખુજલી, દરાજ .....	૯
(૧૨) ગળું .....	૧૧
(૧૩) ઘા – જખમ .....	૧૨
(૧૪) દાગયા ઉપર .....	૧૩
(૧૫) નશો ઉતારવો .....	૧૪
(૧૬) જીવજંતુના કંખ .....	૧૫
(૧૭) શીળસ .....	૧૬
(૧૮) કૂતરં કરડે ત્યારે .....	૧૭
(૧૯) શીતળા .....	૧૭
(૨૦) તાવ .....	૧૮
(૨૧) હરસ – મસા .....	૨૦
(૨૨) દમ – શ્યાસ .....	૨૧
(૨૩) દાહ – બળતરા .....	૨૨
(૨૪) ક્ષય .....	૨૩
(૨૫) દાંતની પીડા .....	૨૪
(૨૬) નસકોરી .....	૨૫
(૨૭) પેટનાં દર્દો .....	૨૬
(૨૮) પેશાબ .....	૨૮
(૨૯) પથરી .....	૩૧
(૩૦) બાળરોગો .....	૩૨
(૩૧) શરદી .....	૩૪
(૩૨) સોજો – મૂઠમાર .....	૩૬
(૩૩) સ્ત્રીરોગો .....	૩૭
(૩૪) અનિદ્રા – ઊંઘ ન આવવી .....	૪૦

## : અનુકમણિકા :

અ.નં.	વિગત
પેજ નં.	
(૩૫) હેડકી .....	૪૦
(૩૬) ડાયાબિટીઝ (મધુપ્રમેહ) ની દવા .....	૪૧
(૩૭) દવા કેવી રીતે ઉપયોગમાં લેવી .....	૪૨
(૩૮) રતવા .....	૪૩
(૩૯) આંખની પીડા .....	૪૩
(૪૦) એસિડિટી .....	૪૬
(૪૧) અશક્તિ – નબળાઈ .....	૪૭
(૪૨) અજીર્ણ – ભૂખ ન લાગવી .....	૪૮
(૪૩) આધાશીશી – માથાનો દુખાવો .....	૪૯
(૪૪) અંગ જકડાઈ જવું .....	૫૦
(૪૫) હૃદયની બીમારી-બલદ પ્રેશર .....	૫૧
(૪૬) ઉધરસ – ખાંસી .....	૫૨
(૪૭) ચક્કર આવવા .....	૫૩
(૪૮) ઝાડા – મરડો .....	૫૩
(૪૯) વાળની માવજત .....	૫૪
(૫૦) લકવો .....	૫૬
(૫૧) ચામડીના રોગો .....	૫૬
(૫૨) ઉલટી .....	૫૮
(૫૩) મધ અને તજનાં મિશ્રણથી અનેક રોગો મટે છે .....	૫૯
❖ આર્થરાઈટીસ .....	૬૦
(શરીરના દુઃખાવા માટે) .....	૬૦
થી શરીરનું રક્ષણ .....	૬૩
❖ માથાના વાળ ખરવા .....	૬૦
બ્લેડરનાં સોજા અને ચેપ માટે .....	૬૧
દંતનો દુઃખાવો .....	૬૧
કોલસ્ટેરોલનો ઘટાડો .....	૬૧
શરદી .....	૬૧
સ્ત્રી બીજની ફળદ્રુપતા માટે .....	૬૨
પેટનાં દુખાવા માટે .....	૬૨
હૃદયરોગવાળા દર્દીઓ માટે .....	૬૨
❖ ચેપી જીવાણુંઓ (બેકટેરીયા) .....	૬૩
❖ અપચો .....	૬૩
❖ ઈન્જ્લુએન્જા .....	૬૩
❖ લાંબી ઉંમર .....	૬૪
❖ મોં ઉપરની ખીલ (પોંપલ) .....	૬૪
❖ ચામડીનાં વિકાર ઉપર .....	૬૪
❖ વજન ઘટાડો .....	૬૪
❖ કેન્સર .....	૬૫
❖ શરીરને થાક લાગવો .....	૬૫
(૫૪) અન્ય ઉપચારો .....	૬૬
(૫૫) ગૌમાતા રોગ-દોષનિવારિણી .....	૭૦
(૫૬) શરીર સ્વાસ્થ્ય અત્યંત ગુણકારી કોળું .....	૭૨
(૫૮) કોળાનો ઔષધ પ્રયોગ .....	૭૩
(૫૯) વિવિધ રોગોથી બચાવ .....	૭૪

# તંદુરસ્તી તમારાં હાથમાં

## સંપૂર્ણ તંદુરસ્તી માટેના ઘરગથ્યુ ઉપાય

### કબજિયાત

- \* અજમો અને સોનામુખીનું ચૂર્ઝ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.
- \* પાકાં રામેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજિયાત મટે છે.
- \* નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે.
- \* રાત્રે સહેજ ગરમ કરેલાં પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજિયાત મટે છે.
- \* લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજિયાત મટે છે.
- \* ખજૂર રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળીને આ પાણી પીવાથી કબજિયાત મટે છે.
- \* ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ ને બે ચમચી મધ મેળવી પીવાથી કબજિયાત મટે છે.
- \* કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી, સવારે દ્રાક્ષને મસળી, ગાળી તે પીવાથી કબજિયાત મટે છે.
- \* રાત્રે સૂતી વખતે એકાદ-બે સંતરા ખાવાથી કબજિયાત મટે છે.
- \* ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ઝ સવાર-સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.
- \* ચાર ગ્રામ હરરે અને એક ગ્રામ તજ સો ગ્રામ પાણીમાં ગરમ કરી તેનો ઉકાળો રાત્રે અથવા સવારના પહોરમાં પીવાથી કબજિયાત મટે છે.
- \* રોજ સવારે એક જ્વાસ ઠંડા પાણીમાં અને રાત્રે દૂધમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજિયાત મટે છે.
- \* અજમાના ચૂર્ઝમાં સંચોરો (સંચર) નાખી ફાકવાથી કબજિયાત મટે છે.
- \* તુલસીના ઉકાળામાં સિંધવ અને સૂંઠ મેળવી ફાકવાથી કબજિયાત મટે છે.

- \* જાયફળ લીંબુના રસમાં ઘસીને તેનો ઘસારો લેવાથી કબજિયાત મટે છે.
- \* જમ્બા પછી એકાદ કલાકે ત્રણથી પાંચ છિમેજ ખૂબ ચાવીને ખાવાથી કબજિયાત મટે છે.
- \* કાંદાને ગરમ રાખમાં શેકી, રોજ સવારે ખાવાથી કબજિયાત મટે છે અને શક્તિ વધે છે.
- \* કબજિયાત હોય અને ભૂખ ઓછી લાગતી હોય તો સૂંઠ, પીપર, જીરું સીધાલૂણ, કાળાં મરી સરખે ભાગે લઈ વાટી, બારીક ચૂર્ઝ બનાવી, બે ગ્રામ દરરોજ જમ્બા પછી લેવાથી કબજિયાત મટે છે.
- \* દૂધ અથવા નવશેકા પાણી સાથે ચપટી વરિયાળી રોજ ફાકવાથી કબજિયાત મટે છે.

### કમરનો દુખાવો - સંધિવા

- \* અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર-સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે.
- \* સૂંઠ અને ગોખરણ સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે.
- \* સૂંઠનું ચૂર્ઝ ગરમ પાણી સાથે ફાકવાથી કમરનો દુખાવો મટે છે.
- \* ખજૂરની પાંચ પેશીનો ઉકાળો કરી, તેમાં અર્ધો તોલો મેથી નાખી પીવાથી કમરનો દુખાવો મટે છે.
- \* સૂંઠ, લસણ, અજમો અને રાઈ નાખીને તેલ ગરમ કરી, તેની માલિસ કરવાથી કમરના દુખાવામાં તેમજ દુખતા સાંધામાં આરામ થાય છે.
- \* સૂંઠ અને હિંગ નાખીને તેલ ગરમ કરી તેનું માલિસ કરવાથી કમરનો દુખાવો તથા શરીર જકડાઈ ગયેલું હોય તો તે મટે છે. સાંધાનો દુખાવો પણ મટે છે.
- \* રાઈના રસમાં સહેજ મીઠું નાખીને તેનું માલિસ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે.
- \* આદુના રસમાં સહેજ મીઠું નાખી તેની માલિસ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે, તોકી રહી ગઈ હોય તો તે પણ મટે છે.
- \* જાયફળને સરસિયાના તેલમાં ઘસી માલિસ કરવાથી જકડાયેલા સાંધા ધૂટા પડે છે અને સંધિવા મટે છે.

## **તંદુરસ્તી તમારાં હાથમાં**

- \* લવિંગનું તેલ ઘસવાથી સંધિવાનો દુખાવો મટે છે.
- \* ધારણા ૧૦ ગ્રામ અને સૂંઠ ગ્રામ ગ્રામ લઈ વાટી, તેનો ઉકાળો બનાવી, તેમાં મધ્ય નાખી પીવાથી પડખાનો દુખાવો તથા છાતીનો દુખાવો મટે છે.
- \* સૂંઠ, સાજુખાર અને હિંગનું ચૂર્ઝ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારનાં શૂળ મટે છે.
- \* જરૂર, હિંગ અને સિંધવની ફાકી ધી સાથે લેવાથી શૂળ મટે છે.
- \* એક ચમચી શેકેલી હિંગ થોડા ગરમ પાણીમાં પીવાથી પડખાનો દુખાવો મટે છે.
- \* સૂંઠનો ઉકાળો કરી, તેમાં એક ચમચી દિવેલ નાખીને પીવાથી સંધિવાનો દુખાવો મટે છે.
- \* દોઢ બે તોલા મેથી રોજ ફાકવાથી વા મટે છે.
- \* કોઈપણ પ્રકારનાં શૂળ-પડખાં, છાતી, હદય કે માથામાં દુખાવો હોય ત્યારે તુલસીનો રસ ગરમ કરી તેના પર માલિસ કરવાથી તરત આરામ થાય છે. આવા પ્રસંગે બે ચમચી તુલસીનો રસ પી જવો.
- \* મેથીને થોડા ધીમાં શેકી તેનો લોટ કરવો, તેમાં ગોળ, ધી ઉમેરીને લાદુ બનાવી લેવા. આ લાદુ ૮-૧૦ દિવસ સુધી ખાવાથી કમરનો દુખાવો અને સંધિવા મટે છે. જકડાઈ ગયેલાં અંગો છૂટાં પડે છે અને હાથ-પગે થતી કળતર પણ મટે છે.
- \* કાચા બટાટાની છાલ કાઢ્યા વગર ટુકડા કરી તેનો રસ કાઢી તુરતજ પીવાથી સંધિવામાં ઘણો ફાયદો થાય છે.
- \* તાંબાના વાસણમાં આખી રાત રાખેલું પાણી સવારે નરણે કોઠે પીવાથી સંધિવામાં ફાયદો થાય છે.
- \* દરિયાના પાણીમાં નિયમિત સ્નાન કરવાથી સંધિવા દર્દીને ખૂબ જ ફાયદો થાય છે. દરિયાના પાણીમાં સ્નાન કરવાનું શક્ય ન હોય તો દરિયાઈ મીઠું ગરમ પાણીમાં ઓગાળી તેનાથી સ્નાન કરવું.
- \* કૈચાના બીજ ૧ કિલો લઈ સાંજે પાણીમાં પલાળો, સવારે તેનાં ફોતરાં ઉખાડીને તેનો ગર્ભ કાઢી તે ગર્ભ તડકામાં સૂક્ષ્મી દો. સૂક્ષ્માયા બાદ તેનું ચૂર્ઝ બનાવી ત્રણ ગ્રામ ચૂર્ઝ સાથે ૧ ગ્રામ અશ્વગંધાનું ચૂર્ઝ મેળવી રોજ સવારે

## **તંદુરસ્તી તમારાં હાથમાં**

- અને રાત્રે જ્યા પહેલાં ગરમ દૂધ સાથે લેવાથી સંધિવા તથા લકવાના રોગીને ફાયદો થાય છે.
- \* સૂંઠનો કંગો બનાવીને પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
- \* સાંધાના દુખાવામાં કેરોસીન જરા ગરમ કરી માલિસ કરો.

## **કમળો**

- \* મધ્ય સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.
- \* મધ્યમાં પાકાં કેળા ખાવાથી કમળો મટે છે.
- \* આદુનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
- \* સૂંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
- \* સફેદ કાંદો, ગોળ અને થોડી હળદર મેળવી સવાર-સાંજ ખાવાથી કમળો મટે છે.
- \* હળદરનું ચૂર્ઝ એક તોલો, ચાર તોલા જેટલા દહીમાં લેવાથી કમળો મટે છે.
- \* હળદરનું ચૂર્ઝ તાજ છાશમાં નાખીને સવાર-સાંજ પીવાથી કમળો અઠવાડિયામાં મટે છે.
- \* શેરીને ઝાકળમાં રાખીને સવારે તેને ચૂસીને ખાવાથી કમળો મટે છે.
- \* લીબુની ચીરી ઉપર સોડા-બાય-કાર્બ નાખીને સવારના પહોરમાં ચૂસવાથી કમળો મટે છે.
- \* ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દહીમાં ૨ થી ૪ ગ્રામ પાપડખાર મેળવીને વહેલી સવારે નરણે કોઠે લેવાથી ઉ દિવસમાં કમળો મટે છે.
- \* ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલી અશક્તિ ને લોહીની ઓછપ દૂર થાય છે.
- \* કરિયાતું બે ચમચી અને સાકર દોઢ ચમચી ફાકવાથી કમળો મટે છે.
- \* લીમડાનાં પાનનો રસ તથા મધ્ય સવારના નરણે કોઠે પીવાથી કમળો મટે છે.
- \* હિંગને પાણીમાં ઘસીને આંખમાં લગાડવાથી કમળો મટે છે.
- \* કમળામાં ખૂબ ન લાગતી હોય તો, બે ચમચી આદુનો રસ, અડધી ચમચી ત્રિફળાચૂર્ઝ સાથે દિવસમાં બે વાર લેવાથી ખૂબ લાગશે.
- \* અરીઠાનું પાણી નાકમાં નાખવાથી કમળો મટે છે.

## કાકડા

- \* સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળીને દિવસમાં બે-ત્રાણ વાર કોગળા કરવાથી કાકડાની પીડા મટે છે.
- \* હળદરને મધમાં મેળવી કાકડા ઉપર લગાડવાથી વધેલા કાકડા બેસી જાય છે.
- \* પાણીમાં મધ નાંખી કોગળા કરવાથી વધેલા કાકડા બેસી જાય છે.
- \* હળદર અને ખાંડ એક એક ચમચી લઈ ફાકી મારી, તેના ઉપર ગરમ દૂધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે.
- \* કેળાની છાલ ગળા ઉપર (બહાર) બાંધવાથી કાકડા હોય તો મટે છે.
- \* કાકડા વધા હોય કે ડિફ્યુશનીયા થયો હોય તો નાની પીંછી વડે ગળામાં કેરોસીન લગાડવું, કેરોસીન લગાડતાં પહેલાં ને પછી છાશનો ખખડાવીને કોગળો કરવો.

## કાનની પીડા

- \* તેલમાં લસણાની કળી કકળાવીને, તે તેલનાં ટીપા કાનમાં નાખવાથી કાનના સણકા અને કાનની રસી મટે છે.
- \* આદુનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી સણકા મટે છે.
- \* મધનાં ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને રસી મટે છે.
- \* તલના તેલમાં હિંગ નાખી, ઉકાળી, તે તેલનાં ટીપાં કાનમાં નાખવાથી દુખાવો મટે છે.
- \* તુલસીના રસનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને સણકા મટે છે અને પરુ નીકળતું હોય તો તે બંધ થાય છે.
- \* કાંદાનો રસ અને મધ મેળવી તેનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને સણકા મટે છે અને પરુ નીકળતું હોય તો તે બંધ થાય છે.
- \* નાગરવેલનાં પાનનો રસ ગરમ કરી તેના ટીપાં નાખવાથી કાનના સણકા અને દુખાવો મટે છે.
- \* આંબાના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાથી કાનના સણકા અને દુખાવો મટે છે.
- \* કુલાવેલી ફટકડી અને હળદર ભેગી કરી કાનમાં નાખવાથી કાન પાક્યો હોય અને રસી નીકળતી હોય તો તે મટે છે.
- \* વરિયાળી અધક્યરી વાટીને પાણીમાં ખૂબ ઉકાળો. તે પાણીની વરાળ દુખતા

- કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનનું શૂળ અને કાનમાં થતો અવાજ મટે છે.
- \* તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા ઉપર લેપ કરવાથી સોજો મટે છે.
- \* કાનમાં કોઈ જીવજંતુ ભરાઈ ગયું હોય તો સરસિયાના તેલનાં ટીપાં નાખવાથી તે મરી જાય છે.
- \* સફેદ કાંદાના રસનાં ટીપાં રોજ બે વખત કાનમાં નાખવાથી બહેરાશ મટે છે.
- \* કાનમાં બગાઈ, કાનખજૂરો જેવા જીવજંતુ ગયાં હોય તો મધ અને તેલ ભેગાં કરી કાનમાં ટીપાં નાખવાથી ફાયદો થાય છે. કાનનું શૂળ અને રસી પણ મટે છે.
- \* કાન દુખતો હોય તો મૂળાના પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી દુખાવો અને સણકો મટે છે.
- \* કાનની બહેરાશ દૂર કરવા પેશાબનાં પાંચ-સાત ટીપાં દરરોજ નાખતા રહેવાથી બહેરાશ દૂર થાય છે.

## કોલેરા

- \* લવિંગના તેલનાં બે-ત્રાણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી કોલેરા મટે છે.
- \* લીંબુનો અને કાંદાનો રસ મેળવીને પીવાથી કોલેરા મટે છે.
- \* ફૂદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે.
- \* જાયફળનું એક તોલો ચૂર્ણ ગોળમાં મેળવી નાના નાની ગોળીઓ કરી, તેમાંથી એક એક ગોળી અર્ધા અર્ધા કલાકે લેવાથી અને ઉપર થોડું ગરમ પાણી પીવાથી કોલેરા મટે છે.
- \* હિંગ, કપૂર અને આંબાની ગોટલી સરખે ભાગે લઈ ફૂદીનાના રસમાં ખૂંટી, ચાશા જેવદી ગોળીઓ બનાવી લેવાથી કોલેરા મટે છે.
- \* કાંદાના રસમાં ચપરી હિંગ મેળવીને અર્ધા કલાકે લેવાથી કોલેરા મટે છે.
- \* પાણીમાં લવિંગ નાખી ઉકાળીને તે પાણી પીવાથી, કોલેરામાં થતી તરસ મટે છે.
- \* જાયફળનો ઉકાળો પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.
- \* કાંદામાં કપૂર ખાવાથી કોલેરા મટે છે.
- \* કોલેરા થયો હોય તો ઘાસલેટને ગરમ કરી પેટ તથા પીઠ ઉપર ઘસવાથી ફાયદો થાય છે.

## કરમ (કરમિયા-કુમિ)

- \* થોડા ગરમ પાણીમાં સોપારીનો ભૂકો દિવસમાં ત્રણ-ચાર વાર લેવાથી કરમ મટે છે.
- \* તુલસીનાં પાનનો રસ પીવાથી કરમ મટી જાય છે.
- \* ઝૂદીનાનો રસ પીવાથી કરમ મટે છે.
- \* રોજ લસણ ખાવાથી કરમ મટે છે.
- \* સુંઠ અને વાવડિંગનું ચૂર્ઝ મધમાં લેવાથી કરમ મટે છે.
- \* કંદાનો રસ પીવાથી કરમ મટે છે.
- \* સવારના પહોરમાં પાણીમાં અર્ધો તોલો મીઠું ઓળાળી, પીવાથી કરમ મટે છે.
- \* ટામેટોના રસમાં ડિગનો વધાર કરીને પીવાથી કરમ મટે છે.
- \* કારેલાનાં પાનનો રસ સહેજ ગરમ કરી પાણી સાથે પીવાથી કરમ મટે છે.
- \* ઊ (પા) ચમચી અજમા સાથે એક ચમચી આદુનો રસ સવારે અને સાંજે લેવાથી કરમ મટે છે.
- \* અનાનસ અથવા સંતરા ખાવાથી કરમ મટે છે.
- \* એક મુઢી ચણા રાત્રે સરકામાં પલાળી રાખી સવારે નરણો કોઠે ચણા ખાવાથી કરમ મટે છે.

## કફ

- \* કંદાનો ઉકળો પીવાથી કફ મટે છે.
- \* અર્ધો તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે.
- \* તુલસીનો રસ ઉ ગ્રામ, આદુનો રસ ઉ ગ્રામ અને એક ચમચી મધ લેવાથી કફ મટે છે.
- \* એલચી, સિંધવ, ઘી અને મધ ભેગા કરીને ચાટવાથી કફ મટે છે.
- \* દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ધૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે.
- \* આદુનો રસ, લીબુનો રસ અને સિંધવ મેળવી, જમતાં પહેલાં લેવાથી શાસ અને ઉધરસ મટે છે.
- \* રાત્રે સૂતી વખતે ત્રણ-ચાર તોલા શેકેલા ચણા ખાઈ, ઉપર પાશેર પાણી પીવાથી શાસનળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.

## ગ્રમડા

- \* ગ્રમડાં ઉપર માખજા લગાડીને, રૂનો પાટો બાંધી રાખવાથી ગ્રમડું ફૂટી જાય છે.
- \* બાફેલાં કંદામાં મીઠું નાખી પોટીસ બનાવી ગ્રમડા પર બાંધવાથી ગ્રમડું ફૂટી જશે.
- \* ઘઉંના લોટમાં હળદર અને મીઠું નાખી પોટીસ બનાવી ગ્રમડા પર બાંધવાથી ગ્રમડું પાકીને ફૂટી જશે.
- \* સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગ્રમડું બેસી જશે.
- \* કંદાની કાતરીને ઘી અથવા તેલમાં શેકી, તેમાં હળદર મેળવી, પોટીસ કરી બાંધવાથી ગ્રમડું પાકી જશે.
- \* પાલખ અથવા તાંદળજાનાં પાનની પોટીસ બનાવી ગ્રમડા પર બાંધવાથી ગ્રમડું પાકી જશે.
- \* બોરડીના પાન વાટી, ગરમ કરી, પોટીસ બનાવી ગ્રમડાં પર બાંધવાથી ગ્રમડું પાકીને ફૂટી જશે.
- \* લસણ અને મરી વાટી લેપ કરવાથી ગાંઠ, ગ્રમડાં પાકીને ફૂટી જશે.
- \* ગાજરને બાઝી તેની પોટીસ કરીને બાંધવાથી ગ્રમડાં મટી જશે.
- \* હળદરની રાખ અને ચૂનો ભેગો કરી લેપ કરવાથી ગ્રમડું ફૂટી જશે.
- \* દરરોજ સવારે લીમડાનાં પાનનો રસ પીવાથી પેટ સાફ આવે છે અને ગ્રમડાં થતાં નથી ને થયેલાં હોય તો તે મટી જાય છે.
- \* બી કાઢી નાખેલ કાળી દ્રાક્ષમાં થોડું પાણી નાખી, વાટી, મલમ બનાવીને કપડાની પઢી બનાવી ગ્રમડા ઉપર મૂડી પાટો બાંધવાથી ગ્રમડું ફૂટી જાય છે.

## ખીલ

- \* મૂળાના પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.
- \* જાંબુના ઠળિયાનો રસ પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
- \* દૂધની મલાઈ સાથે મીઠળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
- \* જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
- \* નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે.

## **તંદુરસ્તી તમારાં હાથમાં**

- \* લીલા નાળયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક પાણીમાં મોં ધોવાથી ખીલ મટે છે.
- \* છાશ વડે મોં ધોવાથી ખીલના ડાઘા, મોં પરની કાળાશ દૂર થાય છે.
- \* રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં મોહું ધોવું, પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સૂઈ જવું. સવારે સાખુથી મોં ધોવું, આ પ્રયોગથી ખીલ મટે છે.
- \* નાળયેરનું દૂધ કાળીજરી સાથે મેળવી-લસોટી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
- \* કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ ઉપર દરરોજ થોડા દિવસ લગાડવાથી ખીલ કાયમ માટે જરૂરીથી મટે છે.
- \* ખૂબ પાકી ગયેલા પપૈયાને છોલીને, છુંદીને તેની માલિસ મોઢા પર કરવી, પંદર-વીસ મિનિટ પછી તે સૂકાઈ જાય ત્યારે પાણીથી ધોઈ નાખવું ને જડા ટુવાલ વડે મોઢાને સારી રીતે લૂછીને તરત કોપરેલ લગાડવું. એક અઠવાડિયા સુધી આ રીતે કરવાથી મોઢા પરના ખીલના ડાઘ મટે છે. મોઢાની કરચલીઓ અને કાળાશ મટે છે.
- \* તુલસીના પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી, મોઢા પર લગાડવાથી અને સૂકાઈ જાય પછી પાણીથી ધોઈ નાખવાથી મોઢા પરના કાળા ડાઘ મટે છે.
- \* પાકાં ટામેટોને કાપીને તેની ચીર ખીલ પર ધીરે ધીરે લગાડીને થોડી વાર સુકાવા દો. ત્યારબાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે.
- \* ગરમ પાણીમાં રૂમાલનો ટુકડો ભીજવીને, નિયોવી તેને મોઢા પર સાધારણ ગરમ હોય ત્યારે મૂકવાથી ખીલ મટે છે.
- \* લોબાન, સુખડ અને આમળાંનો પાઉડર મોંડા ઉપર ચોપડીને થોડું સુકાયા બાદ, લીમડાનાં પાન નાખેલા પાણી વડે ધોવાથી ખીલ મટે છે.
- \* કાચી સોપારી અથવા જાયફળ પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે.

## **ખરજવું, ખસ, ખુજલી, દરાજ**

- \* ગ્રાણ દિવસનો વાસી પેશાબ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે. (ગ્રાણ બાટલી રાખી રોજ એક બાટલીમાં પેશાબ ભરતા રહેવું.)

## **તંદુરસ્તી તમારાં હાથમાં**

- \* ગાજરને વાટી તેમાં થોડું મીહું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.
- \* ખારેક અથવા ખજૂરના ઠણિયાને બાળી તેની રાખ કપૂર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
- \* કળી ચુનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીજવી ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.
- \* તાંદળજની ભાજના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે.
- \* કાંદાનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.
- \* બટાટા બાઝી તેના કટકા કરી, સહન થાય તેવા ગરમ ગરમ, બાંધવાથી ખરજવું મટે છે.
- \* પપૈયાનું દૂધ અને ટંકણખારને ઉકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખરજવું, ખસ મટે છે.
- \* જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખુજલી મટે છે.
- \* કોપરું ખાવાથી અને કોપરું બારીક વાટી શરીરે ચોપડવાથી ખંજવાળ મટે છે.
- \* ટામેટાના રસમાં તેનાથી બમણું કોપરેલ મેળવીને શરીર પર માલિસ કરી, અર્ધા કલાક પછી સ્નાન કરવાથી ખુજલી મટે છે.
- \* આમળાં બાળી, તલના તેલમાં મેળવી, ચોપડવાથી ખસ મટે છે.
- \* ચાશાનો લોટ પાણીમાં મેળવી શરીરે માલિસ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે.
- \* રાઈને રાઈને દહીમાં ધૂંટીને તેમાં સહેજ પાણી નાખી દરાજ પર ચોપડવાથી દરાજ મટે છે.
- \* દહીમાં એળિયો વાટીને ચોપડવાથી દરાજ મટે છે.
- \* તુવેરનાં પાન બાળી દહીમાં ચોપડવાથી ખસ મટે છે.
- \* આખા શરીરે ખુજલી આવતી હોય તો સરસિયાના તેલની માલિસ કરવાથી ખુજલી મટે છે.
- \* કોપરેલ અને લીંબુનો રસ મેળવી શરીર પર માલિસ કરવાથી ખુજલી, દાદર મટે છે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- \* ખંજવાળ આવતી હોય તો તુલસીનાં પાનનો રસ ઘસવાથી મટે છે.
- \* મધ્યમ કદનું ખેતરમાં થતું બટાણું બાઝી, તેની પોટીસ કરી રાતે ખરજવા પર મૂકી પાટો બાંધી સવારે છોડી નાખવો. આ રીતે ૧૦ માસ સુધી કરવાથી જૂનું હઠીલું સુકું ખરજવું મટે છે.
- \* દાદર-ખરજવા ઉપર ઘસલેટમાં ગંધક મેળવીને લગાડવાથી મટે છે.
- \* કુંવારીયાના બીજને ખાટી ધાશમાં અથવા લીંબુના રસમાં વાટી, મલમ જેવું બનાવીને દાદર ઉપર લગાડવાથી દાદર મટે છે. કડવા લીમડાનાં કુણાં પાનને પાણીમાં ઉકાળી, પાણી સાધારણ ઠંડુ થાય ત્યારે પાણીથી દાદરવાળો ભાગ ધોઈને દિવસમાં ત્રણ ચાર વાર મલમ લગાડવાથી દાદર મટે છે.
- \* ખરજવા ઉપર ગાયના છાણનો પાટો બાંધવાથી ખરજવું મટે છે.

## ગાળું

- \* ગળું આવી ગયું હોય તો સરકાના કોગળા કરવાથી મટે છે.
- \* પાન ખાવાથી મોહું આવી ગયું હોય તો મોંઢામાં લવિંગ રાખવાથી મટે છે.
- \* મધ્ય સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોંની ચાંદી અને ગળાની બળતરા મટે છે.
- \* ટેકણખારને પાણીમાં ઓગળી કોગળા કરવાથી મોંની ચાંદી તથા જીબની ચાંદી મટે છે.
- \* બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંની ચાંદી મટે છે.
- \* ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીથી કોગળા કરવાથી મટે છે.
- \* ગરમ પાણીમાં છિંગ નાખી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે.
- \* ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.
- \* પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખૂલશે.
- \* રાતે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખૂલશે.
- \* બોરડીની છાલનો કકડો ચૂસવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખૂલશે.
- \* દ્રાક્ષને સારી પેટે લસોટી ધી, મધ્ય મેળવી ચાટણ બનાવી જીબ ઉપર ચોપડવાથી જીબ ઉપર કાતરા પડી ગયા હોય તો મટશે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- \* લવિંગને જરા શેકી, મોંમાં રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે.
- \* ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ધી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે.
- \* સાકરની ગાંગડી મોંમા રાખી ચૂસવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે.
- \* લસણને ખૂબ લસોટી, મલમ જેવું કરી, કપડા પર લગાડી, પછી બનાવી કંઠમાળ જેવી ગળાની ગાંઠ પર લગાડવાથી ગળાની ગાંઠ મટે છે.
- \* કંઠમાળ પર જવના લોટમાં કોથમરીનો રસ મેળવીને રોજ લગાડવાથી કંઠમાળ મટે છે.
- \* કાંદાનું કચુંબર જીરું અને સિંધવ નાખી ખાવાથી ગળું સાફ રહે છે. કફની બરેરી બાંજતી નથી.
- \* તાજી મોળી ધાશ પીવાથી મોંના ચાંદા મટે છે.
- \* તુલસીના પાન ચાવવાથી તથા તુલસીનાં પાનના ઉકાળાના કોગળા કરવાથી મોંની દુર્ગધ મટે છે.
- \* કોથમીર ચાવી ચાવીને ચૂસવાથી ગળાનો કોઈપણ દુખાવો મટે છે.

## ધા-જ્યખ

- \* લાગેલા ધા, વાઢ કે કાપ ઉપર તાજો પેશાબ લગાડવાથી જલદી રૂઝ આવે છે અને પાકતું નથી.
- \* ધા માંથી લોહી નીકળતું હોય તો સરકો લગાડવાથી બંધ થાય છે.
- \* ધા કે જ્યખમાંથી લોહી નીકળતું હોય તો તેના પર મીઠાના પાણીમાં ભીજવેલો પાટો બાંધવાથી જ્યખ પાકતો નથી અને રૂઝ આવે છે.
- \* તલના તેલનું પોતું મૂકી પાટો બાંધવાથી જ્યખ રૂઝાય છે.
- \* વાગેલા ધા પર હળદર દબાવી દેવાથી ધા માંથી નીકળતું લોહી બંધ થાય છે અને ધા પાકતો નથી.
- \* હળદરને તેલમાં કકડાવીને તે તેલ ધા-જ્યખ પર ચોપડવાથી ન રૂઝાતા ધા જલદી રૂઝાઈ જાય છે.
- \* તલ પીસી તેમાં ધી અને મધ્ય મેળવી ધા પર ચોપડી પાટો બાંધવાથી ધા જલદી રૂઝાઈ જાય છે.
- \* હુલાવેલી ફટકીનો પાઉડર ધા પર નાખી પાટો બાંધવાથી ધામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ધા પાકતો નથી.

## **તંદુરસ્તી તમારાં હાથમાં**

- \* તુલસીના પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે.
- \* હિંગ અને લીમડાના પાન વાટી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મરી જાય છે અને ઘા રૂઝાઈ જાય છે.
- \* રાઈના લોટને ધી-મધમાં મેળવી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મરી જાય છે અને ઘા રૂઝાઈ જાય છે.
- \* ગાજરને કચરી કોઈપણ લોટમાં મેળવીને ફોલ્લા તથા બળતરાવાળા ઘા પર બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે.
- \* તાજા ઘા ઉપર જેઠીમધમાં મધ મેળવી રૂ લગાવી ભરી દેવાથી જલદી રૂજ આવે છે.

## **દાજ્યા ઉપર**

- \* દાઢેલા ઘા પર કકડાવેલું તેલ ચોપડવાથી ખૂબ ફાયદો થાય છે.
- \* દાઢેલા ઘા પર તરત જ કોપરેલ અથવા બટાટો કાપી ઘસવાથી ફોલ્લો થશે નહિં.
- \* દાઢેલા ઘા ઉપર તાંદળજાનો રસ ચોપડવાથી આરામ થાય છે.
- \* દાઢેલા ઘા પર મેંદીનાં પાનને વાટી, પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે.
- \* દાઢેલા ઘા પર ખૂબ પાક કેળાને બરાબર મસળી, ચોંટાડી, પાટો બાંધવાથી તરત જ શાંતિ થાય છે અને આરામ થાય છે.
- \* દાઢેલા ઘા પર તુલસીનો રસ અને કોપરેલ ઉકળીને ચોપડવાથી દાઢેલાની બળતરા મટે છે. ફોલ્લા અને જખમ જડપથી રૂઝાઈ જાય છે.
- \* ગરમ પાણી કે વરણથી દાઢી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી ખૂબ આરામ થાય છે.
- \* દાઢેલા ઘા પર ઈડાની સફેદી લગાડવાથી ઘા રૂઝાઈ જાય છે અને ડાઘ રહેતો નથી.
- \* જખમ, ઘા, ગૂમડાં, ચાંદા, શીતળા જેમાં બહુ બળતરા થતી હોય તો તેમાં ચોખાનો બારીક લોટ પાઉડરની જેમ ચાંદા પર લગાડવાથી દાહ, બળતરાં મટે છે.
- \* દાઢેલા ઘા પર છુંદેલો કાંદો તરત લગાડવાથી તાત્કાલિક આરામ થાય છે.

## **તંદુરસ્તી તમારાં હાથમાં**

- \* રાઈના લોટને ધી-મધમાં મેળવીને કાંટો કે કાચ વાગ્યો હોય તેના પર લેપ કરવાથી કાંટો કે કાચ બહાર આવી જાય છે.
- \* દાજ્યા ઉપર ફોલ્લા પડ્યા પહેલાં કાચું બટાટું લઈ પત્થર પર લસોટી તેનો લેપ લગાવી દેવો. આનાથી દાજ્યાની વેદના ને બળતરા શમી જાય છે, ફોલ્લા થતા નથી ને ડાઘા પડતા નથી. દિવસમાં ત્રણ ચાર વખત આ લેપ કરવો.
- \* વડનાં પાનને ગાયના ધીમાં વાટીને બજેલા ભાગ ઉપર તેનો લેપ કરવાથી તરત બળતરા મટે છે.
- \* દાજ્યા ઉપર કેરોસીન લગાડવાથી ઘણી શાંતિ થાય છે તથા જલદી રૂજ આવે છે.
- \* દાજ્યાના ફોલ્લા ઉપર પ્રથમ છાશ રેડવી અથવા ઠંડુ પાણી રેડવું.
- \* કુંવારાપાઠની છાલ કાઢીને ઘાટો રસ દાજ્યા ઉપર લગાડતા રહેવો આનાથી બળતરા ઓછી થાય છે અને જલદી રૂજ આવે છે.
- \* ચણાના લોટનું પાતળું દ્રાવણ દાજ્યા ઉપર સારું કામ કરે છે.

## **નશો ઉતારવો**

- \* બે-ચાર જમરૂખ ખાવાથી ભાંગનો નશો ઉતરે છે.
- \* આમલીને પાણીમાં પલાણી, મસળી, ગાળીને પીવાથી ભાંગનો નશો ઉતરે છે.
- \* છાશ પીવાથી ભાંગનો નશો ઉતરે છે.
- \* કાનમાં સરસિયાના તેલનાં ટીપા નાખવાથી ભાંગનો નશો ઉતરે છે.
- \* સિંધવ મીહું ને સૂંઠ વાટી તેમાં લીંબુનો રસ મેળવી ચાટવાથી ભાંગનો નશો ઉતરે છે.
- \* ખજૂરને પાણીમાં પલાણી, મસળીને પીવાથી દારુનો નશો ઉતરે છે.
- \* કાકડી ખાવાથી અથવા કાકડીને કાંદાનો રસ પીવાથી દારુનો નશો ઉતરે છે.
- \* એક રૂપીયાભાર જેટલી ફિટકડી પાણીમાં ઓગાળી પીવાથી દારુ પીને લથરીયાં ખાતા બેભાન બનેલો તરત ભાનમાં આવે છે અને નશો ઉતરે છે.
- \* ચાર રૂપીયાભાર જેટલો ગોળ દસ રૂપીયાભાર જેટલાં પાણીમાં ઓગાળી પીવાથી દારુ પીને ચક્કયૂર બનેલા ભાનમાં આવે છે ને નશો ઉતરે છે.
- \* મીઠાવાળું પાણી પીવાથી નશો ઉતરે છે.

## જીવજંતુના કંખ

- \* મધમાખીના ડંખ ઉપર મીહું ચોપડવાથી પીડા મટે છે.
- \* મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા જીંછી કરેલી તમાકુ ચોપડવાથી પીડા મટે છે.
- \* મધમાખીના ડંખ ઉપર સૂવા અને સિંધવ-મીહું પાણી સાથે વાટી ચોપડવાથી પીડા મટે છે.
- \* મધમાખીના ડંખ ઉપર મધ ચોપડવાથી અને મધ પીવાથી પીડા મટે છે.
- \* ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે.
- \* કાનખજૂરાના ડંખ ઉપર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઉત્તરી જીય છે.
- \* કાનખજૂરાના ડંખ ઉપર ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે.
- \* કાનખજૂરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજૂરો બહાર નીકળી જશે અને આરામ થશે.
- \* કાનખજૂરો, બગાઈ જેવાં જીવજંતુ કાનમાં ગયાં હોય તો મધ અને તેલ ભેગાં કરી કાનમાં નાખવાથી નીકળી જશે અને આરામ થશે.
- \* કોઈપણ ઝેરી જીવજંતુ કરડયું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને તે ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાખૂદ થાય છે.
- \* કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાનાં પાન વાટી ચોપડવાથી ડંખની પીડા અને સોજો ઉત્તરે છે અને ઝેરની અસર નાખૂદ થાય છે.
- \* કોઈપણ જીવજંતુના ડંખ ઉપર હળદર ઘસીને સહેજ ગરમ કરી ચોપડવાથી પીડા મટે છે.
- \* વીંછીનાં ડંખ ઉપર કાંદો કાપી બાંધવાથી વીંછીનું ઝેર ઉત્તરે છે.
- \* વીંછીનાં ડંખ ઉપર મધ ચોપડવાથી બળતરા ઓછી થાય છે ને ઝેર ઉત્તરે છે.
- \* વીંછી કરડયો હોય તો ફૂદીનાનો રસ પીવાથી કે ફૂદીનાના પાન ખાવાથી ઝેર ઉત્તરે છે.
- \* વીંછીના ડંખવાળો ભાગ મીઠાના પાણીથી વારંવાર ધોવાથી તથા સહેજ મીહું નાખેલા પાણીનાં ટીપાં બંને આંખોમાં નાંખવાથી ઝેર ઉત્તરે છે.
- \* તાંદળજાનો રસ સાકર સાથે પીવાથી વીંછી ઝેર ઉત્તરે છે.
- \* આમલીનો કચૂકો અથવા કચૂકા સફેદ થાય ત્યાં સુધી પાણીમાં ઘસી એ

- સફેદ થયેલો કચૂકો વીંછીના ડંખ પર ચોંટાડવાથી ઝેર શોખી લે છે, પોતાની મેળે ખરી પડે છે અને વીંછીનું ઝેર ઉત્તરે છે.
- \* વીંછી કરડયો હોય તો કેરોસીનમાં ફટકીનો ભૂકો નાખી ચોપડવાથી પીડા મટી જશે.
- \* કાચની શીશીમાં ૨૦ તોલા કેરોસીનમાં ૧ તોલો સરસિયું તેલ નાખીને તડકે મુકવું. કોઈપણ જીવજંતુના ડંખ ઉપર આ મિશ્રણ લગાડવું.
- \* વીંછીના દંશસ્થાન ઉપર મૂત્રનું માલિસ કરવાથી લાભ થાય છે.
- \* મચ્છરો કે કીડી-મંકોડાના ડંખ ઉપર લીંબુનો રસ ચોપડવાથી પીડા મટે છે.
- \* કીડી-મંકોડાના ડંખ ઉપર લસણનો રસ લગાડવાથી પીડા મટે છે.
- \* ગરોળી કરડે તો સરસિયું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર ઉત્તરે છે.
- \* મચ્છરના ડંખ ઉપર ચૂનો લગાડવાથી પીડા મટે છે.
- \* ઉદર કરડયો હોય તો ખોરું કોપરું મૂળાના રસમાં ઘસી ચોપડવાથી પીડા મટે છે.
- \* સાપ કરડે ત્યારે દસથી વીસ તોલા ચોખ્યું ધી પીવું પછી, પંદર મિનિટ પછી નવશેરું પાણી ધી શકાય એટલું પીવાથી ઉલટી થઈને ઝેર બહાર નીકળી જશે.
- \* વાંદરો કરડયો હોય તો ઘા ઉપર કાંદો અને મીહું પીસીને ચોપડવાથી આરામ થાય છે.
- \* સાપ કે વીંછી કરડયો હોય તો તેના ડંખ ઉપર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચી જેટલો રસ મધમાં મેળવી ચાટવાથી તરત રાહત થાય છે અને ઝેર ઉત્તરે છે.

## શીળસ

- \* કળથીની રાબ બનાવીને તેમાં ગોળ નાંખી પીવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
- \* રોજ સવારે નરણો કોઠે અજમો અને ગોળ ખાવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
- \* ૮ થી ૧૦ કોકમ ૧૦૦ ગ્રામ પાણીમાં ૨-૩ કલાક પલાળીને, તેમાં સાકર તથા થોડું જરૂન નાખી દિવસમાં ૨-૩ વાર પીવાથી, કોઈ દવાથી ન મટતું શીળસ મટે છે.

- \* ૧ ગ્રામ મરીનું ચૂર્ઝ ધી માં મેળવીને બે વાર ખાવાથી તથા શીળસ પર લેપ કરવાથી શીળસ મટે છે.
- \* ૧ ડોલ નવશેકા પાણીમાં ૧ થી ૨ ચમચી ખાવાનો સોડા (સોડા-બાય-કાર્બિ) નાખી તે પાણીથી જ્ઞાન કરવાથી શીળસ મટે છે.
- \* પાવલીભાર અજમો લઈ વાટી તેટલા જ ગોળ સાથે સવારે નરણો કોઠે ગળી જવો. જરૂર પડે તો રાત્રે સૂતી વખતે પણ આમ કરવું, આ પ્રયોગથી શીળસ મટે.

### કૂતરં કરડે ત્યારે

- \* કૂતરં કરડયું હોય તો તેના પર હિંગને પાણીમાં ઘુંઠીને ચોપડવાથી ફાયદો થાય છે.
- \* કૂતરં કરડયું હોય તો તેના પર લસણની કળીઓ પીસીને લેપ કરવાથી, લસણની ચટણીને પાણીમાં ઉકાળીને પીવાથી અને ખોરાકમાં લસણ વધારે ખાવાથી (સાત દિવસ સુધી આ પ્રમાણે કરવાથી) કૂતરાના જેરનો નાશ થાય છે.
- \* હડકાયું કૂતરં કરડયું હોય તો કાંદાના રસ અને મધ મેળવીને ઘા પર લગાડવાથી ઘા જલદી રૂઝાઈ જાય છે અને જેર નાશ પામે છે.

### શીતળા

- \* શીતળાનો રોગચાળો ચાલતો હોય ત્યારે આમલીનાં પાન અને હળદર ઠંડા પાણીમાં પીવાથી શીતળા નીકળવાનો ભય રહેતો નથી.
- \* હળદર અને કાથાનું બારીક ચૂર્ઝ શીતળાના જામી ગયેલા ઘા પર ભભરાવવાથી ફાયદો થાય છે.
- \* ઘાણા અને જીરુ રાત્રે પલાળી રાખી, સવારે મસળી ગાળી તેમાં સાકર નાખી ચાર-પાંચ દિવસ પીવાથી શીતળા પછીની શરીરમાં થયેલી ગરમી નીકળી જાય છે.
- \* શીતળા નીકળે ત્યારે ઘાણા પાણીમાં પલાળી રાખી, મસળી ગાળી તેના વડે અંખો ધોવાથી આંખોમાં શીતળા નીકળતા નથી.
- \* શીતળા નીકળે ત્યારે સોપારીનો બારીક ભૂકો પાણી સાથે પીવાથી શીતળાનું જેર સહેલાઈથી નીકળી જાય છે અને વેદના ઓછી થાય છે.

### તાંવ

- \* કોઈપણ જાતનો તાવ હોય તો બે આનીભર મીહું ગરમ પાણીમાં દિવસમાં ત્રણ વાર લેવાથી તાવ ઉતરી જાય છે અને તાવ ઉત્તર્યા પછી સવાર-સાંજ દોઢ આનીભર મીહું બે દિવસ લેવાથી તાવ પાછો આવતો નથી.
- \* કોઈપણ તાવ આવ્યો હોય તો ફૂદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે.
- \* સખત તાવમાં માથા પર ઠંડા પાણીનાં પોતા મૂકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચઢતી નથી.
- \* કોઝી બનાવતી વખતે તેમાં તુલસી અને ફૂદીનાનાં પાન નાખી ઉકાળી, નીચે ઉતારી, ૧૦ મિનિટ ઢાંકી રાખી પછી મધ નાખીને પીવાથી કોઈપણ જાતનો તાવ મટે છે.
- \* લસણની કળી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ કે ઘીમાં સાંતરીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે.
- \* તુલસી અને સુરજમુખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.
- \* ફૂલુના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જાય છે.
- \* તુલસીના પાન, અજમો અને સૂંઠનું ચૂર્ઝ સરખે ભાગે લઈ તેમાં મધ નાખી લેવાથી ફૂલુનો તાવ મટે છે.
- \* પાંચ ગ્રામ તજ, ચાર ગ્રામ સૂંઠ, એક ગ્રામ લવિંગનું ચૂર્ઝ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચૂર્ઝ, એક કપ ઉકળતા પાણીમાં નાખી ૧૫-૨૦ મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફૂલુનો તાવ તથા બેચેની મટે છે.
- \* ૧૦ ગ્રામ ઘાણા અને ત્રણ ગ્રામ સૂંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફૂલુનો તાવ મટે છે.
- \* એક ચમચી ગંઠીઠાનું ચૂર્ઝ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢિયો તાવ મટે છે.
- \* ફૂદીનાનો ને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.
- \* ગરમ કરેલા દૂધમાં હળદર કે મરી મેળવીને પીવાથી ટાઢિયો તાવ મટે છે.
- \* મરીનું ચૂર્ઝ તુલસીના રસ અને મધમાં પીવાથી ટાઢિયો તાવ મટે છે.

## **તંદુરસ્તી તમારાં હાથમાં**

- \* જીરું વાટીને ચાર ગણા પાણીમાં રાત્રે પલાળીને સવારે નયણો કોઠે પીવાથી ટાઢિયો તાવ મટે છે.
- \* ફૂટીનાનો તાજો રસ મધ્ય સાથે મેળવીને દર બે કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે.
- \* તુલસી, કાળાં મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મેલેરિયાનો તાવ મટે છે.
- \* તુલસીનો રસ ૧૦ ગ્રામ ને આદુનો રસ ૫ ગ્રામ મેળવીને પીવાથી મેલેરિયાનો તાવ મટે છે.
- \* ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઉતરે છે.
- \* મેલેરિયાના તાવમાં વારંવાર ઉલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાળા અને દ્રાક્ષ પાણીમાં પલાળી, મસળી, ગાળી થોડી થોડી વારે પીવાથી ઉલટી મટે છે.
- \* ફૂટીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.
- \* મઠ કે મઠની દાળનો સૂપ બનાવી પીવાથી રોજ આવતો તાવ મટે છે.
- \* એલચી નંગ ઉત્તા મરી નંગ ૪ રાત્રે પાણીમાં ભીજવી રાખી સવારે તે બરાબર ચોળીને પાણી ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ તાવ મટે છે.
- \* તુલસીનો રસ ૧૦ ગ્રામ ને મરીનું ચૂર્ણ ૫ ગ્રામ બે ચ્યામચી મધ્યમાં મેળવીને લેવાથી ટાઈફોઇનો તાવ મટે છે.
- \* વરિયાળી અને ધાળાનો ઉકાળો કરી સાકર નાખીને પીવાથી પિત્તનો તાવ મટે છે.
- \* શરદીને લીધે આવતા તાવમાં તુલસીનાં પાનનો રસ મધ્ય સાથે લેવાથી તાવ મટે છે.
- \* સંનિપાતના તાવમાં શારીર ઠંડુ પડી જાય ત્યારે ગરમી લાવવા માટે રાઈના તેલની માલિસ કરવાથી આરામ થાય છે.
- \* હિંગ અને કપૂરની સરખે ભાગે ગોળી બનાવી (હિંગવટીની ગોળી જે દવાવાળાને ત્યાં પણ મળે છે) એકથી બે ગોળી લઈ આદુના રસમાં પીવાથી સનેપાત(લવરી) નો તાવ મટે છે અને દર્દી ભાનમાં આવે છે.

## **તંદુરસ્તી તમારાં હાથમાં**

- \* ઈલૂના તાવમાં ઉત્તોળા પાણી સાથે ૧ લીંબુનો રસ દિવસમાં ચાર-પાંચ વાર પીવાથી ઈલૂનો તાવ ઉતરે છે.
- \* આદુ, લીંબુ અને તુલસીના રસ સાથે મધ્ય ઉમેરીને ઉપયોગ કરવાથી ઉધરસ, શરદી કે તાવ તેમજ સમગ્ર શરીરમાં થતું કણતર ઘટે છે.

## **હરસ-મસા**

- \* તલ વાટી માખણમાં ખાવાથી હરસ-મસા મટે છે.
- \* સૂર્યનું ચૂર્ણ ધાશમાં નાખીને પીવાથી હરસ-મસા મટે છે.
- \* સવારે નરણે કોઠે એક મુઠી જેટલા કણા તલ થોડી સાકર સાથે ખૂબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
- \* સૂકા હરસ થયા હોય તો ધાશમાં ગોળ નાખીને અને લોહી પડતા મસા હોય તો ધાશમાં ઈન્જરજવ નાખીને પીવાથી હરસ-મસા મટે છે.
- \* કેરીના ગોટલીનું ચૂર્ણ મધ્ય સાથે લેવાથી હરસ-મસા મટે છે.
- \* મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી, ગાળી, પીવાથી હરસ-મસા મટે છે.
- \* ઘી માં સુરણ તળીને ખાવાથી હરસ-મસા મટે છે.
- \* કણથીના લોટની પાતળી રાબ પીવાથી હરસ-મસા મટે છે.
- \* ધાળાને રાત્રે પલાળી રાખી, સવારે ખૂબ મસળીને તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
- \* એક ચ્યામચી કારેલાના રસમાં સાકર મેળવીને પીવાથી હરસ મસા મટે છે.
- \* ગરમા ગરમ સેકેલા ચણા ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
- \* કાંદાના નાના ટુકડા કરી તડકામાં સૂકવી, તેમાંથી એક રૂપિયાભાર જેટલા ઘીમાં તળી તેમાં થોડા તલ અને સાકરનું ચૂર્ણ નાખી સવારે ખાવાથી મસા મટે છે.
- \* કોથમીરને વાટી, ગરમ કરી, પોટલી બાંધી શેક કરવાથી મસાની પીડા મટે છે.
- \* જરાને વાટી, તેની લૂગદી કરીને બાંધવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે અને બહાર નીકળેલા અને ખૂબ હુખતા મસા અંદર જાય છે.
- \* ચોખ્ખી હળદરનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી પાણી સાથે રાત્રે સૂતી વખતે લેવાથી મસા મટે છે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- \* મસૂરની દાળ, રોટલી ને છાશ રોજ ખાવાથી તેમજ દાળમાં ધી અથવા માખણ નાખી ખાવાથી તેમજ મરચું અને ગરમાગરમ મસાલા વગરનું ખાવાથી દુઝતા મસા મટે છે.
- \* કોકમનાં ફૂલનું ચૂર્ણ દહીની મલાઈ સાથે મેળવી, જરાક ગરમ કરી દિવસમાં ત્રણ વાર ખાવાથી હરસમાંથી પડતું લોહી બંધ થાય છે.
- \* જુરાને શેકીને તેમાં સરખે ભાગે કાળાં મરી તથા સિંધવ મેળવીને ચૂર્ણ બનાવી જમ્યા પદ્ધી છાશ સાથે લેવાથી મસા મટે છે.
- \* સૂંઠ, જીરું અને સિંધવનું ચૂર્ણ દહીના મઠામાં મેળવી, જમ્યા પદ્ધી લેવાથી હરસ-મસા મટે છે.
- \* જુવારની કંણ રોજ સવારે પીવાથી હરસ-મસા મટે છે.
- \* ગરમ દૂધ સાથે ૧-૨ ચમચી દીવેલ પીવાથી હરસની પીડા મટે છે અને ગુદા પર થતા ચીરા પણ મટે છે.
- \* કોકમની ચટણી દહીની મલાઈ સાથે ખાવાથી દુઝતા હરસ મટે છે.
- \* હળદરનો ગાંઢિયો તુવેરની દાળમાં બાફી, છાંયડે સૂકવી, ગાયના ધીમાં પીસી, હરસ-મસા પર લેપ લગાડવાથી હરસ-મસા નરમ પડી તરત જ સણકા બંધ થાય છે.
- \* મસા ઉપર કેરોસીન ચોપડવાથી મસા સુકાઈ જાય છે.
- \* જંગલી સૂરણના નાના ટુકડા કરી, તડકે સૂકવી, તેને ખાંડી ચૂર્ણ બનાવીને ૧-૧ ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી હરસ મટે છે.
- \* ફીશર (ગુદા માર્ગમાં વાઢિયા) થયું હોય તો સવારનો પહેલો પેશાબ થોડો જવા દઈ, બાકીનો એક વાસણમાં લેવો. જેટલો પેશાબ હોય તેટલું પાણી ઉમેરી દિવસમાં ત્રણવાર પિચકારી વડે ગુદા માર્ગથી પેશાબ ચઢાવવો અને દશેક મિનિટ ઊંધા સૂઈ રહેવું. અઠવાડિયામાં ફીશર મટી જાય છે.

## દમ-શ્યાસ

- \* દમનો હુમલો થયો હોય તો એક પાંદું કેળું લઈ તેને દીવાની જ્યોત પર ગરમ કરી, પદ્ધી તેને છોલીને મરીનો ભૂકો ઉપર ભભરાવીને ખાવાથી આરામ થાય છે.
- \* ધી સાથે દળેલી હળદર ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી દમમાં આરામ થાય છે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- \* બે ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત થાય છે.
- \* રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જડમૂળથી મટે છે.
- \* હળદર, મરી અને અડદ એ ત્રણને અંગારા પર નાખી ધૂમાડો લેવાથી દમમાં તરત રાહત મળે છે.
- \* દસ-પંદર લવિંગ ચાવીને તેનો રસ ગળવાથી દમ મટે છે.
- \* એલચી, ખજૂર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી દમ મટે છે.
- \* દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ બહાર નીકળી જાય છે અને દમ મટે છે.
- \* બે-ગાળા સુંકા અંજલ સવારે ને રાત્રે દૂધમાં ગરમ કરી ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે અને દમ મટે છે.
- \* નાગરવેલના પાનમાં બે રતીભાર જેટલી ફુલાવેલી ફટકડી ખાવાથી દમ મટે છે.
- \* અજમો ગરમ પાણી સાથે લેવાથી શાસમાં રાહત થાય છે.
- \* પંદર-વીસ મરી વાટી મધ સાથે રોજ ચાટવાથી શાસ મટે છે.
- \* ગાજરના રસનાં ચાર-પાંચ ટીપાં નાકમાં નાખવાથી શાસ મટે છે.
- \* તુલસીનો રસ ત ગ્રામ, આદુનો રસ ત ગ્રામ એક ચમચી મધ સાથે લેવાથી શાસ મટે છે.
- \* હળદર અને સુંઠનું ચૂર્ણ મધ સાથે લેવાથી શાસ મટે છે.
- \* ફુલાવેલી ફટકડી અને સાકર સરખે ભાગે લઈ દિવસમાં ચાર વખત અર્ધો તોલો જેટલી ફાકવાથી શાસ મટે છે.
- \* આમળાના અઠી તોલા રસમાં એક તોલો મધ ઠી તોલો પીંપરનું ચૂર્ણ મેળવી લેવાથી શાસ મટે છે.

## દાહ-બળતરા

- \* મમરા અને ખડી સાકરનો ઉકાળો પીવાથી બળતરા મટે છે.
- \* દ્રાક્ષ અને ખડી સાકર ભેગી કરી સવારે ખાવાથી બળતરા મટે છે.
- \* ધાણા અને સાકર પાણીમાં લેવાથી બળતરા મટે છે.
- \* ધાણા અને જીરું એક એક ચમચી લઈ, અધકચરું ખાંડી, રાતે પાણીમાં પલાણી, સવારે મસળી, ગાળી, તેમાં સાકર નાખી પીવાથી પેટની તથા હાથપગની બળતરા મટે છે.

- \* ધાણાજરુંનું ચૂર્ઝ ખાંડ સાથે લેવાથી એસિડિટીને લીધે જમ્યા બાદ છાતીમાં થતી બળતરા મટે છે.
- \* એલચીને આમળાંના ચૂર્ઝ સાથે લેવાથી શરીરની બળતરા, પગનાં તળિયાને બળતરા મટે છે.
- \* એક ગલાસ પાણીમાં એક લીંબુનો રસ નાખી, તેમાં થોડી સાકર મેળવીને પીવાથી પિતનો દાહ મટે છે.
- \* સવારના પહોરમાં બે તોલા મધ ઠંડા પાણીમાં પીવાથી દાહ, બળતરા, ખંજવાળ મટે છે.

### કાચ

- \* સરેફ કાંદો ૧૨૫ ગ્રામ, એટલાજ ઘીમાં શેકીને એકવીસ દિવસ સુધી ખાવાથી ક્ષયરોગીનાં ખવાઈ ગયેલાં ફેફસાં મજબૂત થાય છે અને ફેફસાંનાં જંતુ નાશ પામી ક્ષયરોગ મટે છે.
- \* ક્ષયની કોઈપણ દવા કરાવી શકે એમ ન હોય તેમણે બકરીના ૨૦૦ ગ્રામ દૂધમાં થોડું મીઠું નાખી સવાર-સાંજ પીવાથી દર્દાનું બળ ટકી રહેશે, કષ સહેલાઈથી નીકળી જશે અને શરીર વધુ સુકાઈ જતું અટકશે.
- \* સાકરમાં એનાથી અર્ધા ભાગનું હળદર ચૂર્ઝ મેળવી તેમાંથી એક એક ચમચી ચૂર્ઝ મધમાં દિવસે ત્રણ વખત લેવાથી ક્ષયનો તાવ, ઉધરસ અને ક્ષયની શરદી મટે છે.
- \* ખજૂર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ બે-ત્રણ તોલા જેટલું ચાટણ ચાટવાથી ક્ષય, ક્ષયની ખાંસી અને શાસમાં ફાટદો થાય છે.
- \* તાજા માખણ સાથે મધ ખાવાથી ક્ષયમાં ઘણો ફાયદો થાય છે.
- \* અરદુસીનાં પાનનો રસ ૨૫ થી ૩૦ ગ્રામ, તેમાં લસણાના રસનાં ૧૦ થી ૨૦ ટીપાં નાખી રોજ સવાર-સાંજ પીવાથી ક્ષયરોગ મટે છે.
- \* લસણને વાટી, ગાયના દૂધ અને ઘી સાથે મેળવી રોજ ખાવાથી ક્ષયરોગ મટે છે.
- \* સાંજે એક ગલાસ દૂધમાં એક ખજૂર ભેળવી દો. રાત્રે દૂધને પુષ્કળ ઉકાળો. દૂધ ઠંકુપડે એટલે સૂતાં પહેલાં ખજૂર ચાવીને ખાઈ જાવ અને ઉપર દૂધ પીવો ઉપર મુજબ સવારમાં જ પ્રયોગ કરવાથી ક્ષયરોગમાં ખૂબજ ફાયદો થાય છે.

### દાંતની પીડા

- \* હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે.
- \* દાંત હાલતા હોય અને દુખાવો થતો હોય તો હિંગ અથવા અક્કલગરો દાંતમાં ભરાવવાથી આરામ થાય છે.
- \* સવારના પહોરમાં કાળા તલ ખૂબ ચાવીને, ખાઈને, ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે.
- \* વડની વડવાઈનું દાતણ કરવાથી હાલતા દાંત મજબૂત થાય છે.
- \* તલનું તેલ હથેળીમાં લઈ આંગળી વડે પેઢા પર ઘસવાથી હલતા દાંત મજબૂત બને છે.
- \* લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
- \* તલના તેલનો કોગળો મોઢામાં દસ-પંદર મિનિટ ભરી રાખવાથી પાયોરિયા મટે છે અને દાંત મજબૂત બને છે.
- \* સરસિયાના તેલ સાથે મીઠું મેળવીને દાંતે ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
- \* હુલાવેલી ફટકડીનો પાઉડર દાંતના પેઢા પર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
- \* દાંતનું પેઢું સુજી ગયું હોય તો મીઠું અને હળદરનો પાઉડર મેળવી પેઢા પર ઘસવાથી મટે છે.
- \* દાંતનું પેઢું સુજી ગયું હોય તો મીઠાના ગાંગડાથી તેને ફોડી તેના પર હુલાવેલી ફટકડીનો પાવડર લગાડવાથી મટે છે.
- \* તેલ, લીંબુનો રસ અને મીઠું મેળવી દાંત ઘસવાથી દાંતનો દુખાવો, દાંતની પીળાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
- \* સફરજનનો રસ સોડા સાથે મેળવી દાંતે ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે અને દાંતની છારી મટે છે.
- \* પાકાં ટામેટાનો રસ ૫૦ ગ્રામ જેટલો દિવસમાં ત્રણ વાર પીવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
- \* દાંતમાં સડો લાગે તો મીઠાના પાણીના કોગળા વારંવાર કરવાથી આરામ મળે છે.

## **તંદુરસ્તી તમારાં હાથમાં**

- \* ક્રોઝિનો ઉકાળો કરી તેના કોગળા કરવાથી દાંતનો સરો અને દાંતનો દુખાવો મટે છે.
- \* કાંદો ખાવાથી દાંત સફેદ દૂધ જેવા થાય છે.
- \* રોજ સવારે મેથી પાણીમાં પલાળી નરણો શ્રોઠે ખાવાથી પાયોરીયા મટે છે.
- \* તુલસીનાં પાન ચાવવાથી અને તુલસીનાં પાનના ઉકાળાના કોગળા કરવાથી દાંત અને પેઢાં મજબૂત થાય છે.
- \* પોલા થયેલ અને કોહવાઈ ગયેલા દાંતના પોલાણમાં લવિંગ અને કપૂર અથવા તજ અને હિંગ વાટી દબાવી દેવાથી આરામ મળે છે.
- \* દાંત પીળા પડી ગયા હોય તો પીસેલું મીંહ અને ખાવાનો સોડા મેળવીને દાંતે ઘસવાથી પીળાશ મટે છે.
- \* દાઢ દુખતી હોય તો ઘાસલેટ અથવા સ્પિરિટનું પૂમહું બનાવી, તેની ઉપર કપૂર ભભરાવી, દુખતી દાઢ ઉપર મુકવું.
- \* જાંબુના જાડની છાલ ધોઈ, સ્વચ્છ કરી, અધકયરી ખાંડી, શેર પાણીમાં નાખી ઉકાળવી. ઠા શેર પાણી બાકી રહેતાં તે પાણી ઠંડુ કરી કોગળા કરવાથી દાંતના પેઢાં મજબૂત થાય છે તથા પાયોરિયા મટે છે.
- \* વડનું દૂધ વડના પતા ઉપર લઈ તેની પેઢાં ઉપર માલિસ કરવામાં આવે તો છલતા દાંત પણ મજબૂત રીતે ચોંટી જાય છે.
- \* ૧૦ ગ્રામ મરી અને ૨૦ ગ્રામ તમાકુની કાળી રાખ બારીક પીસી સવાર-સાંજ દાંતે ઘસવાથી પાયોરિયામાં ફાયદો થાય છે.
- \* જરાને શેકીને ખાવાથી પાયોરિયાની દુર્ગધ દૂર થાય છે.

## **નસકોરી**

- \* નસકોરી ફૂટે ત્યારે તાળવા ઉપર ઠંડા પાણીની ધાર પાડવી તેમજ નાકમાં ઠંડા પાણીની છાલક મારવાથી લોહી બંધ થાય છે.
- \* નસકોરી ફૂટે ત્યારે બરફનો ટુકડો માથે, કપાળે અને ગરદન પર ફેરવવાથી લોહી બંધ થાય છે.
- \* લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વાટે નાખવાથી નસકોરીનું દર્દ કાયમ માટે નાખુદ થાય છે.

## **તંદુરસ્તી તમારાં હાથમાં**

- \* નસકોરી ફૂટે તો શેરડીના રસનાં ટીપાં, ગાયના ધીના ટીપાં, દૂધના ટીપાં, ખાંડના પાણીના ટીપાં, દ્રાક્ષના પાણીના ટીપાં - ગમે તે એક વસ્તુનાં ટીપાં નાકમાં નાખવાથી લોહી પડતું બંધ થાય છે.
- \* નસકોરી ફૂટે તો ફટકડીનું ચૂર્ણ સુંઘાડવું અને ફટકડીનું પાણી નાકમાં નાખવાથી લોહી તરત જ બંધ થાય છે.
- \* ઘઉના લોટમાં સાકર અને દૂધ મેળવી પીવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે.
- \* મરીને દહીં અને જૂના ગોળમાં મેળવીને પીવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.
- \* કેરીની ગોટલીનો રસ નાક વડે સુંઘવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.
- \* દૂધિનો રસ મધ અથવા સાકર સાથે પીવાથી નાકમાંથી કે ગળામાંથી પડતું લોહી બંધ થાય છે.
- \* મરી અથવા અજમો નાખીને ગરમ કરેલું તેલ નાકમાં નાખવાથી, સુંઘવાથી કે નાકે ચોળવાથી નાક બંધ થઈ ગયું હોય તો તે ખૂલે છે.
- \* આમળાંના ચૂર્ણને દૂધમાં કાલવી, રાત્રે સૂતી વખતે મગજના ભાગ પર લગાડવાથી વારંવાર ફૂટતી નસકોરી બંધ થાય છે.
- \* અરુસીના પાનના રસનાં ત થી ૪ ટીપાં નાકમાં નાખવાથી નસકોરી બંધ થાય છે અને અરુસીનાં પાનનો રસ પીવાથી નાક કે મોં વાટે લોહી પડતું બંધ થાય છે.

## **પેટનાં દર્દો**

- \* અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો, અજર્ણ અને વાયુ મટે છે.
- \* આદુ અને લીંબુના રસમાં અર્ધી ચમચી મરીનું ચૂર્ણ નાંખી પીવાથી પેટનો દુખાવો મટે છે.
- \* અજમો અને મીંહ વાટીને તેની ફાકી લેવાથી પેટનો દુખાવો મટે છે.
- \* આદુ અને હુદીનાના રસમાં સિંધવ મીંહ નાખીને પીવાથી પેટનો દુખાવો મટે છે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- \* આદુનો રસ એક ચ્યાન્સી અને લીંબુનો રસ બે ચ્યાન્સી મેળવી તેમાં થોડી સાકર નાખીને પીવાથી કોઈપણ જાતનો પેટનો દુખાવો મટે છે.
- \* શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્જી ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુખાવો મટે છે.
- \* જ્યાં પછી કેટલાકને ૨-૩ કલાકે પેટમાં સખત દુખાવો થાય છે તે માટે સૂંઠ, તલ અને ગોળ સરખે ભાગે લઈ દૂધમાં નાખી સવાર-સાંજ લેવાથી પેટનો દુખાવો મટ છે.
- \* લીંબુના રસમાં થોડો પાપડખાર મેળવી પીવાથી પેટનો દુખાવો ને આફરો મટે છે.
- \* તુલસીનો રસ અને આદુનો રસ સરખે ભાગે લઈ સહેજ ગરમ કરી પીવાથી પેટનો દુખાવો મટે છે.
- \* ગોળ અને ચૂનો ભેગો કરી ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુખાવો મટે છે.
- \* અજમો અને સંચળનું ચૂર્જી ફાકવાથી ગેસ મટે છે.
- \* ચીકણી સોપારીનો બે આનીભાર ભૂકો મોળા મછામાં સવારે લેવાથી ગેસ મટે છે.
- \* લીંબના રસમાં મૂળાનો રસ મેળવી પીવાથી જ્યાં પછી થતો દુખાવો અને ગેસ મટે છે.
- \* કોકમનો ઉકાળો કરી, તેમાં થોડું મીઠું નાંખી પીવાથી પેટનો વાયુ અને ગોળો મટે છે.
- \* સાકર અને ધાણાનું ચૂર્જી પાણીમાં પીવાથી પેટની બળતરા મટે છે.
- \* જીરું અને ધાણા બન્ને સરખે ભાગે લઈ રાત્રે પલાળી રાખી, સવારના ખૂબ મસળી, તેમાં સાકર નાખીને પીવાથી પેટની બળતરા મટે છે.
- \* કુદીનાના રસમાં મધ્ય મેળવી લેવાથી પેટનાં દર્દો મટે છે. લાંબા સમયની અંતરડાની ફરિયાદ માટે આ ઉત્તમ ઈલાજ છે.
- \* ઉકળતા પાણીમાં સૂંઠનું ચૂર્જી નાંખી, તેને ઢાંકી, ઠંકુ થયા બાદ ગાળી તેમાંથી પાંચ ચ્યાન્સી જેટલું પીવાથી પેટનો આફરો પેટનો દુખાવો મટે છે. આ પાણીમાં સોડ-બાય-કાર્બ નાખી દિવસમાં બે ત્રાણ વાર પીવાથી ખરાબ ઓડકાર અને પેટમાં રહેલો વાયુ મટે છે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- \* એક રૂપિયાભાર તલનું તેલ અને ૦૧ તોલો હળદર મેળવીને લેવાથી પેટની ચૂંક મટે છે.
- \* રાઈનું ચૂર્જી થોડી સાકર સાથે લેવાથી અને ઉપરથી પાણી પીવાથી વાયુ અને કફથી થતો પેટનો દુખાવો મટે છે.
- \* હિંગ, સૂંઠ, મરી, લીંડી પીપર, સિંધવ, અજમો, જીરું, શાહજીરું - આ આઠ ચીજો સરખે ભાગે લઈ ચૂર્જી બનાવી (જેને હિંગાષ્ક ચૂર્જી કહેવામાં આવે છે, જે બજારમાં પણ મળે છે) લેવાથી પેટના દર્દો મટે છે.
- \* સાકરવાળા દૂધમાં એકથી બે ચ્યાન્સી દિવેલ નાખી દિવસમાં બે વાર પીવાથી પેટનાં અનેક જાતના દર્દો મટે છે.
- \* સવારના પહોરમાં મધ્ય સાથે લસાશ ખાવાથી પેટની ચૂંક મટે છે અને જેમનો જઠરાણિ મંદ પડી ગયો ગોય તો તે પ્રજીવલિત બને છે.
- \* રાઈનું ચૂર્જી પાણી સાથે લેવાથી પેટની ચૂંક અને અજર્ણ મટે છે.
- \* અજમો, સિંધવ અને હિંગ વાટી તેની ફાકી મારવાથી ગોળો મટે છે.
- \* આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવીને પીવાથી પાચનકિયા બળવાન બને છે.
- \* એલચી, ધાણાનું ચૂર્જી ચારથી છ રતીભાર અને શેકેલી હિંગ એક રતીભાર લઈ લીંબુના રસમાં મેળવીને ચાટવાથી વાયુ, પેટનો દુખાવો અને આફરો મટે છે.

## પેશાબ

- \* પેશાબ ઓછો થતો હોય તે બંધ થયો હોય તો, તાજ છાશમાં ગોળ નાખીને પીવાથી પેશાબની અટકાયત મટે છે.
- \* પેશાબ અટકાતો હોય તો મૂળાનો રસ પીવાથી પેશાબ દૂટથી થાય છે.
- \* અર્ધા તોલા લીંબુનાં બીજનું ચૂર્જી પાણી સાથે પીવાથી તરત પેશાબ દૂટે છે.
- \* પેશાબની બળતરાં તથા અટકાયત થતી હોય તો ગરમ કરેલા દૂધમાં સાકર અને ચોખ્યું ધી નાંખી પીવાથી રાહત થાય છે અને તકલીફ મટે છે.
- \* ચોખાના ધોવાણમાં સાકર તથા ચપટી સૂરોખાર મેળવી પીવાથી પેશાબ ઓછો થતો હોય તો વધુ છે, કોઈપણ કારણસર પેશાબ અટકતો હોય તો મટે છે.
- \* પેશાબ અટકી અટકીને થવો, વધુ થવો અને બળતરા સાથે થવો વગેરેમાં તલ ખાવાથી ફાયદો થાય છે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- \* કેળનું ચાર-પાંચ તોલા પાણી ગરમ કરેલા ધીમાં નાખી પીવાથી - બંધાયેલો પેશાબ તરત છૂટી જાય છે.
- \* રાત્રે ઘઉને પાણીમાં પલાણી રાખી, સવારે વાટી, તેમાં સાકર નાખીને હલવો બનાવી ખાવાથી પેશાબ છૂટથી થાય છે.
- \* આમળાંના ચૂર્ઝમાં ધી ને ગોળ મેળવી, રોજ લેવાથી પેશાબની તકલીફ મટે છે.
- \* પેશાબ અટકી અટકીને આવતો હોય તો એલચીનું ચૂર્ઝ મધ્યમાં ચાટવાથી પેશાબ સાફ અને છૂટથી આવશે.
- \* ૧૦૦ ગ્રામ દૂધમાં ખાવાનો સોડા એક ગ્રામ નાખી, દિવસમાં બે વાર પીવાથી પેશાબની છૂટ થશે અને પેશાબની બળતરા દૂર થાય છે.
- \* જવને ખાંડીને તેની ઉપરના ફોટરા કાઢી નાખી, જવદાણ કાઢી, તેને પાણીમાં ઉકળી (૧ લિટર પાણીમાં ૧ થી ૨ ચમચી જવદાણ નાખવા), જવ બફાઈ જાય એટલે ઉતારી લઈ પાણી લેવું, જવનું આ પાણી આખો દિવસ પાણીની તરસ લાગે ત્યારે સાદા પાણીની જગ્યાએ પીવાથી પેશાબ અટકી અટકીને આવવો, પેશાબમાં બળતરા થવી, કિંનીનું શૂળ, મુત્રાશયનું શૂળ, પથરી વગેરેમાં ફાયદો થાય છે.
- \* એલચી અને સુંઠ સરખે ભાગે લઈ દહીના નીતર્યા પાણીમાં સિંધવ મેળવીને પીવાથી પેશાબ તરત છૂટે છે.
- \* જવ ઉકળેલ પાણી પીવાથી પેશાબ સાફ આવે છે અને બળતરા મટે છે.
- \* શેરડીનો રસ પીવાથી પેશાબ છૂટથી થાય છે, બળતરા મટે છે અને પેશાબમાં લોહી પડતું હોય તો તે પણ મટે છે.
- \* પાતળી ધાશમાં બે આનીભાર સુરોખાર નાખી પીવાથી પેશાબની બળતરા મટે છે.
- \* વરિયાળીનું શરબત બનાવી તેમાં જરાક સુરોખાર નાખી પીવાથી પેશાબની બળતરા મટે છે.
- \* વરિયાળીને ગોખરુનો ઉકળો બનાવી પીવાથી પેશાબની બળતરા મટે છે.
- \* એલચીના ચૂર્ઝને આમળાનાં ચૂર્ઝ સાથે કે આમળાના રસમાં લેવાથી પેશાબની બળતરા દૂર થાય છે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- \* ચાર તોલા કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાણી રાખી, સવારે મસળી, ગાળી થોડા જરાની ભૂકી નાખી પીવાથી પેશાબની ગરમી મટે છે અને પેશાબ સાફ આવે છે.
- \* આમળાના રસમાં મધ અને હળદર નાખી પીવાથી પેશાબ માર્ગ જતું પરું બંધ થાય છે.
- \* સૂંઠના ઉકળામાં હળદર અને ગોળ નાખીને પીવાથી ધાતુસ્ત્રાવ મટે છે તથા પેશાબ સાથે જતી ધાતુ બંધ થાય છે.
- \* એલચી અને શેકેલી હિંગનું ત્રાણ રતી જેટલું ચૂર્ઝ ધીને દૂધની સાથે લેવાથી પેશાબમાં જે ધાતુ જતી હોય તે બંધ થાય છે.
- \* અર્ધાતોલા જેટલું સૂંઠનું ચૂર્ઝ ગાયના અર્ધા શેર દૂધમાં પીવાથી વેદના સાથે પેશાબમાંથી લોહી પડતું હોય તો તે બંધ થાય છે ને વેદના મટે છે.
- \* વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો અજમો અને તલ ભેગા કરીને ખૂબ ચાવીને સવાર-સાંજ ખાવાથી આરામ મળે છે.
- \* આદુના રસમાં ખડી સાકર મેળવી સવારે અને રાત્રે પીવાથી વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો આરામ મળે છે.
- \* ક્યારેક ડાયાબિટીઝ ન હોવા છતાં વારંવાર ખૂબ પેશાબ કરવા જવું પડતું હોય તો અડણી પલાણેલી દાળને વાંટીને ધીમાં શેકી ખાંડ નાખીને શીરો બનાવીને સાત દિવસ ખાવાથી આરામ થાય છે. આ શીરા પર દહીમાં ખાંડ નાખી રોટલી સાથે ખાવાથી વધુ લાભદાયક બને છે.
- \* અર્ધા ચમચી અજમો અને અર્ધા ચમચી ગોળ મસળી મિક્સ કરી સવાર-સાંજ લેવાથી વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો મટે છે.
- \* ક્યારેક ડાયાબિટીઝ ન હોવા છતાં વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો પેટ પર કુંટીના નીચે કોઈપણ તેલનું માલિસ કરવું પછી બાજરીને તાવડી પર ગરમ કરી કપડામાં બાંધી પેટ, પેઢું તથા કમર પર ૧૦-૧૫ મિનિટ રોજ શેક કરવાથી આરામ મળે છે.
- \* આમલી ૧૦ ગ્રામ લઈ, રાતે એક કપ પાણીમાં પલાણી, સવારે મસળીને પાણી કપડાથી ગાળવું, તે પાણીમાં આદુનો રસ એકથી બે ચમચી તથા એક ચમચી ખાંડ મેળવી શરબત કરી સવાર-સાંજ પીવાથી વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો તે અટકે છે.

## **તંદુરસ્તી તમારાં હાથમાં**

- \* કણા તલ ૨૫૦ ગ્રામ, ખસખસ ૧૦૦ ગ્રામ તથા અજમો ૧૦૦ ગ્રામને અધકરા શેકી, ખાંડીને ચૂર્ઝ બનાવી શીશીમાં ભરી રાખવું, તેમાંથી દરરોજ ર થી ૫ ગ્રામ ચૂર્ઝ થોડી સાકર અને ચપટી હળદર મેળવી સવાર-સાંજ બે વાર લેવાથી બહુમૂત્ર રોગ (વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તે) મટે છે.
- \* મેથી ત્રણ ભાગ, સુંઠ એક ભાગ તથા અજમો એક ભાગનું ચૂર્ઝ બનાવી મધુ કે પાણીમાં દિવસમાં સવાર-સાંજ બે વાર લેવાથી બહુમૂત્ર રોગ મટે છે.
- \* મેથીની ભાજીનો રસ દસ તોલા, તેમાં દોઢ માસો કાથો અને ત્રણ માસા સાકર મેળવીને પીવાથી બહુમૂત્ર રોગ મટે છે.
- \* આમળાં ને હળદર સમભાગે લઈ કૂટીને તેમાં મીસરી ખાંડ મેળવીને પાણી સાથે લેવાથી પેશાબની બણતરા મટે છે.

## **પથરી**

- \* લીંબુના રસમાં સિંધવ-મીહું મેળવીને ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે.
- \* ગાયના દૂધની છાશમાં સિંધવ-મીહું નાખીને ઉભા ઉભા રોજ સવારે ૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે.
- \* ગોખરનું ચૂર્ઝ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.
- \* ટેકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફક્કવાથી પથરીનો ચીરો થઈ પેશાબ વાટે નીકળી જાય છે.
- \* નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.
- \* કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.
- \* મૂળાના પાનનો રસ કાઢી તેમાં સૂરોખાર નાખી, રોજ સવારે પીવાથી પથરી ઓગળી જાય છે.
- \* પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.
- \* જુનો ગોળ ને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.
- \* કણી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
- \* કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાણી રાખી, સવારે મસળી, ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.

## **તંદુરસ્તી તમારાં હાથમાં**

- \* કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાળ મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટે છે.
- \* મૂળાનાં બી ચાર તોલા લઈ અર્ધો શેર પાણીમાં ઉકાળવાં, અર્ધુ પાણી બાકી રહે ત્યારે ઉતારી તે પાણી પીવાથી પથરી ઓગળી જાય છે.
- \* ઘઉં અને ચણાને સાથે ઉકાળીને, તેના ઉકાળામાં ચપટી સૂરોખાર નાખી ઉકાળો પીવાથી પથરી ભાંગીને ભૂકો થઈ જાય છે.
- \* મેંદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે.
- \* મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી, તેની ભસ્મ બનાવી, ચાળીને આ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવાર-સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ તથા પેશાબની અટકાયત મટે છે.
- \* બડી દૂધ (દૂધૈલી) નાં પાન પાંચ તોલા તથા મેંદીના પાન પાંચ તોલા લઈ બંનેને અલગ અલગ વાટી રસ કાઢવો ને બંને રસ કાંસાના વાસણમાં નાખી દોઢ તોલા ગોળ ઉમેરી ઉકાળવું, રસ ઠંડો થતા પછી બે ભાગ કરી એક ભાગ સવારે અને એક ભાગ સાંજે ત્રણ દિવસ સુધી પીવો. પેશાબ લાલ આવે તો ગભરાવું નહિ. ત્રીજા દિવસે પથરી બારીક પાઉડર થઈ પેશાબ વાટે બહાર આવશે.
- \* કાંદાના ૨૦ ગ્રામ રસમાં ૫૦ ગ્રામ ખાડેલી મીસરી ભેળવીને ખાવાથી પથરી તૂટી જઈને મૂત્ર દ્વારા નીકળી જાય છે.

## **બાળરોગો**

- \* ખજૂરની એક પેશી ચોખાના ઓસામજા સાથે મેળવી, ખૂબ વાટી, તેમાં થોડું પાણી મેળવીને નાનાં બાળકોને બે-ત્રણ વખત આપવાથી નબળાં, કંતાઈ ગયેલા ગયેલાં બાળકો હષ્ટપુષ્ટ ભરાવદાર બને છે.
- \* એક ચમચી પાલખી ભાજીનો રસ મધમાં મેળવી રોજ પાવાથી સુકલકડી બાળકો શક્તિશાળી બને છે.
- \* પાકા ટામેટાનો તાજો રસ નાનાં બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પાવાથી બાળકો નિરોગી અને બળવાન બને છે.
- \* બાળકોને તલ ખવડાવવાથી બાળકો રાત્રે ઊંઘમાં પેશાબ કરતાં હોય તે અટકે છે અને શરીર પુષ્ટ બને છે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- \* તુલસીના રસનો રસ પાંચથી દસ ટીપાં નાખીને રોજ પીવડાવવાથી બાળકોનાં સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે અને બાળક જલ્દી ચાલતાં શીખે છે.
- \* કંદો અને ગોળ રોજ ખવડાવવાથી બાળકની ઊંચાઈ વધે છે.
- \* ટામેટાંનો એક ચમચી રસ દૂધ પીવડાવતાં પહેલાં પાવાથી, બાળકોને થતી દૂધની ઉલટી મટે છે.
- \* હળદર નાખી ગરમ કરેલા દૂધમાં સહેજ મીઠું અને ગોળ નાખીને પાવાથી બાળકોની શરદી, કફ અને સસણી મટે છે.
- \* લસણની એક કે બે કળી દૂધમાં પકાવી, ગાળી, દૂધ પાવાથી બાળકોની મોટી ઉધરસ (હડકી ઉધરસ) મટે છે.
- \* ધાણાં અને સાકરને ચોખાના ઓસામણમાં પાવાથી બાળકોની ઉધરસ અને શાસ મટે છે.
- \* નાગરવેલનાં પાનને દિવેલ ચોપડી, સહેજ ગરમ કરી, નાના બાળકની છાતી પર મુકી, ગરમ કપડાથી હળવો શેક કરવાથી બાળકને કફ ધૂટો પડી જાય છે.
- \* લસણની કળીઓ કચરી, પોટલી બનાવી, બાળકના ગળામાં બાંધી રાખવાથી બાળકની કાળી ખાંસી (હુકિંગ કફ-હડખી ઉધરસ) મટે છે.
- \* બાળકની છાતી કફથી ભરાઈ ગઈ હોય તો તુલસીનાં પાનનો રસ મધમાં મેળવી બે ત્રાશ વાર પાવાથી તથા તુલસીના રસને ગરમ કરી છાતી, નાક તથા કપાળે લગાડવાથી શરદી અને કફમાં ખૂબ રાહત મળે છે.
- \* છાશમાં વાજડિંગનું ચૂર્ણ પાવાથી નાનાં બાળકોને કરમ મટે છે.
- \* મધમાં કાળીજરીનું ચૂર્ણ ચટાડવાથી બાળકોનાં કરમ મટે છે.
- \* એક ચમચી કંદાનો રસ પાવાથી અન્ન ખાતાં બાળકોના કરમ મરી જાય છે અને ફરી થતાં નથી.
- \* બાળકોના પેટમાં કરમ થતાં હોય તો કાચાં ગાજર થાવાથી કરમ મટે છે.
- \* જલુકોઝ મેળવેલા પાણીમાં લીંબુ નીચોવી બબ્બે ચમચી દિવસમાં ચાર વખત પાવાથી બાળકના શરૂઆતના દાંત ખૂબ સરળતાથી આવે છે અને જાડા થતાં નથી.
- \* બાળકોનાં પેઢાં પર નરમાસથી મધ અને સિંધવ-મીઠું મેળવી ઘસવાથી બાળકને સહેલાઈથી દાંત આવે છે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- \* દાંત આવે ત્યારે પાણી જેવા જાડા થતા હોય તો જાવંતીને તાવડી પર શેકી પાઉડર કરી મધ સાથે માતાના દૂધમાં આપવાથી જાડા મટે છે.
- \* દાંત આવે ત્યારે પાણી જેવા જાડા થતા હોય તો મકાઈના ડોડામાંથી દાશા કાઢી લીધા પછીના મકાઈના ડોડાને બાળી તેની ભૂકી (એક કે બે વાલ જેટલી) પાણી કે છાશમાં પાવાથી જાડા બંધ થાય છે.
- \* દાંત આવે ત્યારે આંખ આવી હોય તો કુલાવેલી ફટકડીને ગુલાબજળમાં મેળવી આંખમાં ટીપાં નાખવાં તથા ફટકડીના નવશેકા પાણીથી આંખ ધોવાથી આરામ થાય છે.
- \* બાળકોને ગાજરનો રસ પિવડાવવાથી દાંત નીકળવામાં સરળતા થાય છે અને દૂધ પણ સારી રીતે પચે છે.
- \* તુલસીના પાનનો રસ મધમાં મેળવીને પેઢા પર ઘસવાથી બાળકના દાંત તકલીફ વગર સરળતાથી આવે છે.
- \* બાળકોને દાંત આવે ત્યારે લીરીપીપરનું ચૂર્ણ અથવા ફૂલાવેલો ટંકણખાર મધમાં મેળવી પેઢા પર ઘસવાથી અને ટંકણખારનું ચૂર્ણ મધમાં ચટાડવાથી સરળતાથી પીડા વગર દાંત આવે છે.
- \* તાંદળજાનો રસ એક ચમચી ધાવણા બાળકને પાવાથી કબજિયાત મટે છે.
- \* એક શેર પાણીને ખૂબ ઉકાળી, તેમાં પાંચ તોલા કંદાની છીંણ નાખી, ઠંડુ થયા બાદ ગાળી, તેમાંથી એક ચમચી પાણી લઈ તેમાં પાંચ ટીપાં મધ મેળવી પાવાથી બાળક ઘસધસાટ ઉંઘે છે.
- \* સફેદ કંદાને કચરીને સુંધાડવાથી બાળકોની આંચકી-તાણમાં ફાયદો થાય છે.
- \* બાળકોને ચૂંક આવતી હોય તો કુંટી પર હિંગ ચોપડવાથી વાધૂટ થઈ આરામ થાય છે.
- \* જાયફળ અને સુંઠને ગાયના ધીમાં ઘસીને તેનો ઘસરકો ચટાડવાથી બાળકને શરદીને લીધે થતા જાડા મટે છે.
- \* નાગરવેલનાં પાનના રસમાં મધ મેળવીને ચટાડવાથી વાધૂટ થઈ નાના બાળકોનો આફરો, અપચો મટે છે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- \* બાળકને પેટમાં દુખે ત્યારે તેનું મૂત્ર પેટ ઉપર ચોપડવાથી લાભ થાય છે.
- \* નાનાં બાળકોને છાશ પીવડાવવાથી દાંત નીકળવામાં તકલીફ થતી નથી.

## શરદી

- \* ગરમગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે.
- \* ગરમ ગરમ ચણા સુંધવાથી શરદી મટે છે.
- \* સૂંઠ, કાળાં મરી ને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
- \* નાગરવેલનાં બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે.
- \* રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.
- \* આદૃનો રસ ને મધ્ય એક-એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે.
- \* રાઈને વાટી મધ્ય મેળવીને ખાવાથી શરદી મટે છે.
- \* ફૂદીનો અને આદૃનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
- \* અજમાને વાટી તેની પોટલી સુંધવાથી શરદી મટે છે.
- \* ગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર નાખીને પીવાથી શરદી મટે છે.
- \* મરી, તજ અને આદૃનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
- \* લીંબુના રસમાં આદૃનું કચુંબરને સિંધવ નાખી પીવાથી શરદી મટે છે.
- \* પાણીમાં સૂંઠ નાંખી ઉકાળીને પાણી પીવાથી શરદી મટે છે.
- \* કાળાં મરી અને શેકેલી હળદરનું ચૂર્ઝ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે.
- \* હળદરનો ધૂમાડો સુંધવાથી શરદી મટે છે.
- \* રાત્રે સૂતી વખતે એક કાંદો ખાવાથી (ઉપર પાણી પીવું નહિ) શરદી મટે છે.
- \* કાંદાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી શરદી મટે છે.
- \* કુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.
- \* કુદીનાના રસના ટીપાં નાકમાં નાખવાથી પીનસ (સળેખમ) મટે છે.
- \* લવિંગના તેલ ને રૂમાલમાં નાખી સુંધવાથી શરદી-સળેખમ મટે છે.
- \* સૂંઠના ચૂર્ઝમાં ગોળ અને થોડુંક ધી નાખી તેની ત્રણ-ચાર તોલા જેવડી ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે છે. વરસતા વરસાદમાં સતત પલળી કામ કરનાર માટે આ ઉપાય ખૂબજ લાભદાયક છે. આનાથી શરીરની શક્તિ અને સ્વૂર્ત્તિ જળવાઈ રહે છે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- \* સૂંઠ, તલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી, સળેખમ મટે છે.
- \* સાકરનો બારીક પાઉડર છીકણીની જેમ સુંધવાથી શરદી મટે છે.
- \* તુલસીના પાનનો રસ ને આદૃનો રસ મધ્ય સાથે લેવાથી શરદી મટે છે.
- \* તુલસી, સૂંઠ, કાળા મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણ વાર પીવાથી ગમે તેવી શરદી મટે છે.
- \* ગરમ પાણીમાં લસણનો રસ મેળવી કોગળા કરવાથી શરદી મટે છે.

## સોજો-મૂઢમાર

- \* કડવા લીમડાનાં પાન બાફીને સાધારણ ગરમ હોય ત્યારે સોજા પર બાંધવાથી સોજો ઉતરે છે.
- \* લવિંગ વાટી તેનો લેપ સોજા પર ચોપડવાથી સોજો ઉતરે છે.
- \* રાઈ અને સંચળ વાટીને લેપ કરવાથી સોજો ઉતરે છે.
- \* હળદર અને કળી ચૂનાનો લેપ કરવાથી મૂઢમારનો સોજો ઉતરે છે.
- \* હળદર અને મીઠાનો લેપ, વાગવાથી કે મચકોડાવાથી આવેલો સોજો મટાડે છે.
- \* તલ અને મૂળા ખાવાથી સોજો ઉતરે છે.
- \* મૂળાના પાનનો રસ પીવાથી સોજો ઉતરે છે.
- \* તાંદળજાનાં પાનનો લેપ કરવાથી સોજો ઉતરે છે.
- \* ઘાણાને લોટની સાથે મેળવી તેનો લેપ કરવાથી સોજો મટે છે.
- \* આમલીના પાન અને સિંધવ-મીહું વાટી તેનો ગરમ લેપ સોજા પર કે જલાઈ ગયેલા સાંધા પર ચોપડવાથી સોજો ઉતરે છે.
- \* મૂઢમાર કે મરદાયેલાં હાડકાં પર આમલી ને આવળનાં પાનનો લેપ ગરમ કરી લગાડવાથી સોજો ઉતરે છે.
- \* શિંગોડાની છાલ ઘસીને લેપ કરવાથી સોજો કે દુખાવો મટે છે.
- \* લસણ, હળદર અને ગોળને મેળવીને તેનો લેપ મૂઢમાર પર કરવાથી આરામ મળે છે.
- \* સરસિયા કે તલના તેલમાં થોડો અજમો નાખી તેલ ગરમ કરી તેલનું સંધિવાના સોજા પર માલિસ કરવાથી આરામ થાય છે.

- \* મીહું લસોટીને ચોપડવાથી સોજો ઉતરી જાય છે.
- \* તુલસીનાં પાનને પીસીને સોજા પર લગાડવાથી સોજો ઉતરી જાય છે.
- \* જાયફળને સરસિયાના તેલમાં મેળવીને સાંધાઓના સોજા પર લેપ કરવાથી જકડાયેલા સાંધા ધૂટા થઈ સોજો મટે છે.
- \* મૂઢમાર કે મોચ પર લોહચુંબકનો સાઉથ પોલ મૂકવાથી તરતજ આરામ થાય છે અને લોહચુંબક લાકડી જેવું જ્વોક આકારનું હોવું જોઈએ અને નોર્થ પોલ શરીરના બીજાભાગને અડે નહીં તેની કાળજી લેવી જોઈએ.

### **સ્ત્રીરોગો**

- \* ખજૂર થોડા મહિના નિયમિત ખાવાથી વારંવાર મૂર્છા આવતી હોય તેવી સ્ત્રીઓની હિસ્ટીરીયા મટે છે.
- \* લસણને પીસીને નાકથી સુંઘવાથી હિસ્ટીરીયાની મૂર્છા મટે છે.
- \* પાકાં કેળા, આમળાનો રસ ને સાકર એકત્ર કરી પીવાથી સ્ત્રીઓના પ્રદર અને બહુમૂત્ર રોગ મટે છે.
- \* જીરું અને સાકરનું ચૂર્ઝી પાવલીભાર, ચોખાના ધોવાણમાં પીવાથી સ્ત્રીઓનું શેતપ્રદર મટે છે.
- \* એક પાંદું અર્ધા તોલા ધી સાથે સવાર-સાંજ ખાવાથી પ્રદરરોગ મટે છે.
- \* હિંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે. માસિક સાફ આવે છે અને પેટનો દુખાવો મટે છે.
- \* આમળાનો રસ મધ્ય સાથે લેવાથી સ્ત્રીઓની યોનિનો દાહ મટે છે.
- \* સ્ત્રીઓને માસિક વખતે ખૂબ પીડા થતી હોય કે માસિક બરાબર ન આવતું હોય તો તલ ખાવા, એક તોલા કાળા તલને વીસ તોલા પાણીમાં ઉકાળવું પાંચ તોલા બાકી રહે એટલે તેમાં ગોળ નાખી ઉકાળી પીવાથી માસિક સાફ આવે છે.
- \* કાચો કાંદો ખાવાથી માસિક સાફ આવે છે અને દુખાવો થતો નથી.
- \* માસિક સમયે વધારે રક્તસ્ત્રાવ થતો હોય અને ચક્કર આવતા હોય તો તુલસીના રસને મધ્યમાં મેળવીને પીવાથી ફાયદો થાય છે.

- \* ત્રાશ તોલા મેથીનો લોટ લઈ રાત્રે વીસ તોલા દૂધમાં પલાણી રાખવો. સવારે પાંચ તોલા ધી ગરમ કરી તેમાં દૂધમાં ભીજવેલો મેથીનો લોટ નાખી એકરસ કરી ઉતારી લેવું. પછી તેમાં બે તોલા ગોળ નાખી બરાબર મિક્સ કરી પ્રસુતા સ્ત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવાથી ધાવણ ધૂટથી આવે છે.
- \* જીરાની ફાકી મારવાથી સ્ત્રીનું ધાવણ વધૈ છે.
- \* ધીમાં શેકેલી હિંગ ધી સાથે ખાવાથી સુવાવડી સ્ત્રીને આવતાં ચક્કર અને શૂળ મટે છે.
- \* સુવાવડમાં સ્ત્રીઓએ સુવાનો ઉપયોગ ધૂટથી કરવો. જેથી ધાવણ સારું આવે છે, કમર દુખતી નથી અને ખાદૈલું પાચન થાય છે.
- \* તાંદળજાનાં મૂળ વાટીને ચોખાના ઓસામણમાં પીવાથી સુવાવડી અને સગર્ભનો રક્તસ્ત્રાવ મટે છે.
- \* સુવાવડી સ્ત્રીને ભૂખ ન લાગતી હોય તો ઠી ચમચી અજમાનું ચૂર્ઝી, બે ચમચી આદુનો રસ અને સોપારી જેટલો ગોળ મેળવી સવારે અને રાત્રે ખાવાથી ખૂબ ખૂબ લાગે છે.
- \* સુવાવડમાં તાવમાં અને સુવાવડ પછી થતા કમરના દુખાવામાં અજમો અડધી ચમચી, સૂંઠ અડધી ચમચી, અને ધી બે ચમચી ભેગું કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુખાવો મટે છે.
- \* ઉલટી, ઉબકા, અપચો, આફરો, કફના રોગો, ઉદરશુળ વગેરે સુવાવડી સ્ત્રીની ફરીયાદોમાં અડધી ચમચી અજમાનું ચૂર્ઝી રોજ સવારે અને રાત્રે નવશેકા પાણી સાથે લેવાથી આરામ થાય છે.
- \* લવિંગને ગરમ પાણીમાં ભીજવી એ પાણી પીવાથી સગર્ભ સ્ત્રીઓની ઉલટી મટે છે.
- \* ધાણાનું ચૂર્ઝી ઠી તોલો અને સાકર એક તોલો ચોખાના ધોવાણમાં પીવાથી સગર્ભ સ્ત્રીની ઉલટી મટે છે.
- \* નારંગી ખાવાથી સગર્ભ સ્ત્રીઓના ઉબકા અને ઉલટી મટે છે.
- \* હિંગની ધુમાડી પ્રસવ સમયે જનન અવયવને આપવાથી પ્રસવ સરળતાથી થાય છે.

## **તંદુરસ્તી તમારાં હાથમાં**

- \* તલ, જવ અને સાકરનું ચૂર્જા મધ સાથે ખાવાથી સગર્ભા અને સુવાવડી સ્ત્રીઓનો રક્તસ્ત્રાવ બંધ થાય છે.
- \* સુવાવડી સ્ત્રીને ક્યારેક ધાવણનો વેગ ચડી જતાં, કોઈવાર સ્તનનો સોજો આવે છે અને વેદના થાય છે. તેના પર નાગરવેલનું પાન ગરમ કરી બાંધવાથી એકહું થયેલું ધાવણ છૂટું પડી જાય છે, સોજો ઉત્તરી જાય છે અને પીડા મટે છે.
- \* ઘઉંની સેવને પાણીમાં બાફી, તે પાણી કપડાથી ગાળી લઈને, ૨૦૦ ગ્રામ પાણીમાં રૂઠી રૂઠી ચમચી ચોખ્ખું ધી નાખી પ્રસવ થનાર સ્ત્રીને પાવાથી પ્રસુતિ સરળતાથી અને જલ્દી થાય છે.
- \* જે સ્ત્રીઓને પૂરતું ધાવણ ન આવતું હોય તેમને ચોળાનું શાક વધુ તેલમાં બનાવી ખાવાથી ધાવણ વધે છે.
- \* તુવેરની દાળનો સૂપ બનાવી રૂઠી રૂઠી ચમચી ચોખ્ખું ધી નાખીને પીવાથી ધાવણ વધે છે.
- \* સ્ત્રીઓને ધાણીવાર પ્રસૂતિમાં વિલંબ થાય છે. દદ જેવું ઉપડવું જોઈએ તેવું ઉપડતું નથી. તે વખતે બને તેટલો જૂનો ગોળ રૂઠી રૂઠી ૧૦૦ ગ્રામ પાણીમાં નાખી, ગરમ કરી, ઓગાળી લઈ, તેમાં હુલાવેલો ટંકણખાર ૨ ગ્રામ જેટલો મેળવીને પીવાથી જલ્દીથી અને સુખથી પ્રસવ થાય છે.
- \* તુલસીનાં પાનનો રસ પીવાથી પ્રસવની પીડા ઓછી થઈ જાય છે.
- \* અધી ચમચી સૂર્કનું ચૂર્જા અને એક ચમચી ગોળ સવારે અને રાત્રે લેવાથી ગર્ભશયના દોષો મટે છે અને ગર્ભશય મજબૂત બને છે.
- \* રોજ સવારમાં એક લવિંગ ૪૦ ટિવિસ સુધી ખાવાથી ગર્ભ રહેવાની સંભાવના રહેતી નથી.
- \* પાંકું કેળું ધી અને સાકર સાથે લેવાથી લોહીવા મટે છે.
- \* કળથીનો ઉકાળો પીવાથી ગર્ભપાત કે પ્રસવ પછી સ્ત્રીઓના ગર્ભશયની પૂરેપૂરી શુદ્ધિ થાય છે.
- \* દરરોજ ગાજરનો ૧૦૦ ગ્રામ રસ પીવાથી સ્ત્રીઓને લોહીવા (રક્તપ્રદર) માં તરતજ ફાયદો થાય છે.
- \* તંદુરસ્ત ગાયના તાજા છાણને કપડાથી ગાળી રૂઠી મિલી. જેટલો રસ લઈ તેમાં તેટલું જ ગાયનું દૂધ મેળવીને પીવડાવવાથી બાળક જન્મ્યા પહેલા ગર્ભશયમાં મરણ પામ્યું હોય તો મરેલા બાળકને બહાર લાવવામાં ઉપયોગી થાય છે.

## **તંદુરસ્તી તમારાં હાથમાં**

- \* આમળાં, હરરે, સૂકો ફૂદીનો, પીપરીમૂળ, સુંઠ, મેથી દશ ગ્રામને મીહું પાંચ ગ્રામ લઈ, બધાંને સાથે લસોટી, ચૂર્જા બનાવી, તેમાં ૧૦ ગ્રામ ગુગળ મેળવી, લસણના રસમાં પાંચ પાંચ ગ્રામની ગોળીઓ બનાવી, પાણી સાથે લેવાથી પ્રસુતિ બાદ સ્ત્રીઓને થતો કમરની નીચેના ભાગનો દુખાવો ઓછો થાય છે.

### **અનિદ્રા - ઊંઘ ન આવવી**

- \* સૂતાં પહેલાં ઠંડા પાણી વડે હાથપગ ધોઈ તાજવે અને કપાળે ધી ઘસવાથી ઊંઘ આવે છે.
- \* ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.
- \* કાંદાનું રાયતું રાત્રે ખાવાથી સરસ ઊંઘ આવે છે.
- \* પીપરીમૂળના ચૂર્જાની ફાકી લેવાથી અને પગે દીવેલ ઘસવાથી સારી ઊંઘ આવે છે.
- \* ગોળ સાથે ગંઠોડાનું ચૂર્જા ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ધી આવે છે.
- \* કુમળા વેંગણને શેકી, મધમાં મેળવીને સૂતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે.
- \* વરિયાળી, દૂધ અને સાકરનું દંડુ શરબત પીવાથી ઊંઘ આવે છે.
- \* જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરી, સૂતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.
- \* રૂઠી રૂઠી ખસખસ વાટીને સાકર અને મધ અથવા સાકર અને ધી સાથે સૂતી વખતે લેવા સરસ ઊંઘ આવે છે.
- \* ખૂબ વિચાર, વાયુ કે વૃધ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી રાતની ઊંઘ ઉડી જાય ત્યારે ગંઠોડાનું રૂઠી રૂઠી ગોળ તથા ધી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
- \* દૂધમાં ખાંડ તથા ગંઠોડાનું ચૂર્જા નાખી ઉકાળીને પીવાથી ઊંઘ આવે છે.
- \* રાતના સૂતી વખતે મધ ચાટવાથી ઊંઘ જલ્દી આવે છે.

### **હેડકી**

- \* કાંદાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
- \* થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી હેડકી બંધ થાય છે.
- \* દૂધમાં સુંઠ ઉકાળીને તેનાં ટીપાં નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.

- \* મૂળાનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
- \* સરગવાના પાનનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
- \* જાયફણને ચોખાના ધોવાશમાં ઘસીને પીવાથી હેડકી બંધ થાય છે.
- \* સુંઠ અને ગોળને ગરમ પાણીમાં મેળવી તેનાં ટીપાં નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
- \* ગોળના પાણીમાં સુંઠ ઘસી થોડીથોડી વારે સુંધવાથી હેડકી બંધ થાય છે.
- \* શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
- \* અડદ અને હિંગનું ચૂર્ણ દેવતા પર નાખી તેનો ધુમાડો મોંમાં લેવાથી હેડકી બંધ થાય છે.
- \* નાળિયેરનાં છોડાં બાળી તેની રાખ મધ્યમાં ચાટવાથી હેડકી બંધ થાય છે.
- \* ગાયનું દૂધ ઉકળીને પીવાથી હેડકી બંધ થાય છે.
- \* ગાજર પીસીને સુંધવાથી હેડકી બંધ થાય છે.
- \* તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ પાંચ ગ્રામ ભેગું કરી પીવાથી હેડકી બંધ થાય છે.
- \* જરું ખાવાથી હેડકી બંધ થાય છે.
- \* આંબાના પાંદડાને બાળી તેનો ધુમાડો લેવાથી હેડકી બંધ થાય છે.

## ડાયાબિટીઝ (મધુપ્રમેહ) ની દવા

### વિભાગ-૧ ડાળખાં ટાઈપ

- ✓ ૧. ઉસબો ૨૦ ગ્રામ
- ✓ ૨. સહાતર ૨૦ ગ્રામ (ત્રણેય દવા મિક્સ કરી સાત ભાગ કરવા)
- ✓ ૩. ચિરાતર ૨૦ ગ્રામ

### વિભાગ-૨ પાઉડર ટાઈપ

- ✓ ૧. ગુણવેલ તત્વ ૨૦ ગ્રામ
- ✓ ૨. સુવર્ણમાંકિકા ૧૦ ગ્રામ (ત્રણેય દવા મિક્સ કરી છબ્બીસ ભાગ કરવા)
- ૩. ચિરાતર ૨૦ ગ્રામ

## દવા કેવી રીતે ઉપયોગમાં લેવી

- \* સૌ પ્રથમ ખાંડ ચેક કરાવવી. ત્યાર બાદ વિભાગ નં.૧ માં જેત્રાણ દવા બતાવેલ છે તે ત્રણેયને મિક્સ કરી સાત સરખા ભાગ કરવા. ત્યારબાદ તેમાંથી એક ભાગ લઈ બે ગ્લાસ જેટલા પાણીની અંદર આખી રાત પલાણી રાખવો. ત્યારબાદ સવારે તે પાણીને એક ગ્લાસ જેટલું પાણી રહે ત્યાં સુધી ઉકળીને તેને ગાળી લેવું અને તેમાં એક ચમચી માખણ નાખવું અને સવારે ખાલી પેટે (નરણો કોઠે) તે પાણી પી લેવું. દવા લીધા પછી એક કલાક બાદ ચા તથા અન્ય વસ્તુ લેવી. આ દવા સાત દિવસ સુધી ચાલુ રાખવી.
- \* હવે વિભાગ નં.૧ ની દવા પૂરી થયા બાદ વિભાગ નં.૨ ની દવા શરૂ કરવી. વિભાગ નં.૨ ની દવામાં જે ત્રણ દવા બતાવેલ છે તે ત્રણેયને મિક્સ કરી ૨૬ સરખા ભાગ કરવા અને પછી તેમાંથી એક-એક ભાગ એક ચમચી માખણ સાથે સવારે ખાલી પેટે (નરણો કોઠે) લેવી. આ દવા પૂરી થાય પછી ફરીથી ખાંડ ચેક કરાવી લેવી.
- \* ખાસ નોંધ - આ દવા જ્યાં સુધી ચાલતી હોય ત્યાં સુધી ગરમ તથા વાયુ થાય તેવા (દા.ત. કાંદા, બટાટા, લસણ, રીગણા, ચણાના લોટની બનાવટની વસ્તુ વગેરે.) પદાર્થોન ખાવા.
- \* આમલીના ડિચ્યુકા શેકીને ખાવાથી ડાયાબિટીઝ મટે છે.
- \* લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીઝ મટે છે.
- \* કુમળા કારેલાંના નાના કટકા કરી છાંયડામાં સૂકવી, બારીક ભૂકી કરી, એક તોલા જેટલી ભૂકી સવાર-સાંજ લેવાથી ડાયાબિટીઝ મટે છે.
- \* સારાં, પાકાં જાંબુને સૂકવી, બારીક ખાંડી ચૂર્ણ બનાવી પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી ડાયાબિટીઝ મટે છે.
- \* લસણને પીસીને તેનું પાણી પીવાથી ડાયાબિટીઝ મટે છે.
- \* રોજ રાતે દોઢથી બે તોલા મેથી પાણીમાં પલાણી રાખી, સવારે ખૂબ મસળી, ગાળીને પીવાથી ડાયાબિટીઝ મટે છે.
- \* આમળાનું ચૂર્ણ ફકવાથી ડાયાબિટીઝમાં રાહત થાય છે.
- \* હળદરના ગાંઠિયાને પીસી, ધીમાં શેકી, સાકર મેળવી, રોજ ખાવાથી ડાયાબિટીઝમાં ખૂબ ફાયદો થાય છે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- \* હરદે, બહેડાં, કડવા લીમડાની અંતરછાલ, મામેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઈ બારીક ચૂર્ઝ કરી સવાર-સાંજ લેવાથી ડાયાબિટીઝ મટે છે.
- \* હળદર એક ચમચી અને આમળાનું ચૂર્ઝ એક ચમચી ભેગાં કરી રોજ સવારસાંજ લેવાથી ડાયાબિટીઝ મટે છે.
- \* ૫૦ ગ્રામ લીલી હળદર, કાળી તુલસીનાં પાન ૧૦, બીલીપત્રનાં પાન ૩૦ વાટી ૧ જ્વાસ પાણીમાં રાત્રે ભીજાવી, સવારે ખૂબ મસળી, કપડાથી ગાળી, સવારે નરણે કોઠે પીવું, આ પાણી પીધા પછી એક કલાક સુધી કંઈ પણ ખાવું-પીવું નહિ. ૨૧ દિવસ સુધી આ પ્રમાણે લેવાથી ડાયાબિટીઝ ચોક્કસ મટે છે.

## રતવા

- \* શેકેલા જવનો લોટ અને જેઠી મધ્યનું ચૂર્ઝ ધોયેલા ઘીમાં મેળવી લેપ કરવાથી રતવા મટે છે.
- \* ઠડા પાણીમાં ચીકણી સોપારી ઘસી લેપ કરવાથી રતવા મટે છે.
- \* નાગોરનાં પાન વાટી લેપ કરવાથી રતવા મટે છે.
- \* કમરકાકડીનું ચૂર્ઝ બનાવી દૂધમાં નાખી, ખીર જેવું બનાવી ખાવાથી રતવા મટે છે.

## આંખની પીડા

- \* ત્રિઝણ ચૂર્ઝ ૧૦૦ ગ્રામ તથા વરિયાળી ૧૦૦ ગ્રામ મેળવી સવાર-સાંજ ૧ ચમચી પાણી અતવા ઘી સાથે લેવાથી આંખોની દ્રષ્ટિ વધે છે.
- \* ક્યારેક આંખમાં ધૂળ, કચરો, ચૂનો કે કડાનું દૂધ પડે તેથી થતી બળતરામાં આંખમાં દિવેલ આંજવાથી આરામ થાય છે.
- \* આંખમાં ચૂનો કે એસિડ પડ્યો હોય તો આંખની અંદર અને બહારથી ઘી ઘસવાથી શાંતિ થાય છે.
- \* આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે.
- \* હળદરના ૨-૪ ગાંઠિયા તુવેરની દાળ સાથે બાફી, તે હળદર છાંયડે સુકવી બે વાર સૂર્યાસ્ત પહેલાં પાણી સાથે ઘસીને આંખમાં જવાથી આંખનું જામર, ઘોળા રંગનું ફૂલ, રતાશ રહેતી આંખ, આંખની ઝાંખપ વગેરે દર્દી મટે છે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- \* રોજ તાજું માખણ ખાવાથી આંખનું તેજ વધે છે. આંખોની રતાશ અને બળતરા મટે છે.
- \* ધાળા, વરિયાળી અને સાકર સરખે ભાગ લઈ તેનું ચૂર્ઝ બનાવી રોજ જમ્યા પછી પાણી સાથે લેવાથી આંખની બળતરા, આંખમાંથી પાણી પડવું, આંખ લાલ રહેવી, આંખે અંધારા આવવા - જેવા દર્દી મટે છે.
- \* હિંગને મધમાં મેળવી, રૂ ની દિવેટ બનાવી, તેને સણગાવી, કાજળ પાડી, એ કાજળ આંખમાં આંજવાથી નેત્રસ્ત્રાવ બંધ થઈ આંખોનું તેજ વધે છે.
- \* ધોળા મરીને દહીમાં અથવા મધમાં ઘસીને સવાર-સાંજ આંજવાથી રતાંધળાપણું મટે છે.
- \* મરીને પાણીમાં ઘસીને આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલદી પાકીને ફૂટી જાય છે.
- \* બકરીના દૂધમાં લવિંગ ઘસીને આંખોમાં નાખવાથી રતાંધળાપણું મટે છે.
- \* સાકર અને ઘી સાથે જરાનું ચૂર્ઝ ચાટવાથી રતાંધળાપણું મટે છે.
- \* કંદાના રસમાં થોડું મીઠું મેળવીને તેનાં ટીપા આંખમાં નાખવાથી રતાંધળાપણું મટે છે.
- \* પાકાં ટામેટાનો રસ સવાર-સાંજ પીવાથી રતાંધળાપણામાં ખૂબ ફાયદો થાય છે.
- \* આંખમાં ચીપડા બાજતા હોય તો કંદાના રસમાં ખડીસાકર ઘસીને રાત્રે ૨-૨ ટીપાં આંખમાં નાખવાથી આરામ થાય છે.
- \* સરગવાના પાનના રસમાં મધ મેળવી આંખમાં જવાથી આંખના દરેક પ્રકારના રોગ મટે છે અને આંખનું તેજ વધે છે.
- \* આંખમાં ઠડા પાણીની છાલક દરરોજ સવાર-સાંજ મારવાથી આંખની ગરમી દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે.
- \* કોથમીરનો રસ કાઢી, ચોખ્યા કપડાથી ગાળી, તેનાં બંધે ટીપાં આંખમાં નાખવાથી દુખતી આંખો સારી થાય છે. ખીલ, ફૂલ, છારી વગેરે મટે છે, ચુશ્માના નંબર ઉત્તરે છે.
- \* મધ અને સરગવાનાં પાનનો રસ આંખમાં નાખવાથી આંખના બધા રોગો મટે છે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- \* નાગરવેલના પાનનો રસ આંખમાં નાખવાથી દુખતી આંખો સારી થાય છે.
- \* જરાનું ચૂર્ણ રોજ ફાકવાથી આંખની ગરમી ઓછી થાય છે.
- \* ધાળાને પાણીમાં પલાણી રાખી, મસળી, ગાળી, તે પાણી વડે આંખો ધોવાથી દુખતી આંખો સારી થાય છે.
- \* શુદ્ધ મધ અને ખાખરાનો અર્ક સરબે ભાગે લઈ, બરાબર એકરસ કરી, બાટલીમાં ભરી રાખો. રોજ રાત્રે સૂતી વખતે બે-ત્રણ ટીપાં આંખમાં નાખવાથી ચશ્માના નંબર ઘટે છે.
- \* અધકચરા ત્રિફળા રાત્રે પાણીમાં પલાણી રાખી, સવારે ગાળી, તે પાણી આંખમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે.
- \* સાકરને પાણીમાં ઘસી તેનો ઘસારો સવાર-સાંજ આંખમાં આંખોનું ફૂલું મટે છે, આંખ સ્વચ્છ થાય છે અને આંખોનું તેજ વધે છે.
- \* આંખ આવી હોય તો લીંબુનો રસ, મધ, ફટકડી લગાડવાથી ઘમી રાહત થાય છે.
- \* સફેદ કાંદાનો રસ મધમાં મેળવીને આંખમાં નાખવાથી દુખતી આંખ સારી થાય છે અને આંખનું તેજ વધે છે.
- \* હળદર, ફટકડી અને આમલીનાં પાન સરખા પ્રમાણમાં લઈ, તેને વાટી, પોટલી કરી, ગરમ કરીને આંખે શેક કરવાથી આંખોની રતાશ અને બળતરા મટે છે.
- \* સાકર અને તેનાથી ત્રણ ગણા ધાળા લઈ, બંનેનું ચૂર્ણ કરી, પાણીમાં ઉકળી, ઠંકું થાય ત્યારે કપડાથી ગાળી, બાટલીમાં ભરી લેવું. એ પાણીનાં બજે ટીપાં રોજ સવાર- સાંજ આંખમાં નાખવાથી દુખતી આંખો સારી થાય છે.
- \* તેલ વગરની તુવેરની દાળ, પાણી સાથે પથ્થર પર ઘસી આંખમાં આંજવાથી આંખનું ફૂલું અને જાળું મટે છે.
- \* જાયફળ પાણીમાં ઘસીને તેનો ઘસારો પાંપણ તથા આંખની આજુબાજુ ચોપડવાથી આંખની ચળ કે પાણી પડતું હોય તો મટે છે અને આંખનું તેજ વધે છે.
- \* આંખમાં દાડમનો રસ નાખવાથી નંબર ઉત્તરે છે.
- \* દરરોજ સવાર-સાંજ ગુલાબજળનાં ટીપાં નાખવાથી આંખોની લાલાશ તરત દૂર થાય છે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- \* તંદુરસ્ત ગાયના તાજા છાળાને કાપડથી ગાળી તે રસમાં લીડીપીપર ઘસીને રોજ રાત્રે અંજન કરવાથી રતાંધળાપણું મટે છે.
- \* મોતીયો-જામર, વેલ કે આંખના દુખાવામાં પૈશાબનું અંજન કરવાથી મટી જાય છે.

## એસિડિટી

- \* સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
- \* અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે.
- \* સફેદ કાંદાને પીસીને તેમાં સાકર અને દહી મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
- \* આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધા ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે.
- \* એલચી, સાકર અને કોકમની ચટણી બનાવી ખાવાથી એસિડિટી મટે છે.
- \* દ્રાક્ષ અને બાળ હરડે સરબે ભાગે લઈ, એટલીજ સાકર મેળવી, તેની રૂપિયાભાર જેવડી ગોળીઓ બનાવી, લેવાથી એસિડિટી મટે છે.
- \* કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
- \* ગંઠોડા અને સાકરનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.
- \* સૂંઠ, ખડી સાકર અને આમળાનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.
- \* અર્ધી લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી, અર્ધી ચમચી સાકર નાખી બપોરના જમવાના અર્ધી કલાક પહેલાં લેવાથી એસિડિટી મટે છે.
- \* ધાળા-જીરુંનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે. જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.
- \* ગાજરનો રસ પીવાથી એસિડિટી મટે છે.
- \* ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલી ૪-૫ નંગ કાળાં મરીનું ચૂર્ણમાં મેળવીને લેવાથી એસિડિટી મટે છે.
- \* ૧ થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ને ધાળા-જીરું ચૂર્ણમાં અથવા સુદર્શન ચૂર્ણમાં મેળવીને લેવાથી એસિડિટી મટે છે.
- \* તુલસીનાં પાનને દહીને છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- \* લીમડાંના પાન અને આમળાનો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી મટે છે.
- \* ધાળા અને સૂંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે.
- \* કુમળા મૂળા અને સાકર મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
- \* સતાવરીનું ચૂર્ણ મધ્ય સાથે લેવાથી એસિડિટી મટે છે.
- \* સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધવલૂણ નાખીને પીવાથી એસિડિટીમાં ઘણો ફાયદો થાય છે.

## અશક્તિ - નબળાઈ

- \* ગાજરનો રસ પીવાથી શરીરમાં સારી શક્તિ આપે છે. જેને અશક્તિ રહેતી હોય તેને ગાજરનો રસ ખૂબ ફાયદાકારક થાય છે.
- \* જમ્યા પઢી ત્રાણ-ચાર પાકાં કેળાં ખાવાથી અશક્તિ દૂર થાય છે.
- \* એક કપ દૂધમાં એક ચમચી મધ્ય નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે.
- \* અંજરને દૂધમાં ઉકાળીને ખાવાથી અને તે દૂધ પીવાથી શક્તિ આવે છે. લોહી વધે છે.
- \* ખજૂર ખાઈ, ઉપરથી ધી મેળવેલું ગરમ દૂધ પીવાથી, ધા વાગવાથી કે ધા માંથી પુષ્ણળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ-અશક્તિ દૂર થાય છે.
- \* રોજ સવારે અને રાત્રે સૂતી વખતે સાકર અને સોનામૂખી સરખે ભાગે લઈ ચૂર્ણ ફાકવાથી શક્તિ વધે છે.
- \* સફેદ કાંદો ચોખ્ખા ધી માં શેકીને ખાવાથી શારીરિક નબળાઈ, ફેફસાંની નબળાઈ, ધાતુની નબળાઈ દૂર થાય છે.
- \* મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.
- \* પાંચ પેશી ખજૂર ધી માં સાંતળીને ભાત સાથે ખાવાથી અને અર્ધો કલાક ઊંઘ લેવાથી નબળાઈ દૂર થઈ શક્તિ અને વજન વધે છે.
- \* એક સૂકું અંજર, પાંચ દસ બદામ અને સાકર દૂધમાં ઉકાળીને પીવાથી લોહીની શુદ્ધિ થઈ, ગરમી મટી, શરીરમાં શક્તિ વધે છે.
- \* દૂધમાં બદામ, પીસ્તા, એલચી, કેસર અને ખાંડ નાખી ઉકાળીને પીવાથી ખૂબ શક્તિ આવે છે.
- \* ચાણાના લોટનો મગસ, મોહનથાળ અથવા મૈસુર બનાવી રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દૂર થાય છે અને શક્તિ આવે છે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- \* ફણગાવેલા ચણા રોજ સવારે ખૂબ ચાવીને ખાવાથી શરીર બળવાન અને પુષ્ટ બને છે. કીમતી દવાઓ કરતાં આ ઉપાય સસ્તો અને સચોટ છે. પણ ચણા પચે તેટલા માપસર જ ખાવા.
- \* ધી માં શેકેલા કાંદા સાથે શીરો ખાવાથી માંદગીમાંથી ઉઠ્યા પઢી આવેલી અશક્તિ દૂર થઈ જલદી શક્તિ આવે છે.
- \* મેથીનાં કુમળાં પાનનું શાક બનાવીને ખાવાથી લોહીનો સુધારો થઈ શક્તિ આવે છે.
- \* સૂકી ખારેકનું ૨૦૦ ગ્રામ ચૂર્ણ બનાવી, તેમાં ૨૫ ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખી બાટલી ભરી દેવી. તેમાંથી ૫ થી ૧૦ ગ્રામ ચૂર્ણ ૨૦૦ ગ્રામ દૂધમાં ઉકાળી, તેમાં જરૂર જેટલી ખાંડ નાખી, સવારે પીવાથી શક્તિ આવે છે.

## અજીર્ણ-ભૂખ ન લાગવી

- \* જમ્યા પહેલાં આદુનું કચુંબર સહેજ સિંધવ-મીહું નાખીને ખાવાથી અજીર્ણ મટે છે અને ભૂખ સારી લાગે છે.
- \* કુદીનાના રસમાં સંચળ મેળવીને ચાટવાથી અજીર્ણ મટે છે.
- \* અધી ચમચી અજમો ને ચપટી સિંધવ-મીહું ને લીંબુના શરબતમાં મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.
- \* એક ગલાસ હુંફણા પાણીમાં એક ચમચી આદુનો રસ ને બે ચમચી મધ્ય મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.
- \* ભૂખ લાગતી જ ન હોય કે ભૂખ મરી ગઈ હોય તો દિવસમાં બેવાર અધી ચમચી અજમો ચાવીને કાવાથી ભૂખ ઉઘડશે.
- \* રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી અજીર્ણ મટે છે.
- \* પાકાં અનાનસના કકડા કરી તેની ઉપર સિંધવ-મીહું ભભરાવી ખાવાથી અજીર્ણ મટે છે.
- \* એક ચમચી લીંબુનો રસ, એક ચમચી આદુનો રસ અને સિંધવ-મીહું મેળવી પીવાથી અજીર્ણ મટે છે.
- \* લીંબુ કાપી, તેની ઉપર સિંધવ-મીહું ભભરાવી જમ્યા પહેલાં ચૂસવાથી અજીર્ણ મટે છે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- \* ચણા જેટલી હિંગ ધી સાથે લેવાથી અજ્ઞાં મટે છે.
- \* સૂંઠ, મરી, પીપર અને સિંધવ-મીહું સરખે ભાગે લઈ તેનું ચૂંઝું છાશમાં પીવાથી અજ્ઞાં મટે છે.
- \* કાંદાના રસમાં શેકેલી હિંગ અને મીહું મેળવીને પીવાથી આફરો મટે છે.
- \* લસણની કળી તેલમાં કકડાવીને ખાવાથી અથવા લસણની ચટણી બનાવીને ખાવાથી અરુચિ-મંદાળિ મટે છે.
- \* ક્રોકમનો ઉકાળો કરી, ધી નાખી, પીવાથી અજ્ઞાં મટે છે.
- \* મેથી અને સુવા સરખે ભાગે લઈ, બંનેને શેકી, અધકચરાં ખાંડી, અર્ધો-અર્ધો તોલો ફાકવાથી આફરો, ખાટાં ગચ્કરાં અને ઓડકાર મટે છે.
- \* પેટમાં ખૂબજ આફરો થયો હોય, પેટ ઢોલ જેવું થયું હોય અને પેટમાં દુખાવો થયો હોય તો કુંટીની આજુબાજુ અને પેટ ઉપર હિંગનો લેપ કરવાથી તરત આરામ થાય છે.
- \* લસણ, ખાંડ અને સિંધવ-મીહું સરખે ભાગે મેળવી, તેનાથી બમણું ધી મેળવી ખાવાથી અજ્ઞાં આફરો મટે છે.
- \* ટામેટાને સહેજ ગરમ કરી સિંધવલૂણ અને મરી છાંટીને ખાવાથી અજ્ઞાં મટે છે.

## આધાશીશી-માથાનો દુખાવો

- \* આદુનો રસ અને તુલસીનો રસ સુંધવાથી અને નાકમાં ટીપાં નાખવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
- \* લસણની કળીઓ પીસીને કાનપટી પર લેપ કરવાથી આધાશીશી મટે છે.
- \* દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.
- \* હિંગને પાણીમાં મેળવી નાકમાં ટીપાં નાખવાથી આધાશીશી મટે છે.
- \* સૂંઠને પાણીમાં ઘસી તેનો ઘસારો કપાળે લગાડવાથી આધાશીસી મટે છે.
- \* દૂધમાં ધી મેળવી, પીવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
- \* સૂરજ ઉગે તે પહેલાં ગરમાગરમ, તાજી, ચોખ્ખા ધી ની જલેબી ખાવાથી આધાશીશી મટે છે.
- \* માથું દુખતું હોય તો કપાળે ચોખ્ખું ધી ઘસવાથી માથું ઉતરે છે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- \* આમળાનું ચૂંઝું, સાકર અને ધી સરખે ભાગે લઈ ખાવાથી માથું દુખતું હોય તો ઉતરે છે.
- \* એક કપ પાણીમાં એક ચમચી દળદર નાખી, ઉકાળિને પીવાથી, તેનો વાક(નાસ) લેવાથી માથાનો દુખાવો મટે છે.
- \* ઠંડા દૂધમાં સૂંઠ ઘસીને, તે દૂધનાં ૩-૪ ટીપાં નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.
- \* અર્ધો ચમચો લીંબુનો રસ અને અર્ધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુખાવો મટે છે.
- \* માથું દુખતું હોય તો તુલસીનાં પાન અને અગરબતી વાટીને માથે ચોપડવાથી તરત જ માથું ઉતરે છે.
- \* નાળિયેરનું પાણી પીવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
- \* લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુખાવો મટે છે.
- \* લવિંગ અને તમાકુનાં પાન વાટીને માથા ઉપર લેપ કરવાથી આધાશીશીનું દર્દ (માઈગ્રેસ) મટે છે.
- \* નવશેકા પાણીમાં મીહું નાખી ઘસીને તેમાં બંને પગ પાણીમાં રાખવાથી ૧૫ મિનિટમાં માથાનો દુખાવો મટે છે.
- \* મરીને શુદ્ધ ધીમાં ટીપાં નાકમાં પાડવાથી આધાશીશી મટે છે.
- \* જલ ઉપર ચપટી મીહું મૂકી, દશ મિનિટ પછી એક જ્લાસ પાણી પીવાથી ગમે તેવો માથાનો દુખાવો મટે છે.

## અંગ જકડાઈ જવું

- \* અંગ જકડાઈ ગયું હોય તો, રાઈની પોટીસ લગાડવાથી ફાયદો થાય છે.
- \* પગના ગોટલા ચઢી જાય તો, કોપરેલ તેલ ગરમ કરી, માલિસ કરવાથી આરામ થાય છે.
- \* સરસિયાના તેલમાં કપૂર મેળવી માલિસ કરવાથી દુખતા સાંધા, ગરદન જકડાઈ જવી તથા સંધિવાના દર્દમાં આરામ થાય છે.
- \* તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખી, સહેજ ગરમ કરી, માલિસ કરવાથી કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, શરીરનું જકડાઈ જવું, લકવો વગેરે મટે છે.

- \* ધંતુરાના પાનને ૮૦૦ ગ્રામ રસ કાઢી, તેમાં ૧૦ ગ્રામ હળદર અને ૨૫૦ ગ્રામ સરસિયું તેલ નાખી, ગરમ કરી, રસ બાળી, માત્ર તેલ બાકી રાખો. આ તેલનું માલિસ કરવાથી શરીરનાં જકડાઈ ગયેલાં અંગો છૂટા પડી તકલીફ મટે છે.
- \* બે નાળિયેરનું કોપરનું કાઢીને, તેના નાના નાના ટુકડા કરી, ખાંડી નાંખવું. ખાંડેલા કોપરાને વાસણમાં ધીમે ધીમે ગરમ કરવું. તેલ છુટું પડશે. તે તેલ કર્યા પછી કપડામાં નીચોવીને ગાળી લેવું. બે નાળિયેરના નીકળેલા તેલમાં ત્રાશ થી ચાર મરીનું ચૂર્ઝ અને ત્રાશ લસણની કળી વાટીને નાખવી. આ તેલથી જકડાઈ ગયેલા ભાગ પર હળવા હાથે સવાર અને રાત્રે માલિસ કરવી અને તે પછી ગરમ રેતીનો શેક કરવાથી ખૂબ આરામ થાય છે.
- \* વાયુ કે કફ્ફિષથી કમરનો દુખાવો કે ડોક જકડાઈ ગઈ હોય તો થોડા પાણીમાં મરયાં નાખી, ઉકાળો કરી, તેમાં કપું બોળી, દર્દવાળા ભાગ પર ગરમ પોતાં મૂકવાથી આરામ મળે છે.

## હૃદયની બીમારી-બ્લડ પ્રેશર

- \* લસણ પીસીને દૂધમાં પીવાથી લોહીનું દબાણ, બ્લડ પ્રેશરમાં ખૂબ ફાયદો થાય છે. લસણ બ્લડપ્રેશરની રામભાણ દવા છે.
- \* બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ મેળવી સવાર-સાંજ પીવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે.
- \* એલચી દાણા અને પીપરમૂળ સરખે ભાગે લઈ ધી સાથે રોજ ખાવાથી હૃદયરોગ મટે છે.
- \* આદુનો રસ ને પાણી સરખે ભાગે મેળવીને પીવાથી હૃદયરોગ મટે છે.
- \* હૃદયના રોગીઓ ગાજરનો રસ નિયમિત પીવો, તેનાથી હૃદય મજબૂત બને છે અને હૃદયની કાર્યશક્તિ વધે છે.
- \* હૃદયનો દુખાવો ઉપડે ત્યારે તુલસીનાં આઠ-દસ પાન અને બે-ત્રાશ કાળાં મરી ચાવી જાદુ જેવી અસર થઈ દુખાવો મટે છે.
- \* છાતી, હૃદયમાં દુખાવો થતો હોય તો ૧૦ થી ૨૦ ગ્રામ તુલસીનો રસ ગરમ કરીને પીવો. પાનને વાટીને લેપ કરવાથી દુખાવો મટે છે.

## ઉધરસ-ખાંસી

- \* કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે.
- \* કાંદાનો ઉકાળો પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે.
- \* લીંબુના રસમાં તેનાથી ચારગણું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે.
- \* લવિંગને મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
- \* મરીનું ચૂર્ઝ દૂધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે.
- \* મરીનું ચૂર્ઝ સાકર-ધી સાથે મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે.
- \* એક ચમચી મધ અને બે ચમચી આદુનો રસ મેળવીને પીવાથી ઉધરસ મટે છે.
- \* થોડી છિંગ શેકી, તેને ગરમ પાણીમાં મેળવી, પીવાથી ઉધરસ મટે છે.
- \* દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
- \* લસણની કળીઓને કચરી, પોટલી બનાવી, તેની વાસ લેવાથી મોટી ઉધરસ (હુપિંગ) કફ મટે છે.
- \* લસણ ૨૦ થી ૨૫ ટીપાં રસ શરબતમાં મેળવી દિવસમાં ચાર કલાકને અંતરે પીવાથી મોટી ઉધરસ(હુપિંગ) કફ મટે છે.
- \* દાડમના ફળની છાલનો ટુકડો મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
- \* આમલીના કિચુકાને શેકી, તેનાં છોતાં કાઢી નાખી, કિચુકાનું બારીક ચૂર્ઝ બનાવી, મધ અને ધીમાં મેળવીને પીવાથી ઉધરસ-કફમાં લોહી પડતું હોય તો મટે છે.
- \* થોડી ખજૂર ખાઈ ઉપર થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ નીકળી જશે અને ઉધરસ તથા દમ મટે છે.
- \* ગરમ કરેલા દૂધમાં હળદર અને ધી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે.
- \* રાત્રે મીઠાની કાંકરી મોંમા મુકી રાખવાથી ઉધરસ ઓછી આવશે.
- \* હુંદીનાનો રસ પીવાથી ઉધરસ મટે છે.
- \* અરધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ છુટો પડી જાય છે અને ઉધરસ મટે છે.
- \* હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચાણ એક મુઢી જેટલા સવારે તથા રાત્રે સુતી વખતે ખાવાથી (ઉપરથી પાણી ન પીવું) કાયમી શરદી અને

## **તંદુરસ્તી તમારાં હાથમાં**

- \* ઉધરસ રહેતી હોય તે મટે છે.
- \* મીહું અને હળદરવાળો શેકેલો અજમો જમ્યા પણી મુખવાસ તરીકે ખાવાથી ઉધરસ અને શરદી મટે છે.
- \* હળદર અને સુંઠ સવાર-સાંજ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.
- \* હળદરને તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમા રાખી ચૂસવાથી કફની ખાંસી મટે છે.
- \* નવશેકા પાણી સાથે અજમો ફાકવાથી કફની ખાંસી મટે છે.
- \* તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસને છાતીનો દુખાવો મટે છે.
- \* રાત્રે થોડાક શેકેલા ચણા ખાઈને ઉપરથી પાણી પીધા વગર સુંઠ જવાથી ઉધરસ મટે છે.
- \* અરદુસીના પાનના રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે.
- \* ખાંડ સાથે બે ટીપાં કેરોસીન દિવસમાં ત્રણ વાર ચાટવાથી મોટી ઉધરસ મટે છે.
- \* કેળનાં પાનને બાળી ભસ્મ બનાવી, તે ભસ્મ દશ ગ્રામની માત્રામાં દિવસમાં ત્રણવાર મધ સાથે ચાટવાથી ઉંટાંટિયામાં રાહત થાય છે.

## **ચક્કર આવવા**

- \* વરિયાળી તથા ખાંડ સરખે ભાગે લઈ, ચૂર્ઝ બનાવી, સવાર-સાંજ લેવાથી ચક્કર બંધ થાય છે.
- \* મરીનું ચૂર્ઝ ધી અને સાકરમાં લેવાથી ચક્કર આવતા બંધ થાય છે.
- \* તુલસીના પાન સાથે મરી ચાવવાથી ચક્કર આવતા બંધ થાય છે.
- \* ભસમાં ચક્કર આવતા હોયતો તજ અથવા લવિંગ મોંમા રાખવા, આંખો બંધ રાખવી.
- \* હિંગને શેકીને પાઉડર બનાવવો. તેમાંથી થોડી હિંગ સુવાવડી સ્ત્રીને ધી સાથે અથવા પાણી સાથે આપવાથી તેને આવતા ચક્કર તથા પેટનો દુખાવો બંધ થાય છે.

## **જાડા-મરડો**

- \* ગાજરનો રસ પીવાથી જાડા બંધ થાય છે.
- \* ચીકુની છાલનો ઉકાળો પીવાથી જાડા બંધ તાય છે.
- \* ખજૂરના ઠણિયાની રાખ કરી, ઠંડા પાણી સાથે પીવાથી જાડા બંધ થાય છે.

## **તંદુરસ્તી તમારાં હાથમાં**

- \* એલચીનાં છોડાની રાખ મધમાં ચાટવાથી જાડા બંધ થાય છે.
- \* સહેજ ગરમ પાણીમાં થોડું મીહું અને લીંબુનો રસ પીવાથી જાડા અને મરડો મટે છે.
- \* તુલસીનાં પાંચ પાન અને સંચળ બે ગ્રામ દહીમાં મેળવીને ખાવાથી જાડા અને મરડો મટે છે.
- \* માખજા, મધ અને ખડી સાકર મેળવીને ખાવાથી મરડો મટે છે.
- \* કેરીની ગોટલી છાશ અથવા ચોખાના ઓસામજામાં વાટીને લેવાથી મરડો મટે છે.
- \* મરીનું ચૂર્ઝ છાશમાં લેવાથી મરડો મટે છે.
- \* મેથીનો લોટ દહીમાં ખાવાથી મરડો મટે છે.
- \* મેથીની ભાજીના રસમાં કાળી દ્રાક્ષ મેળવીને પીવાથી મરડો મટે છે.
- \* આદુનો રસ દૂંટીએ ચોપડવાથી જાડા મટે છે.
- \* ગરમ પાણી સાથે સુંઠ ફાકવાથી અથવા સુંઠનો ઉકાળો બનાવી, તેમાં રૂપિયાભાર એરંડિયું નાખીને પીવાથી મરડો મટે છે.
- \* લીંબુના રસને ગરમ કરી, તેમાં સિંધવ અને ખાંડ મેળવીને પીવાથી મરડો મટે છે.
- \* અજમો, હરડે, સિંધવ અને હિંગની ફકી લેવાથી મરડો મટે છે.
- \* અંદરજવને તવી પર સેકી, તેને બારીક વાટી, ઠી તોલો દિવસમાં બે વાર લેવાથી મરડો મટે છે.
- \* આંબાનાં (મરવા) સૂકાં ફૂલોનું ચૂર્ઝ ગમે તેવો જૂનો મરડો મટાડે છે.
- \* મઠ બાઝીને તેમાં છીણેલા કાંદા મેળવીને ખાવાથી જાડામાં પડતું લોહી બંધ થાય છે.
- \* કાંદાને બારીક વાટી, ત્રણ-ચાર વાર પાણીથી ધોઈ, દહી સાથે ખાવાથી જાડામાં પડતું લોહી બંધ થાય છે.
- \* થોડા તલ અને સાકર વાટી, મધમાં ચાટવાથી જાડામાં પડતું લોહી બંધ થાય છે.
- \* કોકમનું ધી ગરમ કરીને, દિવસમાં બે-ત્રણ વાર બજ્બે તોલા જેટલું પીવાથી લોહીવાળો મરડો મટે છે.
- \* સુંઠનું ચૂર્ઝ છાશમાં મેળવીને બજ્બે કલાકે લેવાથી જાડા બંધ થાય છે.

- \* કાચું પપૈયું પાણીમાં ઉકાળીને ખાવાથી જાડા બંધ થાય છે.
- \* જાયફળ પાણીમાં ઘસીને, અડધી ચમચી જેટલું, સવાર-સાંજ ચાટવાથી જાડા બંધ થાય છે.

## વાળની માવજત

- \* વાળ ખરતા હોય તો દિવેલ ગરમ કરી વારંવાર વાળ પર લગાડવાથી વાળ ખરશે નહિએ.
- \* માથા પર કાંદાનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઉગે છે.
- \* આમળાં, કાળા તલ, ભાંગરો અને બ્રાન્ઝી સરખે ભાગે લઈ, વાટીને પાઉડર બનાવી, રોજ સવાર-સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.
- \* ખાંડ અને લીંબુનો રસ બંને ભેગા કરી, માથું ધોવાથી જૂને ખોડો મટે છે.
- \* ચણાને છાશમાં પલાળીને, ચણા એકદમ પોચા થાય ત્યારે, માથા ઉપર મસળીને બે કલાક પદ્ધી માથું ધોવાથી જૂને ખોડો મટે છે.
- \* તલના ફૂલ, ગોખરૂ અને સિંધવને કોપરેલમાં અથવા મધમાં નાખી તેનો લેપ કરવાથી માથાની ટાલ મટે છે.
- \* પાશેર કોપરેલમાં ખોબો ભરીને મેંટીનાં પાન ઉકાળવાં. તે તેલ રોજ ચોળીને માથામાં લગાડવાથી માથાના વાળ ખૂબ વધે છે અને કાળા પણ થાય છે.
- \* કાંદાનો રસ માથામાં ભરવાથી જૂને જાય છે.
- \* લીમડાંના પાનને પાણીમાં વાટીને, તે પાણીથી માથું ધોવાથી માથાનો ખોડો મટે છે.
- \* વાળ ખરી પડતા હોય ત્યારે ગોરાળું માટી-લીંબુના રસમાં મેળવીને ચોપડવાથી વાળ ખરતા અટકે છે.
- \* છાલ સાથેની કાકડી ખાવાથી વાળ પર ચમક આવે છે.
- \* ગરમ પાણીમાં આમળાંનો ભૂકો નાખી ઉકાળો, એ પાણીથી વાળ ધોવામાં આવે તો વાળ સુંદર અને ચમકતા બને છે.
- \* માથાના વાળ ખરતા હોય તો, ૫૦૦ ગ્રામ શુદ્ધ કોપરેલમાં ૨૦૦ ગ્રામ સૂકી મેથી નાખી, સૂર્યના તડકામાં સાત દિવસ રાખો. ત્યારબાદ તે તેલ ગાળીને બાટલીમાં ભરી લો. આ તેલ સવાર-સાંજ માથામાં ઘસવાથી વાળ ખરતા બંધ થાય છે. વાળ કાળા થાય છે તથા નવા વાળ ઉગે છે.

## લકવા

- \* લકવો થયો હોય તો મધ સાથે લસણ પીસી ચાટવાથી આરામ તાય છે.
- \* લસણાની એક કળી ગળવાની શરૂઆત કરી, દરરોજ એક-એક વર્ધારતા જઈ, ચાળીસમાં દિવસે ૪૦ કળીઓ ગળવી અને એજ રીતે એક એક કળી ઓછી કરતા જઈ, બીજા ચાળીસ દિવસો સુધી (કુલ ૮૦ દિવસ સુધી) કળીઓ ગળવાથી લકવો મટે છે.
- \* કૌચાના બીજ ૧ ડિલો લઈ, સાંજે પાણીમાં પલાળો સવારે તેનાં ફોતરાં ઉખાડીને તેનો ગર્ભ કાઢી તે ગર્ભ તડકામાં સૂકવી દો. સૂકાયા બાદ તેનું ચૂર્ઝ બનાવી ત્રણ ગ્રામ ચૂર્ઝ સાથે ૧ ગ્રામ અશ્વંધાનું ચૂર્ઝ મેળવી, રોજ સવારે ભૂખ્યા પેટે ગરમ દૂધ સાથે અને રોજ સાંજે જમ્યા પહેલાં ગરમ દૂધ સાથે લેવાથી લકવા તથા સંધિવામાં દર્દીને ફાયદો થાય છે.

## ચામડીના રોગો

- \* જિલ્સરીન, ગુલાબજળ અને લીંબુનો રસ સરખે ભાગે લઈ શીશીમાં ભરી રાખો. આ મિશ્રણની માલિસ કરવાથી ચામડી સાફ બનશે. હાથપગમાં ચીરા પડ્યા હોય તે મટે છે.
- \* મૂળાના રસમાં થોડું દહી મેળવી ચહેરા ઉપર લગાડવાથી ચહેરો સુંવાળો, ચમકીલો બને છે.
- \* એક તેલ ગરમ અથવા ઠંડા પાણીમાં એક લીંબુ નીચોવી તેનાથી સ્નાન કરવાથી ચામડી સુંવાળી થાય છે અને ચમક આવે છે.
- \* કારેલીનાં પાનનો રસ ચોપડવાથી ચામડીના કોઈપણ રોગ મટે છે.
- \* તલના તેલને સહેજ ગરમ કરી રોજ માલિસ કરવાથી ફીકી ચામડી ચમકતી થાય છે.
- \* કાકડીને ખમણીને તેનો રસ ચોપડવાથી ચીકાશવાળી તેમજ ચીમળીયેલી ચામડી સુંવાળી બને છે.
- \* હાથ કે પગની ચામડી ફાટે ત્યારે વડનું દૂધ લગાડવાથી મટે છે.
- \* સંતારાની છાલને સૂકવી, તેનો પાઉડર કરી, ગુલાબજળમાં મેળવી, તેને મોંઢા પર લગાડી અર્ધો કલાક રહેવા દઈ, પદ્ધી ધોવાથી ચામડી મુલાયમ બનશે. ડાઘા નીકળી જશે અને ચહેરાની કરચલી નીકળી જશે.

## **તંદુરસ્તી તમારાં હાથમાં**

- \* હાથ કે પગમાં ચીરા પડ્યા હોય, અણાઈ થઈ હોય તો એક લીંબુનો રસ તેનાથી ત્રાશ ગણું તેલ અથવા કોપરેલ મેળવી લગાડવાથી રાહત થાય છે.
- \* ચણાના લોટમાં પાણી અને થોડું ઘી મેળવી શરીર પર અને મોંઢા પર માલિસ કરવાથી ચામડી ગૌરવર્ણની અને તેજસ્વી બને છે.
- \* દાઝી ગયેલી ચામડી પર સફેદ ડાઘ રહી જાય છે અને તેના ઉપર રૂને મધમાં ભીજવી પાટો બાંધવાથી ડાઘ નીકળી જાય છે.
- \* દૂધ અને દીવેલને સરખે ભાગે લઈ નિયમિત શરીર પર માલિસ કરવાથી શરીર પર કરચલી દૂર થાય છે.
- \* લીમડાના ૧૦૦ પાન લઈ તેનું ચૂર્ઝ દ મહિના સુધી લેવાથી સફેદ કોઢ મટી જાય છે.
- \* રોજ સવારે બજે તોલા મધ ઠંડા પાણીમાં મેળવી પીવાથી ચામડીના રોગો જેવા કે દાહ, ખંજવાળ, ફોલ્ટ્વી મટે છે.
- \* ચોખાના ધોવાણને થોડીક હળદર મેળવીને ચહેરા પર તથા શરીર પર માલિસ કરી પછી સ્નાન કરવાથી શરીર અને ચહેરાની સુંદરતા વધે છે.
- \* દૂધની મલાઈનો લેપ સ્નાન કરતા પહેલાં અર્ધા કલાક અગાઉ ચહેરા પર કરવો. સુકાયા બાદ મોંઢા પર હાથથી માલિસ કરવું. જેથી બધી મલાઈ ચહેરાનો મેલ લઈ, પોપડા થઈ, ઉખડી જશે અને ચામડી ગોરી, તકતકતી અને લીસ્સી બનશે.
- \* બટાટાની છાલને શરીર પર ઘસવાથી ચામડી સુંવાળી થાય છે.
- \* રસ કાઢી લીધેલાં લીંબુના ફાડિયાં ચહેરા પર ઘસવાથી ચામડી સહેજ તમતમે છે પરંતુ ચહેરાની લાલી એકદમ આવે છે. થોડીવાર મોં પર છાલ ઘસી પછી ઠંડા પાણીએ મોં ધોઈ નાંખવું. તેથી પસીનાના મેલથી બંધ પડેલાં ચામડીનાં છિદ્રો ખુલ્લાં થઈ જાય ને ચહેરા પર લોહી ફરવા લાગે અને લાલી આવે.
- \* જેનો રંગ શામળો હોય, ચહેરો દેખાવડો ન હોય તે જો આમળાંના ચૂર્ઝને હળદર પાઉડર સાથે મેળવી, દૂધમાં કાલવી, સ્નાન કરતી વખતે મોંઢા પર ઘસીને ચોળો તો તેનાથી લાંબા સમયે દેખાવડા થવાય છે.
- \* ગરમ પાણીમાં આમળાંનો ભૂકો નાખી, ઉકાળી તે પાણીથી સ્નાન કરવાથી ચામડી મુલાયમ બને છે.

## **તંદુરસ્તી તમારાં હાથમાં**

- \* દૂધમાં લીંબુનો રસ મેળવી સવાર-સાંજ ચહેરા પર માલિસ કરવાથી ચહેરો સ્વચ્છ, કોમળ અને ચમકદાર બને છે. આખા શરીરે માલિસ કરવાથી શરીર તંદુરસ્તભર્યું બને છે.
- \* એક શેર પાણીને ઉકાળીને ૧૦ શેર બનાવી દીધા બાદ તેમાં સરખે ભાગે જિલ્સરીન અને લીંબુન રસ નાખી એક શીશીમાં ભરી રાખવું અને ખૂબ હલાવી એકસરખું મિશ્રણ કરવું. આનાથી દિવસમાં બે-ગ્રાશ વાર મોં પર માલિસ કરવાથી મોં પરના ડાઘા અને મેલ નીકળી જાય છે. ઠંડીમાં આ મિશ્રણથી ચામડી તરડાતી નથી અને ગરમીમાં એનાથી ઠંડક રહે છે, આ મિશ્રણની સ્નો વાપરવાની જરૂર પડતી નથી.
- \* કેટલાકને ચહેરો સુગંધિત બનાવવા સ્નો વાપરવાની ટેવ હોય છે. તેને બદલે સ્નાન ક્રયા બાદ બે ટીપાં સુખડના તેલનાં મોંઢા પર ઘસવાથી સુગંધ આવે છે અને ચામડીને ઠંડક આપે છે.
- \* અણાઈ થઈ હોય તો હરરે અને ફટકડીનું પાણી બનાવી તે અણાઈ પર રોજ લગાડવાથી તરત ફાયદો થાય છે.
- \* શિયાળામાં હાથપગની આંગળીઓની વચ્ચે ચળ આવે અને ચામડીમાં ચીરા પડે તો ઘઉંના ભૂસામાં એક ચમચી મીઠું નાખીને પાણી નવશેરું ગરમ કરી આ પાણીમાં હાથપગ રાખીને શેક કરવાથી ચળ મટે છે.

## **ઉલટી**

- \* ફુદીનાનો રસ પીવાથી ઉલટી મટે છે.
- \* રાઈને જીણી વાટી, પાણીમાં પલાળી, પેટ પર લેપ કરવાથી ઉલટી મટે છે.
- \* મરી અને મીઠું વાટીને ફાકવાથી ઉલટી મટી જાય છે.
- \* ગોળને મધમાં મેળવીને લેવાથી ઉલટી મટે છે.
- \* આદુનો રસ ને કાંદાનો રસ મેળવીને પીવાથી ઉલટી મટે છે.
- \* સૂંદ અને ગંઠોડાનું ચૂર્ઝ મધમાં ચાટવાથી ઉલટી મટે છે.
- \* મીઠા લીમડાનાં પાનનો ઉકાળો પીવાથી ઉલટી મટે છે.
- \* તજનો ઉકાળો પીવાથી ઉલટી મટે છે.
- \* લીંબુ કાપી તેના ઉપર ખાંડ ભભરાવીને ચૂસવાથી અન્નવિકારથી થતી ઉલટી મટે છે.

- \* શેરડીનો રસ પીવાથી પિતની ઉલટી મટે છે.
- \* તુલસી અને આદુનો રસ મધ્ય સાથે લેવાથી ઉલટી મટે છે.
- \* એલચી અને તુલસીનાં પાન ખાવાથી ઉલટી મટે છે.
- \* એલચીના દાણા વાટીને ફાકી મારવાથી અથવા મધ્યમાં ચાટવાથી જવ ડોળાતો હોય કે ઉલટી થાય તેવું લાગતું હોય તો તે મટે છે.
- \* લીંબુ કાપી, તેના ઉપર સૂંઠ, સિંધવ-મીહું નાખી, ગરમ કરી ચૂસવાથી અજ્ઞાની ઉલટી મટે છે અને ખાટા ઓડકાર મટે છે.
- \* એક એક તોલો દ્રાક્ષ અને ધાણા વાટી પાણીમાં એકરસ કરી પીવાથી પિતની ઉલટી મટે છે.
- \* આમલીને પાણીમાં પલાળી તેનું પાણી ગાળીને પીવાથી પિતની ઉલટી મટે છે.
- \* કાંદાનો રસ થોડા પાણીમાં એક કલાક પછી પીવાથી અપચાને લીધે થતી ઉલટી મટે છે.
- \* ચોખાના ધોવાશમાં જાયફળ ઘસીને પીવાથી ઉલટી-ઉબકા મટે છે.
- \* મમરાનો ઉકાળો બનાવી તેમાં ૨-૪ એલચી, ૨-૩ લવિંગ તથા સાકર નાખી ૫-૭ ઉભરા આવવા દઈ, ઉતારીને ઠંડુ પારી લો. તે પાણી ગાળીને ૧-૨ ચમચી લીંબુ નીચોવીને અને બરકનો ટુકડો નાખીને પીવાથી ઉલટી મટે છે.
- \* અર્ધો કપ ગરમ પાણીમાં ૧ ગ્રામ ખાવાનો સોડા નાખી પીવાથી ઉલટી મટે છે.
- \* ગાડી કે મોટરબસની મુસાફરીમાં ચક્કર આવે અથવા ઉલટી થવા માંદે ત્યારે મૌંમા લવિંગ અથવા તજ રાખી ચૂસવાથી ચક્કર અને ઉલટી બંધ થાય છે.

### **મધ્ય અને તજનાં મિશ્રણથી અનેક રોગો મટે છે.**

જગતનાં લગભગ તમામ પ્રદેશોમાં મધનું ઉત્પાદન થાય છે. આયુર્વેદિક તથા યુનાની દવાઓમાં સદીઓથી મધનું એક દવા તરીકે વિશેષ મહત્વ સ્વિકારવામાં આવ્યું છે. હાલનાં વિજ્ઞાનિકોએ પણ મધને અનેક બિમારીઓને નસાડતી એક રામભાણ મેડિસીન તરીકે કબુલ કરી છે. અધ્યતન વિજ્ઞાનના તાજેતરનાં સંશોધનથી જાણવા મળ્યું છે કે શુદ્ધ મધ્ય સાથે ગરમ મસાલામાં ઉપયોગમાં લેવાતા તજ(સીનેમોન) નાં પાવડર સાથેનું મિશ્રણ નિયમિત લેવામાં આવે તો અનેક રોગોને મટકે છે.

ઉપરાંત મધ્ય એક એવું ઔષધ થે કે તેનો ગમે તેવી બિમારીમાં બેધડક પણે ઉપયોગ કરી શકાય છે. મર્યાદામાં દવા તરીકે લેવાએલું મધ્ય મીઠાશવાળું હોવા છતા મીઠી પેશાબ(ડાયાબિટીઝ) નાં દર્દીઓને પણ નુકશાન કરતું નથી તેમ આજનું સંશોધન કહે છે.

કેનેડાથી પ્રસિદ્ધ થતા અઠવાડિક વીકલી વલ ન્યુઝ ના તારીખ ૧૭ મી જાન્યુઆરી ૧૯૮૫ ના અંકમાં પશ્ચિમનાં વિજ્ઞાનિકોએ કરેલ પ્રયોગમાં મધ્ય સાથે તજ નો ભૂકો ભેગો કરી લેવાથી કેવા કેવા રોગ મટે છે તે વિષે વિસ્તૃત માહિતી આપી છે. અંગ્રેજમાં અપાએલી માહિતીનો ભાવાનુવાદ વાંચકો માટે અહીં ૨૪ કર્યો છે.

### **ARTHRITS આર્થરાઈટીસ (શરીરના દુખાવા માટે) :**

એક ભાગ મધ્ય અને બે ભાગ નવશેકા પાણીનું મિશ્રણ બનાવી તેમાં એક નાની ચમચી તજનો ભૂકો નાખી શરીરનાં દુખતા ભાગ ઉપર ધીમે ધીમે તેની માલિશ કરવાથી એકાદ મીનીટમાં જ તે દુખાવો બંધ થાય છે અને દર્દીને તાત્કાલીક રાહત મળે છે.

અથવા આર્થરાઈટીસના દર્દીઓ દરરોજ સવારે અને સાંજે એક કપ ગરમ પાણીમાં મધનાં બે ચમચી અને એક નાની ચમચી તજનાં પાવડરને ભેળવી નિયમિત પીવે તો ગમે તેવા સાંધાનાં દુખાવામાં રાહત મળે છે.

કૉપનહેગન ખાતેની યુનિવર્સિટીમાં તાજેતરમાં કરવામાં આવેલા એક પ્રયોગ મુજબ ત્યાંના ડોક્ટર્સે દરરોજ સવારે નાસ્તાનાં પહેલા અંદાજે ૨૦૦ આર્થરાઈટીસના દર્દીઓને એક ચમચો મધ્ય અને અર્ધો ચમચો મધને તજનાં પાવડરને ભેગું કરી સીરપ બનાવી પીવરાવવાનું શરૂ કર્યું હતું. એકાદ અઠવાડિયામાં લગભગ ૭૩% દર્દીઓને દુખાવો મટી ગયો હતો અને એક મહિનામાં તો લગભગ બધા જ દર્દીઓ ચાલી શકતા નહોતા તેઓ વગર દુખાવો હતો ચાલતા ચાલતા થઈ ગયા હતા.

### **HAIR LOSS માથાના વાળ ખરવા**

જેઓનાં માથાના વાળ ખરતા હોય તેવા લોકો ગરમ કરેલ ઓલીવનાં તેલમાં એક ચમચી મધ્ય અને એક ચમચી તજનાં પાવડર મેળવી નહાતા પહેલા માથામાં બરાબર ચોળી પછી અંદાજે પાંચેક મીનીટ પછી જો નહાવાનું રાખે તો તેના વાળ ખરતા બંધ થશે.

## **BLADDER INFECTIONS બ્લેડરનાં સોજ અને ચેપ માટે :**

એક જ્વાસ નવશેકા પાણીમાં બે ચમચા તજનો પાવડર તથા એક ચમચો મધ મેળવીને પીવાથી બ્લેડર (વૃષણ)નાં ચેપી જંતુઓનો નાશ થશે અને કદાચ જો ચેપ હઠીલો હોય તો પાણીને બદલે સેનબરી જ્યુસ સાથે લેવાથી ગમે તેવો હઠીલો ચેપ દૂર થશે અને દુઃખાવામાં રાહત મળશે.

## **TOOTHACHE દાંતનો દુઃખાવો :**

એક ભાગ તજનાં ભૂકામાં પાંચ ભાગ મધ ઉમેરી તેને દુઃખતા એવા કોઈ પણ દાંત ઉપર ઘસવાથી કે ચોપડવાથી દાંતના દુઃખાવામાં રાહત મળે છે. જ્યાં સુધી દુઃખાવો ઓછો ન થાય ત્યાં સુધી આ પ્રયોગ દરરોજ દિવસમાં ત્રણ વખત કરવો.

## **CHOLESTROL કોલસ્ટેરોલનો ઘટાડો :**

સોળ આઉંસ જેટલા ચાનાં પાણીમાં બે ચમચી મધ અને ત્રણ ચમચી તજનો પાવડર મેળવી દર્દીને પીવરાવવામાં આવતા તેના બે કલાકમાં જ લોહીમાંના કોલસ્ટેરોલનું પ્રમાણ ૧૦% જેટલું ઘટી જવા પામ્યું હતું.

સંશોધનમાં જગ્યાવ્યા પ્રમાણે દિવસમાં જો ત્રણ વખત આ રીતે રહેલું કોલસ્ટેરોલ કે ચરબીનું પ્રમાણ સંપૂર્ણપણે અંકુશમાં આવે છે. તેવો રીપોર્ટ પ્રય્યાત તેનીશ મેડીકલ જર્નલમાં ડૉક્ટર એલેક્ઝાન્ડર ઑન્ડ્રેવ તથા એરીક વૉગલમેને કર્યો છે.

ઉપરાંત આ જર્નલમાં એક વધુ માહિતી પણ પ્રસિધ્ય થઈ છે કે દરરોજ ચોખ્યું મધ પોતાનાં ખોરાકમાં લેવાથી કદી કોલેસ્ટોરોલની ફરીયાદ રહેતી નથી.

## **COLD શરદી :**

જેઓને સામાન્ય કે સખત શરદી થઈ હોય તેઓ એક ચમચા જેટલું મધ લઈ તેન નવશેકું ગરમ કરવું અને ૦૧ ચમચી જેટલા તજનાં પાવડર સાથે મિશ્રણ કરી દિવસમાં ત્રણ વખત ચાટવું. આ પ્રયોગ ગમે તેવી હઠીલી ખાંસી, શરદી અને સણેખમ ઘડીવારમાં દૂર કરશે. ઉપરાંત શરદીને કારણે જો ગળું સુકાતું હશે તે પણ સારું થશે.

## **INFERTILITY સ્ત્રી બીજની ફળકુપતા માટે :**

વર્ષોથી આયુર્વેદમાં તથા યુનાની દવામાં સ્ત્રી તથા પુરુષની મૈથુન શક્તિને બળવાન કરવા માટે મધનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત તેનાં નિયમિત સેવનથી પુરુષનાં શુકાણુમાં પણ બળ આવે છે તેમ યુનાની હક્કિમોએ લખ્યું છે. દરરોજ રાતે સુતી વખતે નિયમિત પણે બે ચમચા મધનું સેવન કરવાથી ગમે તેવા નપુસંક પણ શારીરીક સમાગમની ઈચ્છા કરતા થઈ જાય છે તેવું શાસ્ત્રોમાં જગ્યાવ્યું છે.

આ ઉપરાંત ચીન, ભારત તથા દૂર પૂર્વના દેશોમાં બાળકો ન રહેતા હોય તેવી સ્ત્રીઓ સ્ત્રીબીજને તેનાં અંડકોષને શક્તિશાળી બનાવવામાં દવા તરીકે સદીઓથી તજનો ઉપયોગ કરવામાં આવે છે.

બાળક ન રહેતા હોય તેવી પરિસ્થિતિમાં સ્ત્રીઓએ તજનો પાવડર થોડા સરખા મધ સાથે મેળવી તેનું ચાટણ (પેસ્ટ) બનાવવું. અને તેને દિવસમાં વારંવાર દાંતના પેઢા ઉપર ચોપડતા રહેવું જેથી ધીમે ધીમે તે ચાટણ મોં વાટે શરીરમાં દાખલ થતું રહેશે.

અમેરિકાનાં મેરીલેંડના પરણેલા એક યુગલને છેલ્લા ચૌદ વર્ષોથી બાળક થતા નહોતા. તેઓએ બાળક થવાની આશા ધોડી દીધી હતી. પરંતુ કોઈએ જ્યારે આ પ્રયોગ પ્રમાણે મધનું તથા તજનાં ભૂકાવાળા મિશ્રણનું સેવન કરવા માટે ચિંધતા તેઓ પતિ પત્ની એમ બંનેએ ધીરજપૂર્વક આ પ્રયોગ શરૂ કરતા થોડા સમય બાદ તે સ્ત્રીને ગર્ભ રહ્યો હતો અને પુરા મહીને તેણીએ જોડક બાળકોને જન્મ આપ્યો હતો.

## **SET STOMACH પેટનાં દુખાવા માટે :**

વર્ષોથી મધનો ઉપયોગ અપચાની રાહત તથા પેટનાં દુખાવાને દૂર કરવા માટે વૈદી તમજ હક્કિમો કરતા આવ્યા છે. જો મધ સાથે તજનો પાવડર મેળવી ચાટતા પેટમાંના અલ્સરનો પણ જરૂરથી નાશ કરે છે.

## **HEART DISEASE હૃદયરોગવાળા દર્દીઓ માટે :**

દરરોજ નાસ્તામાં બ્રેડ ચા રોટલી સાથે જેલી કે જામને બદલે મધ અને તજનાં પાવડરનો બનાવેલ પેસ્ટ ચોપડી નિયમિત લેવાથી શરીરમાં તથા લોહી વહન કરતી નસોમાં ભેગા થતા ચરબીના ભરાવાને તથા ચરબીના ગમે તેટલા જાડા

## **તંદુરસ્તી તમારાં હાથમાં**

થરને ઓગાળી નાખી સેવન કરનાર વ્યક્તિને હૃદયરોગથી તો બચાવે જ છે, એટલુંજ નહીં પરંતુ જેઓ એકાદ વખત પણ હાઈ એટેકનાં હુમલાનો ભોગ બની ચુક્કા હોય તેઓને બીજા એટેકથી જોજનો દૂર રાખે છે.

ઉપરાંત આ પ્રયોગનાં નિયમિત સેવનથી હૃદયના ધબકવાથી શક્તિમાં બળ મળે છે. જેથી શ્વાસ ચડવાની તકલીફથી પણ આરામ થાય છે.

અમેરિકાના તથા કેનેડાના અનેક નર્સિંગ હોમમાં દર્દીઓ પર કરવામાં આવેલા સફળ પ્રયોગો બાદ એક વધુ તારણ પણ પ્રામ થયું છે કે જેમ જેમ ઉમર વધતી જાય છે તેમ તેમ લોહી વાહિનીઓ સખત અને બરછટ બનતી જાય છે તેમજ તેની ફ્લેક્સીબિલીટી (સ્થિતીસ્થાપકતા) ઘટતી જાય છે. મધ અને તજનાં પાવડરનું નિયમિત સેવન કરવાથી લોહીવાહિની બરછટ તથા સખત બનતી અટકે છે તેમજ ઉમરના હિસાબે તેની સ્થિતીસ્થાપકતામાં જે સખતાઈ આવે છે તેમાં ધીમે ધીમે ચમક આવતી થાય છે.

### **IMMUNE SYSTEM ચેપી જીવાધ્યાંઓ (બેક્ટેરીયા)થી શરીરનું રક્ષણ :**

નિષ્ણાંત ડાક્ટરો અને સંશોધકોનું મંત્ર છે કે, મધ અને તજના પાવડરનું નિયમિત સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ત્રણ ગણો વધારો થાય છે. અને બેક્ટેરીયા કે રોગ વાયરસનાં હુમલાઓથી શરીરનું રક્ષણ થાય છે.

સંશોધકોનું તારણ છે કે મધ વિપુલ પ્રમાણમાં વિવિધ પોષકતા (વીટામીનો) નો તથા ખનીજો સમાયેલ છે પરિણામે તેનું સેવન કરનારનાં લોહી રોગપ્રતિકાર કરતા જે શૈતકણો (વ્હાઇટ સેલ) હોય છે તેને બળ મળે છે. અને શરીરમાંના બેક્ટેરીયા તથા વાયરસોને મારી હટાવી નાશ કરે છે.

### **NDEGESTION અપચો :**

બે ચમચા ભરેલા મધ ઉપર તજનો થોડો ભુકો છાંટી જમણ પહેલા ખાઈ જવાથી એસીરીટીનાં કારણે થતી હૃદય કે છાતીની બળતરા દૂર થાય છે. ઉપરાંત ગમે તેટલા ભારે ખોરાક પણ પચાવી નાખે છે.

### **INFLUENZA ઇન્ફ્લુઅન્ઝા :**

સ્પેઈનનાં દેશનાં એક સંશોધનકાર અભ્યાસિઓએ સાબિત કર્યું છે કે મધમાં એક પ્રકારનાં કુદરતી તત્વો છે કે જે ઇન્ફ્લુઅન્ઝાનાં જિવાધ્યાને મારી હટાવે છે. અને ગમે તે ઉમરની વ્યક્તિઓને ફૂલુની બિમારીથી બચાવે છે.

## **તંદુરસ્તી તમારાં હાથમાં**

### **LONGEVITY લાંબી ઉંમર :**

મધ તથા તજનાં ફૂકાની બનાવેલી ચા પીનારા કદી વૃદ્ધ થતા નથી તેમ ચીન, જાપાન તથા મધ્યપૂર્વનાં હકીમોનો દાવો છે.

ચાર ચમચા જેટલું મધ અને એક ચમચો તજનાં ભૂકાને ત્રણ ક્રપ જેટલા પાણીમાં ઉકાળી તેની ચા બનાવવી અને દિવસમાં ત્રણ ચા ચાર વખત ૦૧ -૦૧ ક્રપ દરરોજ પીવાથી શરીરની ચામડીનાં કોષો યુવાન રહે છે. ઉંમર વધવા છતાં ચામડી ઢીલી પરી જરૂર લબડતી નથી. અને ઉતાવળે વૃદ્ધ્યાવરસ્થા આવતી નથી આયુષ્માં વધારો શક્ય છે અને સો વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિ પણ પોતાની યુવાનીમાં કરી શકતી હતી તેવું કામ કરી શકે છે.

### **PIMPLES મોં ઉપરની ખીલ (પીપંલ) :**

ત્રણ ભરેલા ચમચા મધને એક ચમચા જેટલા તજના ભુકામાં મેળવી પેસ્ટ બનાવવાનું અને દરરોજ રાતે સુતી વખતે ચહેરા ઉપર જ્યાં ખીલ થયા હોય તે પર બરાબર મસળી સુઈ જવું અને બીજી સવારે વહેલા ઉઠી ચણાના લોટથી ચા સાદા ગરમ પાણીથી ચહેરાને ધોઈ નાખવો. આવી રીતે સતત બે અઠવાડીયા સુધી કરવાથી ગમે તેવી હઠીલી ખીલને જડમૂળથી નાથ થાય છે.

### **SKIN INFECTIONS ચામડીનાં વિકાર ઉપર :**

ખસ, ખુજલી, ગુમળા કે ચણ આવવા જેવા ચામડીના કોઈ પણ રોગ ઉપર મધ તથા તજનો ભૂકો સરખે ભાગે મેળવી શરીરનાં તે ભાગ ઉપર ચોપડવાથી થોડા દિવસોમાં જ ચામડી જન્ય રોગોનો નાશ થાય છે.

### **WEIGHT LOSS વજન ઘટાડો :**

ગમે તેવું જાહુ કે ચરબીવાળું શરીર હોય પણ જો તે વ્યક્તિ દરરોજ સવારે નાસ્તો લીધા પહેલા અર્ધા કલાકે ખાલી પેટે, દરરોજ રાતે સુતા પહેલાં મધ અને તજનાં પાવડરનો એક ક્રપ જેટલો ઉકાળો પીવાની આદત રાખે તો તે વ્યક્તિ પોતાના શરીર ઉપરનાં મેદને હુંમેશ માટે હટાવી શકે છે. ઉપરાંત સતત ચાલુ રાખેલો ઉકાળો પીવાની આ આદત ગમે તેવા ચરબીયુક્ત ખોરાક લેવા છતાં શરીર પર ચરબીને વધવા દેતી નથી.

## CANCER કેન્સર :

જપાન તેમજ ઓસ્ટ્રેલીયામાં તાજેતરમાં કરવામાં આવેલા એક નવા સંશોધનનું પરિણામ જણાવે છે કે પેટ તથા હાડકાનું એડવાન્સ કેન્સર રોકવામાં દર્દી પર કરવામાં આવેલા મધનાં પ્રયોગથી તેને અટકાવી શકવામાં સફળતા મળી છે. જેઓ આ પ્રકારનાં કેન્સરનાં રોગથી પીડાતા હતા તેવા દર્દીઓને દરરોજ મધ અને તજનાં પાવડરનું મિશ્રણ દિવસમાં ત્રણ વખત આપવામાં આવ્યું હતું. આ મિશ્રણ થકી તેઓનાં રોગમાં સામાન્ય દવા કરતાં ત્રણ ગણો ઝડપથી સુધારો થવા પાઢ્યો હતો.

આ દર્દીઓનું ધ્યાન રાખનાર ડૉક્ટર હીરોકી ઔવાટાનું કહેવાનું એ છે કે આ દર્દીઓને દરરોજ દિવસમાં ત્રણ વખત એક ચ્યામ્પો ભરીને મધ તથા તજનો ભૂકો બેગો કરી એક મહિના સુધી આપવાનું રાખ્યું હતું. જેનું ઉપર પ્રમાણે પરિણામ દેખાયું હતું. તે વધુમાં કહે છે કે કેન્સરનાં દર્દીઓને પ્રથમ પોતાના ડૉક્ટરની જ સલાહ માનવી જોઈએ પણ હું તેવા ડૉક્ટરની ભલામણ કરી શકું છું કે તેઓએ આ પ્રકારની સારવાર માટે કોઈ આનાકાની કરવી જોઈએ નહીં એટલા ઉત્સાહ જનક આ સારવારનાં પરિણામો છે.

## FATIGUE શરીરને થાક લાગવો :

હમણાં હમણાં કરવામાં આવેલ નવા સંશોધન પ્રમાણે ડૉક્ટરનું કહેવાનું થાય છે કે, મધમાં જે સાકરનું પ્રમાણ છે તે નુકશાન કરવાને બદલે શરીરની શક્તિ જાળવવામાં સહાયરૂપ થાય છે.

સપ્રમાણ રીતે લીધેલું મધ અને તજનો પાવડર નિયમિત લેવાથી મોટી ઉંમરનાં અર્થાત સિનિયર સીટીજનોની શરીરનો છ્રાસ થતો અટકે છે. તથા દરેક કાર્યમાં તેઓને સ્વૃત્તિ દેખાશે અને થાક નહીં લાગે.

આ વિષેનું જેઓએ સંશોધન કર્યું છે તે નિષ્ણાંત ડૉક્ટર મીલ્ટ્યન અભ્યોજાનાં અભિપ્રાય પ્રમાણે અર્ધા ચ્યામ્પા જેટલું મધ આઈ આંટસ પાણીમાં (એક જ્વાસ જેટલા પાણીમાં) મેળવી તેમાં તજનો હુકો નાખી દરરોજ સવારે ઉઠીને બ્રશ કર્યા બાદ બે કલાક લેવું. તેનાથી શરીરનો થાક ઓછો થાય છે.

## અન્ય ઉપયોગો

1. લુ લાગવી
  - (૧) કાંદાના રસના ટીપાં લુ લાગેલી વ્યક્તિના નાકમાં નાખવાથી આરામથાય છે.
  - (૨) કાચી કેરી પાણીમાં ઉકાળી સાકર મેળવી સરબત બનાવી પીવાથી આરામ થાય છે.
  - (૩) તુલસીના પાનનો રસ ખાંડ મેળવીને પીવાથી આરામ થાય છે.
  - (૪) કાંદો, જીરું અને ખાંડ વાટીને ખાવાથી આરામ મળે છે.
2. વૃષા રોગ
  - (૧) ધાણા પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી તે પાણીમાં મધ અને ખાંડ નાખી વારંવાર પીવાથી તૃષ્ણા રોગ ઉલટી શાંત થાય છે.
  - (૨) ખાંડને પાણીમાં ઓગાળી પીવાથી તૃષ્ણા રોગ શાંત થાય છે.
  - (૩) ટામેટાના રસમાં ખાંડ અને લવીંગનું ચૂર્ઝ મેળવી પીવાથી આરામ થાય છે.
3. બેહોશી
  - (૧) કાંદાની ચાર ચીરી કરીને બેહોશ માણસને સુંઘાડવાથી બેહોશી મટે છે.
  - (૨) હીસ્ટીરીયાની ફિટ વખતે કાંદો કાપીને સુંઘાડવાથી તરત ફાયદો થાય છે.
  - (૩) મરીનું ચૂર્ઝ આંખમાં આજવાથી માણસ બેહોશ થયો હોય તે ચેતનામાં આવે છે.
  - (૪) મરીનું ચૂર્ઝ નાકમાં હુકવાથી બેહોશી માણસને ઘણી છીકો આવે અને બેહોશી મટે છે.
  - (૫) કોઈ દર્દને કારણે દર્દીનું શરીર એકદમ ઠંડુ પડતું જાય કે નાડી રૂભતી જાય તો ૧૦૦ ગ્રામ પાણીમાં ૫ ગ્રામ

## તંદુરસ્તી તમારાં હાથમાં

- લવીંગનો ભૂકો નાખી ઉકાળી તે પાણીથી દર્દીના હાથપગના તળીયા, છાતી, માથું, ગરદન બધે સારી રીતે માલીશ કરવું. આખા શરીરમાં ગરમાટો આવી જશે અને મંદ નાડી તેજ થશે.
- ૪. જડાપણું**
- (૧) એક પાકા લીબુનો રસ અઢી તોલા મધ લઈ, વીસ તોલા સહેજ ગરમ પાણીમાં મેળવી જમ્યા બાદ તરતજ પીવાથી એક-બે મહિનામાં જડાપણું મટે છે.
  - (૨) તુલસીના પાનને દર્દી કે છાશમાં ખાવાથી વજન ઘટે છે. શરીરમાં ચરબી ઓછી થાય છે અને શરીર સપ્રમાણે બને છે.
  - (૩) સહેજ ગરમ પાણીમાં મધ મેળવી સવારે નયણે કોઠે પીવાથી ચરબી ઉત્તરે છે. જાડી જેવી વ્યક્તિ પણ આ પ્રયોગથી ઓગળી જાય છે.
- ૫. વજન વધારવા**
- (૧) નયણા કોઠે ખજુર સાથે દૂધ પીવાથી લોહી શુદ્ધ થાય છે અને વજન વધે છે.
  - (૨) કોથમીરનો તાજો રસ અને લીબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી લોહી શુદ્ધ બને છે અને વજન વધે છે.
  - (૩) રાત્રે ભેંસના દૂધમાં આખા ચણા પલાણી રાખી સવારે ખાવાથી શક્તિ અને વજન વધે છે.
  - (૪) ખજુર દસ તોલા અને દ્રાક્ષ પાંચ તોલા, દરરોજ ખાવાથી સુકલકરી શરીરમાં નવું લોહી રેદા થાય છે અને ખૂબ ફાયદો થાય છે.
- ૬. ઝેર**
- (૧) અર્ધો તોલા વાટેલી રાઈ અર્ધો તોલો મીઠું ગરમ પાણીમાં પીવાથી ઉલટી થઈ જેર બહાર નીકળી જાય છે.
  - (૨) એક થી પાંચ તોલા જેટલું મીઠું પાણીમાં મેળવીને પાવાથી તાત્કાલિક ઉલટી થઈ જેર બહાર નીકળી જાય છે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- (૩) ગાજરનો રસ પીવાથી શરીરમાં રહેલો પચ્ચા વગરનો કચરો, જેરી તત્વો અને નુકશાનકર્તા પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે.
  - (૪) કોઈપણ પ્રકારનું જેર પેટમાં ગયું હોય તો તુલસીનો રસ જેટલો પી શકાય તેટલો પીવાથી જેરનો દોષ નીકળી જશે.
- ૭. વાયુ**
- (૧) તુલસી, કુદીનો, મરી અને આદુનો ઉકાળો પીવાથી વાયુ મટે છે.
  - (૨) અજમો ગરમ કરી તેના સરખા ભાગે સિંધવ લઈ વાટી ભેગું કરી તેમાંથી ત્રણ માત્રા જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ મટે છે.
  - (૩) નાગરવેલના પાન અને સરગવાની છાલને એકત્ર કરી રસ કાઢી પીવાથી નળ કુલ્યા હોય તે મટે છે.
- ૮. તૂટેલું હાડકું**
- (૧) લસણની કળી ધીમાં સાંતળીને ખાવાથી તૂટેલું હાડકું સંધાય છે અને ફેક્ચરની પીડા મટે છે.
  - (૨) ઘઉને જરા શેકી પછી તેનો લોટ કરી મધ સાથે ચાટવાથી તૂટેલું હાડકું સંધાય છે.
- ૯. અલસર**
- (૧) ગાજરનો રસ પીવાથી અલસર મટે છે.
- ૧૦. અંડનો સોજો**
- (૧) કાંદાનું પડ સહેજ ગરમ કરી સુજેલા અંડ પર લગાડવાથી સોજો મટે છે.
  - (૨) ચણાના લોટને પાણીમાં રગડીને તેમાં મધ મેળવી અંડ પર લગાડવાથી સોજો મટે છે.
  - (૩) સિંધવનું ચુર્ણ ગાયના ધીમાં મેળવી પીવાથી સોજો મટે છે.
- ૧૧. પિત**
- (૧) યામેટાના સુપમાં સાકર મેળવીને પીવાથી પિત મટે છે.
  - (૨) શેરરીનો રસ પીવાથી પિત મટે છે.

## તંદુરસ્તી તમારાં હાથમાં

- ૧૨. રસોળી** (૧) રાઈ અને મરીના ચૂર્ઝને ધીમાં મેળવીને લેપ કરવાથી રસોળી મટે છે.
- ૧૩. બરોળ** (૧) ખજુરની ચાર-પાંચ પેશી રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે મસળી તેમાં મધ નાખી સાત દિવસ સુધી પીવાથી બરોળ મટે છે.
- ૧૪. તોતડાપણું** (૧) સુકા આમણાના ચૂર્ઝને ગાયના ધી સાથે મેળવીને ચાટવાથી તોતડાપણું મટે છે.
- ૧૫. બરો** (૧) તાવ ઉત્તર્યા પછી હોઠ પર બરો મુતરી ગયો હોય તો પાણીમાં જરૂ વાટીને ચોપડવાથી બરો મટે છે.
- ૧૬. યાદશક્તિ** (૧) સવારના સ્નાન કર્યા પછી તુલસીના પાંચ પાન પાણીની સાથે લેવાથી મગજની નિર્ભળતા દૂર થાય છે અને યાદશક્તિ વધે છે.
- ૧૭. થાક** (૧) લીંબુનું શરબત ખાંડ નાખીને પીવાથી થાક મટે છે.  
 (૨) ખૂબ મહેનતનું કામ કરવાથી કે વધુ ચાલવાથી થાક લાગે ત્યારે ઠંડા પાણીમાં ૨૦ ગ્રામ ગોળ ઓગાળી તેમાં એલચી દાણા વાટી પીવાથી થાક દૂર થશે અને શક્તિ આવે છે.  
 (૩) રાત્રે તાંબાના લોટામાં ભરી રાખેલું પાણી સવારે ઉઠી તરત પીવાથી દસ્ત સાફ આવે છે અને આરોગ્ય સારું રહે છે.
- ૧૮. વા** (૧) બે ચમચી આદુનો રસ, એક ચમચી લસણનો રસ, બે ચમચી મેથી ભાજુનો રસ મેળવી પીવાથી સાંધાનો વા મટે છે.
- ૧૯. અન્ય** (૧) મરીના બે-ત્રણ દાણા રોજ ખાવાથી કોઈપણ રોગ થતો નથી.

## તંદુરસ્તી તમારાં હાથમાં

### ગોમાતા રોગ-દોષનિવારિણી

- (૧) મંદ જઠરાંજિ** - આમાશયના વિકારોને કારણે પાચન સંબંધી રસ (અન્જાઈમ) ઓછો ઉત્પન્ન થાય છે. એનાથી ભૂખ ઓછી લાગે છે, આખો દિવસ અરુચિ, જીવ ગભરાવો, અપચો, વિષમ જવર, કબજિયાત કે અતિસારના રોગો જન્મે છે. આવા રોગીનો વાત અને પિત કુપિત થઈ જાય છે. આથી એ દિવસે દિવસે નબળો પડતો જાય છે અને જલદી ઘરડો થઈ જાય છે. શિયાળામાં દરરોજ તક અને ઉનાળામાં છાશનું સેવન કરવાથી આ રોગ હંમેશ માટે નષ્ટ થઈ જાય છે.
- (૨) ગ્રહણી** - ગ્રહણી કે સંગ્રહણી એક ભયંકર રોગ છે આ રોગમાં રોગીની પાચનશક્તિ નબળી પડી જાય છે, હંમેશા જાડા થાય છે. ક્યારેક મલાશયમાં પીડા થવાને લીધે મલાશયબ્રંશ (કંચ નીકળવું) પણ થઈ જાય છે. કુશળ વૈદ્યોનું માનવું છે કે તકના પ્રયોગથી સંગ્રહણી રોગ મટી જાય છે.
- (૩) અજીર્ણીકે અપચો** - આ સામાન્ય અને સૌને થતો રોગ છે. ગાયના તકમાં ચપટી જરૂ, ૧૦ ગ્રામ મરી, ૧૦-૧૨ ગ્રામ લાહોરી મીઠું નાખી એક ઘૂંઠડો સિસકારો બોલાવતા પીવો. મઠો ફક્ત દિવસે જ પીવો જોઈએ. બપોર પછી મઠો પીવો વર્જિંત છે.
- (૪) આંખોમાં બળતરા** - ધૂળ, ધૂમાડા અને ગરમીથી આંખો લાલ થઈ જાય છે. દહીની મલાઈ કે માખણ આંખો ઉપર ચોપડી સૂઈ જવું. પોપચા ઉપર આ લેપ કરવાથી બળતરા શાંત થઈ જાય છે. મઠો પીનારની આંખો સદા નીરોગી રહે છે.
- (૫) આંતરડગમાં કૂમિ** - આજકાલની આ સામાન્ય બીમારી છે. કૂમિનાશ કરવા માટે એક દિવસ પહેલાં મીઠો મઠો પીવો. એનાથી આંતરડગના બધા કૂમિ એક જગ્યાએ ભેગા થઈ જશે. બીજા દિવસે એ જ સમયે મઠામાં મીઠું નાખીને પીવાથી કૂમિ મરી જાય છે. કૂમિને માટે આના જેવી સરળ, સુલભ, સ્વાદિષ્ટ અને ગુણકારી કોઈ ઔષધિ નથી.
- (૬) ઉપદંશ કે ચાંદી** - મીઠા દહીનો મઠો અને અરીઠાંની છાલનું ચૂર્ઝ લેવાથી એક અઠવાડિયામાં આ રોગ મટી જાય છે. અરીઠાંની છાલ સૂકવી, વાટી, પાણી નાખી ચાણા જેવડી ગોળી બનાવી લેવી. દરરોજ એક ગોળી એક બે જલાસ મઠા સાથે લેવી.

- (૭) એજિઝ્મા કે છાજન - લીમડાના પાન (કુંપળો) છાશમાં વાટીને એજિઝ્માગ્રસ્ત ભાગ પર દિવસમાં બેત્રાણ વાર લેપ કરવો. તાજું દહી કે મઠો પીવો. એમાં મીહું કે ખાંડ ન નાખવી.
- (૮) કબજિયાત - મઠો પીનારને કબજિયાત થતી જ નથી કબજિયાત હોય તો બે ચૃપટી અજમાનો ભૂકો મીહું નાખીને સેવન કરો તો પણ કબજિયાતમાં લાભ થાય છે.
- (૯) ચહેરાની કરચલીઓ - કાંતિયુક્ત ચહેરાની ઈચ્છા કોને ન હોય ? એ માટે બજારમાં પુષ્કળ પ્રમાણમાં જાતજાતના લોશન, સાબુ અને તેલોની બનાવટો મળે છે. એની કિંમત પણ સામાન્ય માણસના ગજ બહારની હોય છે. ક્યારેક લોશન કે સાબુ અનુકૂળ નથી આવતા અથવા એલજી કરે છે તો એ માટે વળી બીજા ઉપાયો કરવા પડે છે.
- કરચલીવાળા ચહેરા પર ગાયનો એક દિવસનો વાસી મઠો સવારે સ્નાન પહેલા લગાવી હળવે હાથે માલિશ કરો અને દશ મિનિટ પછી સ્નાન કરી લો. થોડા જ દિવસોમાં ચહેરાની કરચલીઓ દૂર થઈ જશે અને ચહેરો કાંતિયુક્ત બની જશે.
- (૧૦) દાદર - લીમડાના પાંચ પાન, અઢી ગ્રામ હળદર, પાંચ કાળા મરી, એક નાની પીપર છાશમાં વાટીને દાદર પર લેપ કરવો. થોડા જ દિવસોમાં દાદર ગાયબ થશે.
- (૧૧) તકારિષ્ટ - અજમો, આમળાં ને મરી દરેક ૧૨-૧૨ તોલા, પાંચેય પ્રકારનું મીહું ૪-૪ તોલા લઈને એ બધાનું ચૂર્ણ બનાવી માટીના એક ઘડામાં ભરવું. એના ઉપર ૬ શેર, ૬ છટાંક, ૨ તોલા મઠો નાખવો. ઘડાનું મોં બંધ કરીને એક મહિના સુધી રહેવા દેવું. ત્યારબાદ ગાળીને શીશીઓમાં ભરી લેવું. પાચનશક્તિ મંદ પડે ત્યારે, અપચો, સોજા, ગુલમ અર્શ, ફૂભિ, પ્રમેહ, અતિસાર અને પેટના રોગોમાં આ ખૂબ લાભકારી છે. પાણીમાં આ ખોરાક દોઢથી અઢી તોલા મેળવી દરરોજ સવાર સાંજ લેવો.
- પદ્ધતિ - જે મઠામાંથી બધું ધી કાઢી લેવામાં આવે એ મઠાને જ તક કહેવાય છે. એ અત્યંત હળવો, સુપાણ્ય, ગુણકારી હોવાથી બધા માટે પદ્ધતિ એટલે કે સેવન યોગ્ય છે. જેમાંથી થોડું જ ધી કાઢવું હોય એવો મઠો થોડો ભારે, પુષ્કિકારક અને કફ્ફારક છે. જેમાંથી બિલકુલ ધી કાઢવામાં ન આવ્યું હોય

એવો મઠો અત્યંત બળવાન શરીર અને પ્રબળ પાચનશક્તિ તથા વ્યાયામ કે વધુ પરિશ્રમ કરવાવાળા લોકો જ પચાવી શકે છે. અપથ - રાત્રે દહીં કે મઠો ન ખાવો જોઈએ. ધી, ખાંડ, મગની દાળ, મધ કે આમળાં મેળવ્યા વિના દહીં નખાવું. કંઈ ન મળે તો પાણી મેળવીને જ ખાવું. દહીં ગરમ કરીને ન ખાવું.

## **શરીર સ્વાસ્થ્ય**

### **અત્યંત ગુણકારી કોળું**

બધા શાકોમાં સૌથી વધુવજનદાર શાક કોળું છે. કોળામાં કુદરતી મીઠાશ ઘણી હોય છે. આથી એના શાકમાં ઉપરથી ગળપણ નાખવાની જરૂર પડતી નથી. ચોમાસાની ઋતુમાં એકવાર કોળું કાપી નાખ્યા પછી વધારે સમય રાખી મુકવાથી એના પર ફૂગ વળી જાય છે. માટે એ ઋતુમાં તાજું કોળું જ લેવું. સારું પાકેલું અને જૂનું કોળું ખાવામાં ગુણકારી ગણાય છે.

**ગુણધર્મો :** પીળું કે લાલ કોળું આયુર્વેદ વિજ્ઞાન મુજબ ગુણમાં ઠંડુ, રૂચિકર્તા, સ્વાદે મધુર, બળવર્ધક, પૌષ્ટિક અને વીર્યવર્ધક હોય છે. કોળું પચવામાં ભારે, પિત અને દોષનાશક, કફકર્તા, વાયુકર્તા, શ્રમશક્તિ વર્ધક તથા ઉત્તમ પિતશામક (ગરમીશામક) છે. કોળું પ્રમેહ, મૂત્રાલ્પતા, મૂત્ર ધીરે ધીરે તરવાની તકલીફ, તૃષ્ણા, રક્તવિકાર, શ્રમ, ઉન્માદ, ભાંચિ, માનસિક રોગો (ગાંડપણ), હૃદયરોગ, રક્તપિત (રક્તસ્ત્રાવ) અને ફેફસાંના રોગો મટાડે છે. આ ગુણ પરિપક્વ કોળાના છે.

કોળાનાં બીજ વિષનાશક તથા પેટના કૂમિનાશક છે. એનાં બીજનો ગર (મીજ) બદામ જેવો શક્તિદાયક છે. આ બીજમાંથી તેલ નીકળે છે. આ તેલ મગજની રૂક્ષતા દૂર કરે છે, મગજને તર કરી નિદ્રા લાવે છે. શરીર પર કોળાના બીજના તેલની માલિશ કરવાથી શરીરમાં રહૂર્તિ આવે છે.

**જીવજંતુના** તથા અન્ય જેરની અસર નાખૂં કરવાનો પ્રબળ ગુણ કોળાના રસમાં રહેલ છે. એના રના સેવનથી અમ્લપિત (એસીડીટી) મટે છે તેમજ એનો રસ મૂત્રલ તથા મૂત્રપિંડ માટે સૌખ્ય ઉત્તેજક છે. શરીરનો સોજો, પથરી તથા મધુપ્રમેહમાં પણ એ લાભ કરે છે.

આધુનિક વિજ્ઞાન મુજબ કોળું વિટામીન એ ની સમૃદ્ધિની બાબતમાં ગાજર પદ્ધી બીજે નંબરે આવે છે. નબળી આંખો કે નબળી દ્રષ્ટિવાળા બધા ચ્યામાંધારીઓ માટે કોળાનું શાક ખાવું ખરેખર ઉત્તમ છે. આધુનિક દ્રષ્ટિએ કોળું શીતળ અને મૂત્ર લાવનારું છે. એનાથી રક્તવાહિનીઓનો સંકોચ થાય છે અને જો તે વધુ માત્રામાં લેવાય તો જાડા સાફ લાવે છે, તેમજ શાંત અને ગાઢ નિક્રા પણ લાવે છે. ગાંડપણના રોગમાં જ્યારે રોગીની આંખો લાલઘૂમ થઈ ગઈ હોય, નાડીની ગતિ ખૂબ ઝડપી થઈ હોય તથા રોગી ખૂબ ઉત્સર્જિત, કોધી કે આવેશમય થઈ ગયો હોય ત્યારે કોળાનો રસ ૧૦૦ થી ૨૦૦ મિ.લી. પીવડાવવાથી એ શાંત થઈ જાય છે અને ઉંઘ આવી જાય છે. ફેફસામાંથી કે શરીરના કોઈ પણ માર્ગથી રક્તસ્ત્રાવ થતો હોય ત્યારે કોળાનો રસ ખરેખર ખૂબ લાભ કરે છે. ટી.બી. (ક્ષય) ની પ્રથમ અવસ્થામાં તાજા કોળાનો રસ નિયમિત પીવડાવવાથી લાભ થાય છે.

## **કોળાનો ઔષધ પ્રયોગ**

(૧) દાઝવા પર : દાઝવાથી થયેલ સોજા, બળતરા તથા જખમ પર કોળાનો ગર્ભ પોટીસની જેમ લગાડવાથી લાભ થાય છે.

(૨) અંદરનો દાહ : કોળાનો રસ કાઢીને એમાં સાકર નાખીને પીવાથી અંદરનો દાહ, બળતરા શરે છે.

(૩) મગજની ગરમી : ગાંડપણ - કોળાના નાના નાના ટુકડા કરી, વરાળમાં બાફીને એમાં સાકર મેળવી દેવી. પદ્ધી એના ઉપર આમલીનો સરકો નાખી મિશ્રણ કરવું. ત્યારબાદ કપડા વડે ગાળીને રોગીને આપવાથી મગજની ગરમી, માથાનો દુખાવો તથા ઉન્માદમાં લાભ થાય છે.

(૪) પેટનાં કરમિયાં : પેટમાં કરમિયાં થયાં હોય તો કોળાના ૧૦ થી ૨૦ ગ્રામ બીજમાં સાકર કે ગોળ મેળવીને રાત્રે સૂતી વખતે બીજ ખાવાં. સવારે એરંડિયું પીવાથી કરમિયાં બહાર આવી જાય છે.

(૫) પરમિયો (મૂત્રરોગ) : કોળાનાં એક બે ગ્રામ બીજનું ચૂર્ણ કરીને એમાં સાકર કે મધ મેળવીને સવાર-સાંજ ખાવું.

(૬) રક્તસ્ત્રાવ (રક્તપિતા) : શરીરમાંથી કોઈપણ માર્ગથી રક્તસ્ત્રાવ થતો હોય તો કોળાના રસમાં સાકર મેળવીને કે એના રસનું શરબત બનાવીને પીવાથી લાભ થાય છે.

(૭) એરી જંતુનો ઊંખ : કાનખજૂરા, મંકોડા, મધમાખી, વીંઠી જેવાં એરી જંતુઓના ઊંખ ઉપર કોળાનું ગીંઠુ કાપીને એને પાણી સાથે ઘસી ઊંખ ઉપર એનો લેપ કરવાથી લાભ થાય છે.

(૮) શાસ (દમ) : કોળાના મૂળનું ચૂર્ણ ત ભાગ, સૂર્ધચૂર્ણ ૧ ભાગ મેળવીને એમાંથી પ ગ્રામ ચૂર્ણ પાણી કે મધ સાથે લેવાથી શાસની બિમારીમાં લાભ થાય છે.

(૯) નબળાઈ - કોળાનાં બીજના ગરનું ચૂર્ણ ધી માં સેકી એમાં દળેલી સાકર મેળવીને લાદુ કે પાક બનાવીને રોજ ખાવાથી વધુ મહેનત કે પરિશ્રમથી આવેલી નબળાઈ દૂર થાય છે.

(૧૦) અસ્થિપિત (એક્સિસ્ટેરી) : કોળાના ૫૦ થી ૧૦૦ મિ.લી. રસમાં ૧ ચમચી સાકર નાખીને સવાર-સાંજ પીવો. ભોજનમાં ખાદું, ગળ્યું, તીખું અને તળેલું ન ખાવું. આથી અસ્થિપિત મટે છે.

(૧૧) પથરી : કોળાના ૩૦ થી ૫૦ મિ.લી. રસમાં થોડી છિંગ અને જવકાર મેળવીને પીવાથી પથરી નાશ પામે છે.

વિશેષ : આયુર્વેદમાં ભૂરા કોળામાંથી ખંડ કુખ્ખાંડ અવલેહ, પાક તથા અર્ક કુખ્ખાંડ બને છે. ખંડ કુખ્ખાંડ અવલેહ ક્ષય, રક્તપિત (રક્તસ્ત્રાવ), હદ્યરોગ, વાઈ, ફેફસાનાં રોગમાં તથા ગાંડપણ વગેરે માનસિક રોગમાં વૈઘ્યો વાપરે છે.

આમ કોળું એક ઉત્તમ શાક અને ઉત્તમ ઔષધ છે.

સાવધાની : વાયુ તથા કફ પ્રકૃતિવાળા માટે વધારે પ્રમાણમાં કોળાનું સેવન સારું નથી. ખૂબજ કાચું, અપકર કે કોમળ(લીલું) કોળું વિષ સમાન છે. આથી એનું સેવન ન કરવું.

## **વિવિધ રોગોથી બચાવ**

(૧) માથાના રોગો : સ્નાન કરતા પહેલાં હંમેશાં પાચ મિનિટ સુધી માથાના મધ્યમાં તાજવા પર કોઈ શ્રેષ્ઠ તેલ (કોપેરેલ સરસિયું, તલનું તેલ, બ્રાહ્મી, આમળાં, ભૂંગરાજ) થી માલિશ કરવી. એનાથી સ્મરણશક્તિ અને બુદ્ધિનો વિકાસ થાય છે. વાળ કાળા, ચ્યમકદાર અને મુલાયમ થાય છે.

વિશેષ : રાત્રે સૂતાં પહેલાં કાન પાછળની નસો પર તથા માથાના પાછળા ભાગ પર છથવે હાથે તેલની માલિશ કરવાથી ચિંતા, માનસિક તાણ અને માનસિક પરેશાનીના કારણે માથાના પાછળના ભાગમાં અને ડેકમાં થતો દુખાવો તથા

ભારેપણું મટે છે.

(૨) નેત્રવિકાર : સવારે દાંત સાફ કરી મોંમાં પાણી ભરી મોં કુલાવી દેવું. ત્યારબાદ આંખોમાં ઠંડા પાણીની ચાલકો મારવી. દરરોજ દિવસમાં ત્રણવાર સવાર-બપોર-સાંજ આ પ્રમાણે કરવાથી આંખોમાં તાજગી અનુભવાય છે. કોઈપણ પ્રકારનો નેત્રવિકાર થતો નથી. કેટલાક મહિનાના અભ્યાસથી ચેમાં ઉત્તરી શકે છે. લાભ તો એક મહિનામાં જ જણાવા લાગે છે.

**વિશેષ :** (અ) ધ્યાન રાખવું કે મોનું પાણી ગરમ ન થઈ જાય. ગરમ થતાં પાણી બદલી લેવું.

(બ) મોંમાથી પાણી બહાર કાઢતી વખતે મોં કુલાવી પૂર્ણ વેગે પાણી બહાર ફેંકવાથી લાભ વધું થાય છે. આંખોની આસપાસ કરચલીઓ પડતી નથી.

(ક) પાણી એકદમ ઠંડું ન હોવું જોઈએ.

(૩) સવારે મોંમા બરાબર પાણી ભરીને ત્રિફળાજળથી આંખો પર છાલકો મારવાથી નેત્રજ્યોતિ મંદ થતી નથી. ત્રિફળા જળ બનાવવા માટે સાંજે ૨ ગ્રામ ત્રિફળા ૧૦૦ ગ્રામ પાણીમાં માટી કે કાચના વાસણાં પલાણી દેવું. સવારે એ પાણીને નિતારી જીણા સ્વચ્છ કપડાથી ગાળી લેવું. એ જળથી દરરોજ આંખો ધોવી. આથી આંખોના બધા વિકારો મટે છે અને આંખોની જ્યોતિ વધે છે.

**વિકલ્પ :** દરરોજ સવારે જલનેતિ કરવી.

**સહાયક ઉપયોગ :** પગનાં તળિયાં અને આંગળિઓ પર સરસવના તેલની માલિશ કરવાથી આંખોની જ્યોતિ વધે છે. સૌ ગ્રામ પગના અંગૂઠાઓને તેલથી તરબોળ કરી માલિશ કરવી જોઈએ. આથી કોઈ પણ પ્રકારનો નેત્રરોગ થતો નથી. આંખોનું તેજ વધે છે. એ ઉપરાંત, પગનું ખરબયડાપણું, રૂષતા તથા પગનો સોજો જલદી દૂર થાય છે. પગમાં કોમળતા તથા બળ આવે છે. રવિવારે માલિશ કરવાથી તાપ પેદા થાય છે. મંગળવારે માલિશ ન કરવી.

(૪) કાનના રોગો : અઠવાડિયામાં એકવાર ભોજન કરતાં પહેલાં કાનમાં નવશેકા ગરમ સરસિયા તેલનાં બે ચાર ટીપાં નાખી ભોજન કરવું. આથી કાનમાં ક્યારેય તકલીફ નહિ થાય. કાનમાં તેલ નાખવાથી અંદરનો મેલ પીગળીને બહાર આવી જાય છે. અઠવાડિયામાં કે પંદર દિવસમાં એકવાર આમ કરવાથી બહેરાપણાનો ભય રહેતો નથી અને દાંત પણ મજબૂત બને છે.

**વિશેષ :** (અ) ૨૫ ગ્રામ સરસિયાના તેલમાં લસણની બે કળી ઝોલીને

નાંખવી. પછી તેલ નવશેકું ગરમ કરી ગાળી લો. આ તેલ અઠવાડિયામાં એકવાર કાનમાં નાખવામાં આવે તો શ્રવણશક્તિ વધે છે. કાન નીરોગ રહે છે. આ લસણવાળા તેલને થોડું ગરમ કરીને કાનમાં નાખવાથી ખુશી પણ દૂર થાય છે અને નાનો મોટો ઘા પણ રૂજાઈ જાય છે.

(૬) કાન કે નાકમાં આંગળી કે તશખલું નાખવાથી એમાં જખમ થવાનો કે ચેપ લાગવાનો ભય રહે છે. આથી એમ ન કરવું.

(૪) નજલો-સણેખમ : દરરોજ રાત્રે સરસિયું તેલ કે ગાયનું ધી નવશેકું ગરમ કરી નાક વડે એક બે ટીપાં સુંધતા રહેવાથી નજલો-સણેખમ ક્યારેય થતાં નથી. મગજને પણ પુષ્ટિ મળે છે.

(૫) દાંત, જીબ અને મોંના રોગો : સવારે કડવા લીમડાનાં બે ચાર કુમળાં પાન છાવીને થૂંકી દેવાથી દાંત, જીબ અને મોં. એકદમ સાફ અને નીરોગ રહે છે. કડવા લીમડાનાં પાનમાં કલોરોફિલ હોય છે.

**વિશેષ :** લીમડાનું દાતણ યોગ્ય રીતે કરનારના દાંત મજબૂત રહે છે. દાંતમાં જીવ પડતા નથી અને પીડા પણ થતી નથી. મોં ના રોગોથી બચાવ થાય છે. બાર વર્ષ સુધી દરરોજ લીમડાનું દાતણ કરવાથી મોંમાથી ચંદનની સુગંધ આવે છે.

(૬) મોંના રોગો : મોંમા થોડીવાર સુધી સરસિયું તેલ ભરી રાખી કોગળો કરવાથી જડબુનું મજબૂત બને છે. અવાજ ખુલેલો અને ગંભીર થાય છે. ચહેરો પુષ્ટ બને છે. છાયે રસોમાંથી દરેક રસનો અનુભવ કરવાથી શક્તિ વધી જાય છે. આ કિયા કરવાથી ગળું સુકાતું નથી. હોઠ પણ ફાટતા નથી. દાંત પણ તૂટતા નથી કરાણકે દાંતનાં મૂળ મજબૂત થઈ જાય છે. દાંતમાં પીડા પણ થતી નથી.

(૭) શરદીના કારણો ઉત્પન્ન થતા રોગો તથા ગળા થસનતંત્રના રોગો : જે વ્યક્તિ દરરોજ સવારે નયણે કોઠે તુલસીના ચારપાંચ પાન ચાવીને પાણી પીએ છે એ અનેક રોગોથી સુરક્ષિત રહે છે. સામાન્ય રોગ આપમેળે જ દૂર થઈ જાય છે. શરદીના કારણો થતી બીમારીમાં વિશેષ રૂપે સણેખમ, ખાંસી, બ્રોન્કાઈટિસ, ન્યૂમોનિયા, ઈન્ફ્લુએન્ઝા તથા ગળા, શાસનળી અને ફેફસાંના રોગોમાં તુલસીનું સેવન ઉપયોગી છે.

(૮) શાસરોગ (દમ) : શાસ બદલવાની પદ્ધતિથી, જમણા સ્વરના વધારે અભ્યાસથી તથા જમણા સ્વરમાં જ પ્રાણાયામના અભ્યાસથી શાસરોગ-દમનું

નિયંત્રણ કરી શકાય છે.

ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાથી દમ, ક્ષય વગેરે રોગો થતા નથી. જૂનામાં જૂનો નજલો-સળોખમ પણ આ પ્રાણાયામથી મટી જાય છે. નાક અને છાતીના રોગો થતા નથી.

(૮) હદ્ય તથા મગજના રોગો : દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવાથી હદ્ય તથા મગજના રોગો થાય છે. આથી દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવું ન જોઈએ.

**વિશેષ :** દરરોજ સવારે ચાર પાંચ કિલોમીટર ઝડપથી ચાલનારા (કરનારા) લોકોને હદ્યનો રોગ થતો નથી.

(૯) પેટનું કેન્સર : (અ) દરરોજ ભોજન કરી અડધા કલાક પછી લસણની એકાદ બે કળી કાચીજ છોલીને ખાવી જવી. આમ કરવાથી પેટનું કેન્સર થતું નથી. કેન્સર હોય તો દરરોજ ભોજન કર્યા પછી લસણની એક બે કળી વાટીને પાણીમાં મેળવીને આવશ્યકતા અનુસાર સતત એક બે મહિના સુધી લેવાથી પેટનું કેન્સર મટે છે.

(બ) માનસિક તાણથી મુક્ત રહો અને કેન્સરથી બચો. નવી શોધ અનુસાર કેન્સરનું મુખ્ય કારણ માનસિક તાણ છે. શરીરના કયા ભાગમાં કેન્સર થશે એ માનસિક તાણના સ્વરૂપ પર નિર્ભર છે.

(ક) જો કેન્સરથી પીડિત વ્યક્તિ દાડમના દાઢાનું સેવન કરતો રહે તો એનું આયુષ્ય ૧૦ વર્ષ સુધી વધી શકે છે. કેન્સરના રોગીએ રોટલી વગેરે ન ખાતાં માત્ર ભાવ જોઈએ.

(૧૧) પેટની બિમારી : (અ) દરરોજ તુલસીનાં ચાર પાન ચાવીને ખાવાથી કે વાટીને ગોળી બનાવી પાણીના ઘૂંઠા સાથે ગળી જવાથી પેટની બિમારીઓ થતી નથી.

(બ) ભોજન ખૂબ ચાવીને કરવું. એક કોળીયો બત્તીસવાર ચાવવો જોઈએ. ખૂબ કરતાં થોડું ઓદ્ધું તેમ જ નિશ્ચિત સમયે ખાવાથી અપચો, આફરો વગેરે ઉદ્દરબ્યાધિઓથી વ્યક્તિ બચી શકે છે. ઉપરાંત પાચનક્રિયા સારી રીતે થાય છે.

(૧૨) પિતાવિકાર, મસા(અશ) અને પેટના કૃમિ : અઠવાડિયામાં એકવાર કારેલાનું શાક ખાવાથી દરેક પ્રકારના તાવ, પિતાવિકાર, બાળકોના લીલા પીળા

અણા, મસા, પેટના કૃમિ તથા મૂત્રરોગોથી બચાવ થાય છે.

(૧૩) મૂત્રપિંડની બીમારી : ભોજન કર્યા પછી તરત મૂત્રત્યાગ કરવાથી મૂત્રપિંડ (ક્રિડની), કમર અને યકૃતના રોગો થતા નથી. ગઠિયો વા વગેરે અનેક બીમારીઓથી પણ બચી શકાય છે.

(૧૪) વાતરોગો : જે લોકો દરરોજ માલિશ કરે છે એમને વાયુના રોગો થતા નથી. એમનું શરીર થાક અને ઘા સહન કરવામાં સમર્થ થઈ જાય છે. મહિનામાં ઓછામાં ઓછી ચારવાર તેલમાલિશ કરવી જ જોઈએ.

(૧૫) ગૂમડાં, ફોલ્ટ્વીઓ અને ચમરોગો : ચૈત્ર માસમાં અર્થાત માર્ચ-એપ્રિલમાં જ્યારે લીમડાની નવી નવી કુંપળો ફૂટે છે ત્યારે એકવીસ દિવસ સુધી દરરોજ દાતણ, કોગળા કર્યા પછી તાજી પંદર કુપળો (બાળકો માટે સાત કુંપળો) ચાવી ચાવીને ખાવાથી કે ગોળી બનાવીને પાણી સાથે ગળી જવાથી કે વાટીને પી જવાથી વર્ષભર ગૂમડાં, ફોલ્ટ્વીઓ થતી નથી.

**વિશેષ :** નયાણાં કોઠે કુંપળોનું સેવન કરવું. ત્યારબાદ ઓછામાં ઓછા બે કલાક સુધી કંઈ જ ન ખાવું.

(અ) આનાથી લોહીની ઘણી બધી ખરાબીઓ, ખુજલી વગેરે ચમરોગ તથા પિત અને કફના રોગો મૂળમાંથી નષ્ટ થાય છે.

(બ) આનાથી મધુપ્રમેહ (ડાયાબિટીઝ) ના રોગથી બચાવ થાય છે.

(ક) આનાથી મલેરિયા અને વિષમજવરની સંભાવના પણ ઓછી રહે છે.

**સાવધાનીઓ :** ધ્યાનમાં રાખવું કે એકવીસ કુંપળો અથવા સાત પાન કરતાં વધારે તથા સતત લાંબા સમય સુધી ન ખાવાં, નહિં તો યૌવનશક્તિ નબળી પે છે, વાતવિકાર વધે છે. તેલ, મરસું, ખટાશ અને તળેલી વસ્તુઓની પરેજી પાળવી.

(૧૬) મલેરિયા : મલેરિયાની મોસમમાં દરરોજ સવારે તુલસીનાં ચાર પાન તથા ચાર મરી વાટીને ગોળી બનાવી પાણી સાથે ગળી જવાથી કે એમ જ ચાવી જવાથી મલેરિયાથી બચી શકાય છે. મલેરિયામાં એ ક્વિનાઈનનું કામ કરે છે. એનાથી તાવનો ભય પણ રહેતો નથી.

(૧૭) કોલેરા : એક લીંબુ એક જ્વાસ પાણીમાં નીચોવી, એક ચમચી સાકર મેળવી શિકંજી બનાવીને દરરોજ સવારે પીવી. કોલેરાથી બચવાનો આ અતિ ઉત્તમ પ્રયોગ છે. એટલું જ નહિં, પ્રારંભિક અવસ્થામાં એનો એકાદ બે વારના

સેવનથી જ રોગ શાંત થઈ જાય છે.

**વિશેષ :** (અ) કપૂર પોતાની સાથે રાખવાથી કોલેરાની અસર થતી નથી.

(બ) લીંબુની શિક્ક પીવાથી પિતા વમન, તરસ અને દાહમાં રાહત થાય છે.

(ક) જે લોકો દૂધ પચાવી શકતા નથી એમને પોતાની પાચનશક્તિ સારી કરવા માટે કેટલાક દિવસ સુધી લીંબુની શિક્ક પીવી જોઈએ.

(દ) ભોજન કર્યા પછી લીંબુના રસનું સેવન કરવાથી ભયંકર અને ચેપી રોગોથી બચાવ થાય છે.

(૧૮) ટાઈફોઇડ ડેવા ચેપી રોગો : એક ચપટી (અડધાથી એક ગ્રામ) તજ બે ચમચી મધ્યમાં મેળવીને દિવસમાં બેવાર ચાટવાથી મોતીજરો-ટાઈફોઇડ જેવા ચેપી રોગોથી બચી શકાય છે.

(૧૯) શીતળા : લીમડાની સાત કુંપળો અને સાત મરી એક મહીના સુધી દરરોજ સવારે નયણા કોઠે લેવામાં આવે તો શીતળા જેવો ભયંકર રોગ એક વર્ષ સુધી થતો નથી. પંદર દિવસ આ પ્રયોગ કરવાથી છ મહિના સુધી શીતળાનો રોગ થતો નથી. શીતળાનો રોગચાળો ફાટ્યો હોય ત્યારે જે લોકો લીમડાનાં પાનનું સેવન કોઈ પણ પ્રકારે કરે છે એમને શીતળા જેવા ભયંકર રોગથી પીડિત થવું પડતું નથી.

(૨૦) લૂ : ઉનાળામાં એક કુંગળી (ઉપરનું સૂક્ખેલું ફોતરું કાઢીને) પોતાના જિસ્સામાં રાખવા માત્રથી લૂ લાગતી નથી.

ઘેરથી બહાર જતી વખતે ખૂબ પાણી કે છાસ પીને નીકળવાથી લૂ લાગતી નથી.

(૨૧) દૂષિત જળ : દૂષિત જળમાં તુલસીનાં લીલાં પાન (ચાર લીટર પાણીમાં ૫૦-૬૦ પાન) નાખવાથી પાણી શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે. પાણીને કપડા વડે ગાળતી વખતે તુલસીનાં પાન કપડામાં રાખીને પાણી ગાળી લેવું.

**વિશેષ -** તુલસીનાં પાનમાં ખાદ્ય વસ્તુઓને વિકૃત થતી બચાવવાનો અદ્ભૂત ગુણ છે. સૂર્ય-ચંદ્રગ્રહણ વગેરે સમયે જ્યારે ખાવાનું નિષેદ્ધ હોય છે ત્યારે ખાદ્ય વસ્તુઓમાં તુલસીનાં પાન નાખવાથી એમ માનવામાં આવે છે કે એ ખાદ્ય વસ્તુઓ વિકૃત થતી નથી.

## ॥ જય મહારાજ ॥